

વર્ષ-૪, અંક-૪  
ઓકટોબર - ડિસેમ્બર, ૨૦૧૦  
કિંમત : રૂ. ૨૦/-

# વિહંગ

પક્ષીનિરીક્ષકો વર્ચ્યેનો સેતુ



શરૂઆદ ૨૦૧૦



कालीओड पीणक (Black-naped Oriole) (पृष्ठ-३७)



लालपग तुळनी (Amur Falcon) (पृष्ठ-१९)

ગ્રામીણ પદ્ધતિ : રાણીના વિકાસ : માનવ



વધુ રંગકષોવાળું તેતર (Melanotic Grey Francolin) (पृष्ठ-२७)

ગ્રામીણ પદ્ધતિ : રાણીના વિકાસ : માનવ



બેકાલ કસ્તૂરો (Eye-browed Thrush) (पृष्ठ-३२)

ગ્રામીણ પદ્ધતિ : રાણીના વિકાસ : માનવ



નદીમીપુંछ માખીમાર (Rusty-tailed Flycatcher) (पृष्ठ-३८)

ગ્રામીણ પદ્ધતિ : રાણીના વિકાસ : માનવ



કાળરો રાજલાલ (White-bellied Minivet) (पृष्ठ-१८)

ગ્રામીણ પદ્ધતિ : રાણીના વિકાસ : માનવ

## સૂચિ



માણ્યું ગેનું સ્મરણ-૬	૬
વિહંગાવલોકન	૬
નિરીક્ષણ નોંધ	૧૪
કચ્છની પ્રવાસ-ગાથા	૪૫
ગીય પર જાપણો	૪૮
પ્રવૃત્તિવૃત	૪૯
ભારતના પુષ્પવિહંગો ગથા વિહંગ-પુષ્પો (૬)	૫૩
પમસેણુ	૫૮
યાયાવર-દર્શન કાચકમ	૬૩
સંચય	૬૫
પંખી પંચાંગ	૬૬
<b>મુખ્યપૃષ્ઠ : ખડ કુટ્ટી (Bristled Grass-Warbler)</b>	
નિરીક્ષણ નોંધ પાન નં. ૩૦	
તસવીર : અર્પિત દેવમુખારી, જામનગર	



## વિહંગા


નિરીક્ષણ

RNI Reg. No. GUJ/GUJ/2007/  
20874 dt. 21-8-07

વર્ષ ૪ અંક ૪ શરદ ૨૦૧૦

પરામર્શક	સંપાદક
લાલટીંહ રાઓલ	ડૉ. બંકુલ નિરીક્ષણ
<b>સંપાદક મંડળ :</b>	
ડૉ. પીયુષ પટેલ, અંગોક મશરૂ, ડૉ. મૌવિક વડુ	
મુખ્યપૃષ્ઠ સંજાવટ : 'પગમાર્ક ક્ષુદ્રાયુલસ કોન્સોર્ટિયમ'	
ચિત્રકણ : ડૉ. બંકુલ નિરીક્ષણ	
પત્રવ્યવહાર : ૧૮/૧૪, સત્યાગ્રહ શાખાની, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫ vihanggujarat@gmail.com	
લવાજમ : વાર્ષિક રૂ. ૧૦૦	
આજીવન રૂ. ૧૫૦૦	
(શુભેચ્છા ક્ષણો આવકાર્ય - 'વિહંગ રીસર્ચ ક્ષાઉન્ડેશન')	
- 'Vihang Research Foundation'ના નામે ડાફ્ટ અથવા મ.ઓ.થી, બહારગામના ચેકમાં રૂ. ૨૫/- ઉમેરવા. આ સંસ્થાને મળેલાં ધાર આવકરેચા ધારાની કલમ ૮૦૦ હેઠળ કરમુક્સિતને પાત્ર છે.)	
આ અંકમાં રજૂ થતા વિચારો સાથે સંપાદક મંડળ સહમત હોય તે જરૂરી નથી.	

## સંપાદકીય



વિવેક એવો ગુણ છે જે આપણને અન્યોની કદર કરતાં શીખવે છે. પર્યાવરણ-પ્રેમીમાં તો આ લક્ષણ સવિશેષ વિકસિત હોવું જોઈએ. તો જ આપણે સૃષ્ટિનાં સર્વે ઘટકોને તેમના પર્યાવરણીય આવરણના સંપૂર્ણ પરિષ્ક્યમાં મૂલવી શકીએ.

આપણે 'શ્રીન વોલન્ટીયર' હોઈએ, 'શ્રીન ઓથર' હોઈએ કે 'શ્રીન એક્ઝિટીસ્ટ' હોઈએ, 'વિવેક' આપણી સમજ, સાધન તથા શૈલીને વધુ પારદર્શક, વધુ પ્રમાણભૂત તથા વધુ પરિણામાદાયી બનાવશે તે નિઃશંક છે. અને કદાચ પરિણામ ન મળે તો પણ શું? શુભવિચાર તથા શુભકાર્યની 'બેટન' તમે બેશક તમારા અનુગામીના હાથમાં થમાવી શકો છો. પણ હેતુમાં જો ઊણપ અને અભિગમમાં સંદિગ્ધતા હશે તો કર્યુક્કાર્યું વિવાદના વમળમાં ગ્રસિત થઈ જશે.

અપમૃત્યુમાંથી મીણબતીના અજવાણે શહાર્દત શોધવાનો સદ્ગ્ભાવ અને શુભઆશયથી થયેલો એકલદોકલ પ્રયત્ન પણ શ્રી અમિત જેઠવાના મૃત્યુના સમાચારને 'વિવાદાસ્પદ'ની કાળી રેખાથી સીમાંકિત થતા ન રોકી શક્યો.

ઘટનાની સાંજે મારા ઉપર ફોન આવ્યો, "તમે અમિત જેઠવાના સમાચાર સાંભળ્યા?" અને સાંભળીને એક આંચકો લાગી ગયો. ફોન પૂરો થયો ત્યાં સુધીમાં બીજા ચાર ફોન અને ત્રણ મેસેજ આવી ગયા હતા.

શ્રી અમિત જેઠવાને છેલ્લે મળ્યે માંડ દોડ મહિનો થયો હતો. બી. સી. એસ. જી.ના પૂર્વ ગીરના પ્રવાસ દરમિયાન અમિતભાઈની બે વાર મુલાકાત થઈ હતી. પ્રારંભિક સંમેલનમાં અમારા કાર્યક્રમના સંચાલકના અંગત આમંત્રણથી તેઓ મંચરસ્થ થયા હતા. સંફેદ વસ્ત્રો, 'રિવોલ્વર', ચહેરા પર રમતું તોઝાની રિમિત તથા સ્થાનિક વિધાનસભ્ય સાથેનો વાતચીતનો વ્યવહાર સૂચ્યવતાં હતાં કે અમરેલીના રાજકીય તથા સામાજિક વર્તુળોમાં તેઓએ આગવી રીતે પોતાનું સ્થાન જમાવ્યું છે. તેઓના દુરાગઢને વશ થઈને મોડું થતું હોવા છતાં બીજે દિવસે હનુમાનગાળાથી વળતાં ખાંબામાં, તેઓની જનવાભાર્યે ખોલાયેલી આર. ટી. આઈ.ની ઓફિસ સામે બસ ઊભી રાખવી

પડી. બસની નીચે ચા-પાણીની વ્યવસ્થાની વ્યસ્તતા સાથે જે થોડો સંગાથ રહ્યો તેમાં તેઓએ જણાયું “ગીરમાં બધી ખાણો બંધ કરાવી દીધી, સાહેબ.” અમારા સત્કારમાં તેઓની હોંશ સાફ જણાઈ આવતી હતી.

આ અગાઉ હું તેમને ત્રણ વાર મળ્યો હતો. પહેલી મુલાકાત મારે ઘરે થઈ હતી. આશરે સાત-આઈ વર્ષ પહેલાં ‘વિહંગ’નું પગેરું શોધતા શોધતા તેઓ મારે ઘરે આવ્યા હતા. મહુવા પાસેના દરિયાકાંઠાના વિસ્તારોમાં થતા પક્ષીઓના શિકાર સામે તેઓ ઝુંબેશ ચલાવી રહ્યા છે, તે મેં સાંભળ્યું હતું. એ સંદર્ભે મેં તેઓને ધન્યવાદ આપ્યા હતા. “દરેક વ્યક્તિની કાર્ય કરવાની એક આગામી પદ્ધતિ હોય છે. બધાં પાસે બધાં હથિયાર ન હોય અને બધાં શસ્ત્રોમાં તે નિપુણ પણ ન હોય. જેની જેમાં આવડત અને અથીય વિશેષ જેમાં અભિરુચિ તે શસ્ત્ર ચલાવે. આપણે સૌ કર્મશીલોએ આ હક્કિકતનો સ્વીકાર કરવો જોઈએ તથા પરસ્પર આદરભાવ રાખવો જોઈએ.” પક્ષીના શિકાર બાબતે જ્યારે ચર્ચા નીકળી ત્યારે મેં આ મુજબ ખુલાસો કર્યો હતો. ત્યાર બાદ તેઓએ કદ્દી કોઈ બાબતે – સીધી કે આડકતરી રીતે કોઈ પણ અપેક્ષા રાખ્યા સ્વિવાય મારે માટે સદ્ગુલાવ સેવ્યો છે, તેવી પ્રતીતિ મને છેક સુધી રહી હતી. પારકે જબે બંદૂક રાખીને ઝોડવાની નાંપુંસક ચેષ્ટા તો તેઓએ મારી સાથે ક્યારેય નથી કરી.

૨૦૦૪માં બી.સી.એસ.જી. આયોજિત ગીધ અંગેના પરિસંવાદમાં સૌ સ્થાનિક સ્વયંસેવકોએ પોતપોતાના વિસ્તારોમાં ગીધની પરિસ્થિતિ અંગે રજૂઆત કરી અને તેઓએ જબરદસ્તી મંચ ઉપર આવી તેઓની લાક્ષણિક ઉગ્ર શૈલીમાં વનવિભાગ સામે વાક્પ્રહારો શરૂ કર્યા ત્યારે મારે પણ રૂદ્ધ સ્વરૂપ ધારણ કરી, વર્તમાન તખ્તો તાત્ત્વિક ચર્ચા માટેનો છે, તેઓની ખાતા સામેની શત્રુવટ તથા પૂર્વગ્રહની અભિવ્યક્તિ ધરાર અપ્રસ્તુત તથા અસ્થાને છે – કહી નીચે ઉતારવા

પડ્યા હતા.

ગત વર્ષે અમદાવાદમાં બી.સી.એસ.જી. તરફથી યોજાયેલી ‘વન્યજીવ-સંરક્ષણમાં માહિતી અધિકાર અધિનિયમ (RTI)નો એક સાધન તરીકે પ્રયોગ’ – એ કાર્યશાળામાં મેં તેઓને એ સંદર્ભે તેઓના અનુભવોની રજૂઆત કરવા આમંત્રા હતા. આર.ટી.આઈ.ના પ્રખર ઉપાસક હોવા છતાં પાછળથી તેઓ દ્વારા સંપાદિત અને પ્રકાશિત ‘એરાઉન્ડ ધ નેચર’માં આ કાર્યશાળા અંગે કોઈ પણ ઉલ્લેખ ન જોઈ થોડું આશ્ર્ય થયું હતું.

આ મારી સીધી ઓળખ. પરોક્ષ પરિચય વનવિભાગના તંગ આવી ગયેલા કેટલાક વરિષ્ઠ અધિકારીઓ, પર્યાવરણસંરક્ષણ તથા માહિતી અધિકાર અધિનિયમ સાથે સંકળાયેલા કેટલાક અંગત મિત્રો, અખભારાના અંશો તથા ‘એરાઉન્ડ ધ નેચર’ એ સર્વેના ક્યારેક ઘનિષ્ઠ તો ક્યારેક આછેરા સંપર્કથી મળી રહેતો. તેઓએ આર.ટી.આઈ. અને પાછળથી પી.આઈ.એલ (જાહેર હિત અરજી) એમ બે શસ્ત્રોને તીક્ષ્ણ ધારથી સજાવી વગરમ્યાને જ કમરબંધ પર લટકાવી રાખ્યાં છે, તેવું સ્પષ્ટ વરતાતું.

વર્ષોથી ગીરને કન્ઠી રહેલા ખાશઉંદ્રોગ ઉપરાંત, અન્ય પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલમાં તથા વનવિભાગની લાપરવાહી અને નિયમવિરુદ્ધની કામગીરી સામે રોક લગાવવામાં હસ્તગત કરેલાં ઉપરોક્ત શસ્ત્રોનો તેઓએ ક્વચિત સિફ્ટપૂર્વક તો ક્વચિત ઝનૂનપૂર્વક ઉપયોગ કર્યો. ખૂબ જ દાઢ અને આકોશથી કામ કર્યું. જે વિવાદસ્પદ રહ્યું તે – એ દાઢ અને આકોશને સીંચતું ઈજન; તેમાં પર્યાવરણ-સંરક્ષણની શુદ્ધ ભાવનાથી પર પણ કશુંક હતું. અને તેથી જ જે સિફ્ટ થયું તેને વિવાદનું ગ્રહણ લાગી ગયું. પ્રતિશોધની ભૂમિકા પર આરુદ્ધ થયેલો આવેગ બૂમરેંગ થઈને રિપુરેશે તેમને ભરાયી ગયો.

ખૂબ જીવ બણ્યો. બુદ્ધિશાળી હતા, લડવાની હામ હતી. કાયદાકીય દાવપેચમાં સૂજ કેળવી હતી. ઘણું થઈ

શક્ત. માત્ર સંદિગ્ધ અભિગમને લીધે જે ઉપલબ્ધ કર્યું તેને કોઈ મનભેર વધાવી ન શક્યું. અનિયંત્રિત ભષ્યાચારને કારણે જ્યારે પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચી રહ્યું હોય ત્યારે દુરાચારી તત્ત્વો સામે રોષ ભભૂતી ઊઠે એ સ્વાભાવિક છે. પણ આ કોધાવેશ બેકાબૂ થયેલી અગનજવાળાની જેમ સર્વનાશનું કારણ બને તેને બદલે એક પથરદર્શક જ્યોતના ચિરઉઝાસનું નિમિત્ત બની રહે તો વધુ પરિણામલક્ષી નીવડે.

શ્રી અમિતભાઈને હું અંગત રીતે તથા 'વિહંગ'ના

### પ્રફાચક્ષનું પક્ષીનિરીક્ષણ

એરિયલ એક નર્સ હતી. ઉછ વર્ષની ઉંમરે ખરાબ દવાને કારણે તેણે અચાનક આંખો ગુમાવી.

તે પાંચ વર્ષની ઉંમરની હતી ત્યારથી તેના દાદા સાથે પક્ષીનિરીક્ષણ કરવા જતી. પક્ષીનિરીક્ષણના શોંઘે તેની નિરીક્ષણશક્તિ અને કુદરત સાથેના જોડાણને ખૂબ ઉંડાં બનાવ્યાં હતાં. હવે આંખો ગયા પછી તેની બધી જ ગમતી પ્રવૃત્તિઓ અને પક્ષીનિરીક્ષણ તેની પહોંચની બહાર થઈ ગયાં હોય એમ તેને લાગ્યું. એરિયલ નિરાશાની ઉંડી ગતર્માં ધકેલાઈ ગઈ. એક આખું વર્ષ એમ જ પસાર થઈ ગયું.

અને એક દિવસ એને અચાનક થયું 'હું આ રીતે ન જીવી શકું' અને તેણે અંધ વ્યક્તિની જેમ જીવવાની ખાસ પ્રકારની કેળવણી લેવા માંડી. ગાઈડ ડોગની મદદથી તે બહાર જવા લાગી. ધીરે ધીરે તેણે જીવનનો દોર પાછો સંભાળી લીધો. હવે તે ગાઈડ ડોગ સાથે એકલી હાઈકિંગ માટે પણ જવા લાગી.

એક દિવસ એરિયલ તેના પતિ સાથે હાઈકિંગ પર નીકળી હતી. તેના કાન એક પંખીના ગાનથી સતેજ થયા. તેણે તેના પતિને પૂછ્યું 'આ ગાન કરતું પક્ષી

સૌ વાચકો વતી શ્રદ્ધાજલિ અપૂર્ણ છું. તેઓનાં કુટુંબીજનોને આ અસ્ત્ર આઘાતને જરવવા બળ અને પ્રેરણ આપે તથા અકાળે સરકી ગયેલી 'બેટન' તેઓના નિશ્ચેતન હાથોમાંથી હજ વધુ સુરક્ષિત હાથોમાં જાય તેવી ઈશ્વરને હદ્યપૂર્વક પ્રાર્થના કર્યું છું.

તેઓની અનુપસ્થિતિમાં પર્યાવરણના મુદ્દે થઈ રહેલી ગેરરાતીઓ સામે કાયદાકીય લડાઈ છેઠનારની આપણને ખોટ રહેશે જ તે નિઃશંક છે.



કયા રંગનું છે ?" તેના પતિએ નિરીક્ષણ કરીને તેનો રંગ કદ્દો. ખૂબ ઉત્તેજના સાથે તેણે પ્રશ્નોનો વરસાદ કર્યો, "તેની પૂછાડી પર કાળા પણ છે ? તેનું કદ આટલું છે ?" તેના પતિએ પણ એટલી જ ઉત્તેજનાથી વર્ણન કર્યું, "હા, તેનું ગણું સહેદ છે. તેની ચાંચનો આકાર ...આવો છે.." આમ તેને વધારે વિગતો આપી. અને એરિયલ ખુશીથી જૂમીને બોલી, "અરે ! આ તો Canyon Wren."

બંને જણાં પક્ષીનિરીક્ષણની આ નવી પદ્ધતિથી ખૂબ ખુશ થયાં. પછીનો આંખો દિવસ એરિયલ પક્ષીનો અવાજ સાંભળતી, તેના પતિ તેનું વર્ણન કરતા અને તે પક્ષી ઓળખતી. અને આ રીતે આ નવી પદ્ધતિના પક્ષીનિરીક્ષણથી એરિયલને તેના આ શોખનો ગુમાવેલો આનંદ પાછો મળ્યો. અને ખરેખર તો આ નવા પ્રકારનું પક્ષીનિરીક્ષણ તેને વધારે આનંદદાયક લાગ્યું. એરિયલ તેના પતિના સહકારથી પક્ષીઓ અને કુદરતની દુનિયામાં પાછી ફરી.

શ્રોત: 'હેપી શોર નો રિઝન'

લ. મર્સી શિમોક

સંકલન : ડૉ. સમીક્ષા નિરેદી

દિવસના ૧૬ કલાક દરમિયાન એક 'રેન' (Wren, *Troglodytes troglodytes*)

પોતાનાં બચ્યાનાં ખોરાક આપવા માટે સરેરાશ ૧૦૦૦ વાર માળાની મુલાકાત વે છે.



## માણ્યું તેનું સ્મરણ - ૬



### લાલસિહ રાઓલ

એક વાર મારી તબિયત બરાબર ન હતી. હું રજા ઉપર હતો. દરમિયાન એક રવિવારે પ્રકૃતિ મંડળના બેન્ટ્રાશ મિત્રો સાહેબને મળવા રાજકુમાર કોલેજે ગયા. તે વખતે હિંગોળગઢ મુકામે બોંઘે નેચરલ લિસ્ટરી સોસાયટી (બી. એન. એચ. એસ.) તરફથી પંખીઓને જાળવી પકડી રીતું પહેરાવવાનો કેમ્પ ચાલતો હતો. વાછિયા તરફ આવેલું હિંગોળગઢ આજાઈ પહેલાના જસદણ રાજ્યનું એક નાનું ગામનું. ત્યાં હજારેક ફૂટ (૩૦૦ મીટર) ઊંચી ટેકરી પર રાજાનો મહેલ અને નીચે પોતીસરી નામનું રૂક્ષ જંગલ છે. મને લઈને ત્યાં જવા સાહેબે તેમને કહ્યું. ખુશ થતા તે બધા આવ્યા મારી પાસે. મને રીંગીંગ કેમ્પની વાત કરી. મેં કહ્યું: “નાદુરસ્ત તબિયતને લીધે હું નહીં આવી શકું, પણ તમે બધા આ લાભ ચૂક્યા નહીં. જરૂર હિંગોળગઢ જાવ.” તે મિત્રો નિરાશ થયા. મારી પાસેથી નીકળી સીધા પહોંચ્યા સાહેબ પાસે. મારી અનિચ્છાની તેમને વાત કરી. સાહેબ ન માન્યા. કહે, “જાવ, લાલસિહભાઈને અહીં લઈ આવો.” પેલા મિત્રો આવ્યા અને મને ઉદાહ્યો. સાહેબ કહે “શું વાંધો છે? હિંગોળગઢ કેમ નથી જાવું?” મેં મારી અશક્તિ અને જીજા જવરની વાત કરી, અને કહ્યું, “ત્યાં જઈને હું કોઈ કામમાં નહીં આવું. નકામો ભારરૂપ થઈ પડીશ. આથી મારા જવાથી કાંઈ અર્થ નહીં સરે.” સાહેબ કહે, “ગઠનાં હવાપાણી બહુ સારાં છે. ત્યાં

તમારી તબિયત સારી થઈ જશે. તમારે જવાનું જ છે. બીજું કાંઈ નહીં તો પકડાયેલાં પંખીઓની વિગતો એક જગ્યાએ બેસીને રજિસ્ટરમાં લખી તો શકશો ને? રખડપણી આ ભાઈઓ કરશો.” આમ મારે હિંગોળગઢ જવાનું થયું. બીજા દિવસે પેલા મિત્રો સાથે પહોંચ્યો હિંગોળગઢ. સાહેબની વાત સાચી પડી. જંગલમાં બધી ફરતો. ત્રણ દિવસ અમે ત્યાં રોકાયા તે દરમ્યાન મને યાદ પણ ન આવ્યું કે મારી તબિયતમાં કાંઈ વાંધો છે. આમ ‘બર્ડ રીંગીંગ કેમ્પ’નો નવો અનુભવ મળ્યો. ત્યાર પછી સમયાંતરે થયેલા બીજા એવા કેમ્પોમાં ભાગ લેવા માંડયો. ઘણું નવું જાણવાનું મળ્યું.

અહીં ‘બર્ડ રીંગીંગ’ વિશે થોડી વાત કરું. ચોમાસું ગીતર્થ યુરોપ, રાશીયા, સાઈનારીયા, મધ્ય એશીયા તથા પશ્ચિમ એશીયાના દેશોમાંથી કરોડો પંખીઓ શિયાળામાં ભારત આવે છે. અહીં યોગ્ય સ્થળોએ તેમને જળમાં પકડી તેમનાં એક પગમાં એલ્યુમિનિયમ મિશ્ર ધાતુની પંખીઓના કદ મુજબની નાની મોટી રીંગ પહેરાવવામાં આવે છે. તે રીંગમાં અનુકૂમ નંબર અને તે પહેરાવનાર સંસ્થાનું નામ ઉપસાવેલ હોય છે.

પકડાયેલ પંખીને કાળજીપૂર્વક જાળમાંથી કાઢવામાં આવે છે. તેમ કરતાં તેને જરાય ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રખાય છે. પછી એક રજિસ્ટરમાં તેની વિગતવાર નોંધ કરાય છે. તેમાં પકડ્યાની તારીખ,

સ્થળનું નામ, પંખીનું નામ, શક્ય હોય ત્યાં તેમની જાતિ એટલે કે નર છે કે માદા તે, તેમનું વજન, પાંખ-પૂછઠીના માપ અને તેને પહેરાએલ રીંગનો નંબર લખીને પંખીને છોડી મુકાય છે. આ રીંગને લીધી પંખીને તેના દૈનિક જીવનમાં જરાય તકલીફ પડતી નથી.

ભારતમાં જુદાં જુદાં સ્થળોએ થઈને હજારો પંખીઓને રીંગ પહેરાવવામાં આવે છે. આટલાં વરસોમાં બે લાખથી વધારે પંખીઓને આવી વાંઠી પહેરાવાઈ છે. જે દેશોમાંથી તે પંખીઓ અહીં આવે છે ત્યાં પણ આવી રીતે પંખીઓને પકડીને રીંગ પહેરાવી તેની વિગતવાર નોંધ રજિસ્ટરમાં લખી તેમને છોડી મૂકે છે. આવા રીંગવાળા પંખી કવચિત્ આપણી જાળમાં સપદાય છે. તેમના રીંગના નંબર અને અન્ય વિગતો આપણા રજિસ્ટરમાં નોંધાય છે. તે પંખી ક્યાં અને કઈ તારીખે આપણી જાળમાં પકડાયું તેની વિગત રીંગ પહેરાવનાર સંસ્થાને મોકલાય છે. (દરેક દેશમાં એક માન્ય સંસ્થા જ આ પ્રવૃત્તિ કરી શકે છે.) તે જ પ્રમાણે અહીં રીંગ પહેરાવેલ પંખી અન્ય દેશમાં પકડાય તો તે લોકો તેની વિગત આપણાને મોકલે છે. તેને આપણા રજિસ્ટરમાં જે તે પંખીને સામે લખી લેવાય છે. આમ યાયાવર પંખીઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તેની સાચી માહિતી મળી રહે છે. મુસાફરીમાં તે કેટલા માઈલ ઉત્ત્યં અને તે અંતર તેણે કેટલા દિવસમાં કાયંતું તેની જાણકારી મળે છે.

રીંગ પહેરાવવાને લીધી પંખીની ઉમર પણ ક્યારેક જાણી શકાય છે. દેશી કે પરદેશી જે કોઈ પંખી જાળમાં સપદાય તે દરેકને રીંગ પહેરાવીને તેની નોંધ રખાય છે. હિંગોળગઢાને મોતીસરી જગતમાં આ રીંગાં કાર્યક્રમ થતો. ત્યાં બુલબુલ સારી સંખ્યામાં હોય છે. કવચિત્ તેઓ પણ જાળમાં સપદાય છે. આવું એક બુલબુલ જાળમાં સપદાયું. તેની રીંગ ઉપરના નંબરથી આપણા રજિસ્ટરમાં જોતાં માલૂમ પડ્યું કે બાર વરસ પહેલાં તે જ સ્થળેથી તેને રીંગ પહેરાવેલી. આમ કુદરતી અવસ્થામાં બુલબુલ બાર વરસથી વધારે જીવી શકે છે

તે જાણવા મળ્યું. હિંગોળગઢે રીંગ પહેરાવેલ એક યાયાવર પંખી યુરોપના ગ્રીસ પાસેના કીટ ટાપુ ઉપર જાળમાં સપદાયેલું. આ બે સ્થળો વચ્ચેનું સીધું અંતર ત્રણ હજાર કિલોમીટર છે.

અમેરિકા અને યુરોપમાં દર વરસે લાખો પંખીઓને રીંગ પહેરાવી છોડી મૂકવામાં આવે છે. ત્યાંના પ્રમાણિયાં આપણે નાણાંના અભાવે ખાસ કાંઈ કરી શકતા નથી, એમ કહેણું પડે છે. બાકી આ પ્રવૃત્તિ ખૂબ ઉપયોગી અને જરૂરી છે.

હું રાજકોટ હતો તે દરમિયાન શ્રી ઝાફર ફિલેહાલીએ મુંબઈથી ‘Newsletter for Bird watchers’ નામનું માસિક શરૂ કર્યું. સાઈકલોસ્ટાઇલ સ્વરૂપે તે નીકળાંતું અને રસધરાવનારાને નિશ્ચૂળ મોકલાતું. તેના પહેલા જ અંકથી મેં તે મંગાવવાનું શરૂ કરેલું. એક પૂર્વનિશ્ચિત રવિવારે સવારથી સાંજ સુધીમાં જોયેલ પંખીઓની યાદી બનાવીને મુંબઈ મોકલવાની વાત તેમાં આવી. સૌથી વધારે પંખી જોનારને સલીમ અલીની ‘The Book of Indian Birds’ ઇનામ તરીકે મળવાની હતી.

અમસ્થાયે હું રજાના દિવસે એકલો એકલો પંખી નિરીક્ષણ કરવા નીકળી પડતો. હરીફાઈમાં ભાગ લેવાનું તો મારા માટે માત્ર નિમિત્ત હતું. તે રવિવારે પક્ષીનિરીક્ષણ કરતો ગયો અને જોયેલ પંખીનું નામ ડાયરીમાં ટપકાવતો ગયો. આજ નદીના કિનારે આવેલ સેન્ટ્રલ જેલ આસપાસનો નદીકાંઠી પંખીઓ જોવા માટેનું માનું માનીનું સ્થળ. તેમાંથી નદી કિનારે આવેલ કર્ણશ્વર મહાદેવનું મંદિર વધારે માનીનું. રાજકોટમાં તે વખતે બુલ્લી ગટરો હતી. જેલથી થોડે ઉપરવાસ ગટરનું પાણી આજ નદીમાં છોડી દેવાતું ત્યાં નદીનો પટ પથરાય. નદીકાંઠે જેમની જમીનો હતી તે ખેડૂતોએ આપસૂજથી માટીનો નાનો આડબંધ કરીને ગટરના પાણીને રોક્યું. પછી તેમાં પંપ મૂરીને પોતાનાં ખેતરોમાં તેનાથી કિંચાઈ કરી, વધારે પાક પકવતા. આડબંધને લીધી નદીમાં નાનું છીછું જળાશય ગટરના પાણીનું બનતું. તેમાં થતો

જવજંતુ ખાવા પંખીઓ શિયાળામાં આવતાં. તેમના નિરીક્ષણ માટે તે સરસ સ્થળ.

હવે મૂળ વાત પર આવું. જેલ સામેના રહેઠાણ વિસ્તારની ગટરોનું પાણી એક મોટા ધોરિયા રૂપે નદીમાં જતું. પંખીનિરીક્ષણ કરતો કરતો હું જેલના મુખ્ય દરવાજા નજીક પહોંચ્યો. ત્યાં એક આશ્ર્વયજનક બાબત મારી નજરે ચડી. મારાથી સાત આઈ મીટર દૂર ઘાસવાળી જમીનમાં ચરતી ૭-૮ કાબરી મેના (Pied Myna) મારી નજરે ચડી. તેમને જોતાં હું ખુશખુશ. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તે પહેલાં કાબરી મેના ક્યાંય



### સાચે જ મોર બોલી રહ્યા છે...

અન્ય ઝતુમાં પણ આ મોર ટહુકા કરે છે કે કળા પણ કરે છે, પણ અત્યારે તો ઉપર આકાશમાં મેઘગર્જના અને નીચે.... વૃક્ષરાજુમાંથી મોરની પ્રતિગર્જના. અને એવા ટહુકા કે ઉન્મત મેઘને પણ એની નોંધ લેતી પડે. આ મેઘભીની ઝતુમાં મોરના અવાજમાં જે ભીનાશ અનુભવાય છે, તે અન્ય ઝતુઓમાં નહીં. મેઘથી મેદૂર આકાશ થઈ ગયું હોય, અને વનરાજ શ્યામ બની ગઈ હોય એવે વખતે મનમાં ગીતગોવિંદનો પ્રથમ શ્લોક ગણગણતા હોઈએ. ત્યાં

નોંધાયેલ નહીં. આ તેનો પહેલા રેકોર્ડ હતો. હરીઝાઈ મને તો ફળી.

૧૯૬૬ દમાં હું થોડો વખત જસદણમાં રહેલો. ત્યાં એક દિવસ શ્રી દરબાર સાહેબની વાડીમાં ફરતો હતો ત્યારે એક કાબરી મેના મારા જોવામાં આવેલી. તે મારું તેનું બીજું દર્શન. ત્યાર પછી તો કોઈ કોઈ વાર બીજાઓની નજરે તે ચુડતી રહે છે.

(ક્રમશાસન)

સી-૨, હરિઓમ એપાર્ટ, ‘ઘરીબ ઓફ ઇન્ડિયા’ પ્રેસ રોડ,  
જવરાજ પાર્ક, અમદાવાદ-૧૫

મેઘના સ્વાગતકૃત્યના ભાગ તરીકે મોરનો કેકારવ થયો. તેમાં ભાજો કોયલ અને પપીણનો તીવ્ર સ્વર.

આખો લોક બદલાઈ ગયો.... લાગ્યું કે અત્યારે રઘવાયું બની દોડતું બરાડતું ભોં ભોં કરતું.... નગર મિથ્યા છે, અવસ્તવિક છે. વાસ્તવિક છે તો માત્ર આ આ મેઘ, આ મોર, આ ભીની સાંજ. લેન્ડસ્કેપ જ નહીં, આપણો ‘ઇન્સર્કેપ’ પણ બદલાઈ ગયો.

જોઉ હું તો ત્રણ-ચાર મોર પોતાની અનુપમ નૃત્યછટા બતાવી રહ્યા છે. મને ત્યાંથી પસાર થનારને ધ્યાનમાં લેતા નથી. હું ક્ષણિક ઊભો રહી તેમના કલાપની શોભા જોઈ રહું હું. એક મોરનું ધ્યાન ગયું. એ સભાન થયો, કદાચ શંકિત પણ થયો હશે તોયે તેની કળા ક્ષણોક મારી સામે જોતા રહીને ચાલુ રાખી. ને પછી એવા વળાંક સાચે સંકેલી લીધી કે ખભે પડેલા ખુલ્લા કેશને છટાથી કોઈ રમણી હાથમાં સંકેલી હળવો વળ ન આપતી હોય !

ભોળાભાઈ પટેલ

પ્રકાશક : આર. આર. શેઠ એન્ડ કંપની, ૧૯૮૬

સૌજન્ય : ચૈત્ર ચમકે ચાંદની'

‘ગિલેમોટ’ (Guillemot, *Uria aalge*) નામનાં પક્ષીઓ દરિયાકંઠાની કરાડો પર મોટા ગીય સમૂહોમાં, નજીક નજીક માળા બનાવે છે. આવા ગીય સમૂહમાં પણ ગિલેમોટ પોતાના માળા અને ઇંડાંને કંઈ રીતે ઓળખી લે છે ?

એનું કારણ એ છે કે ગિલેમોટનું દરેક હુંકું અલગ રંગનું હોય છે અને તેના પરની ભાત પણ આગવી હોય છે.

# વિહંગાવલોકન



શ્રી લવકુમાર ખાચર



## આપણનું અંગત રણદીપ...

હા, પક્ષીઓને અભયારણયોથી વિશેષ કશુંક જોઈએ છે; એમને તમારા ભાવવિશ્વનો ભાગ બનવું છે. તમારું ઘર, આંગણ, પાડોશ અને એ બધાની વચ્ચે ઘેરાયેલા વિશાળ આકાશના તેઓને અભિન અંગ બનવું છે. અફાટ નિર્જીવ સાગરમાં માત્ર રાપુઓની જેમ અભયારણયો અને આરક્ષિત વિસ્તારો જ વન્ય જીવોની હ્યાતિને સુનિશ્ચિત કરે, એવી પરિસ્થિતિને આપણે કદાપિ માન્ય ન રાખી શકીએ. 'વિહંગા'ના છેલ્લા અંકમાં પૂર્વ ગીરના પ્રવાસનું વર્ણન છે કે જ્યાં કેટલાક મિત્રોએ પક્ષીઓની રદ જાતિનું અવલોકન કર્યું. અડધી સદી પહેલાં આ પક્ષીઓ આખા સૌરાષ્ટ્રમાં જોઈ શકાયાં હોત! આપણી સહિયારી અભિવાધારી એ પરિસ્થિતિને પુનર્જીવિત કરવાની આવશ્યકતા ઊભી થઈ છે અને મને ખાતરી છે કે આપણે તે કરી શકીશું. મારા મત પ્રમાણે 'વિહંગા'નો આ જ ઉદ્દેશ હોઈ શકે. ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતું આ સુંદર અને ઉપયોગી પ્રકાશન, રાજ્યભરમાં હાથ ઉપર લેવાયેલી કેટલીક મહત્વની પરિયોજનામાંની એક છે, તેમ હું માનું છું. તેણે વાચક વર્ગમાં જે આવકાર પ્રાપ્ત કર્યો છે તે અચંબો પમાડે તેવો છે. તે માત્ર એક જ વ્યક્તિના નિઝ રસ અને પ્રેમનું

પ્રતીક ન રહે તે બાબતે આપણે સૌઓ જાગૃત રહેવાનું છે. આ ઉમરે જ્યારે મારે વરંડામાં આરામ ફરમાવતાં જતનપૂર્વક ઉછેરેલાં મારાં ઝડપ-પાન અને તેમાં ઘર શોધતાં રહ્યાંસહ્યાં પક્ષીઓનું સંગીત સાંભળવાનું હોય ત્યારે આમ કલમ ઉપાડવાનું કારણ આ જ છે. હનુમાનગાળામાં મિત્રોએ જે પક્ષીજાતિઓ જોઈ તે સર્વે અહીં જ હોવી જોઈતી હતી; તે કેમ નથી એ બાબતે હું લખવા માગું છું.

'દ્વાના દસકામાં જ્યારે ચાજકોટનું મારું આ ઘર મેં લીધું ત્યારે થોડાંક મકાનો તથા ચોતરફ ખુલ્લાં મેદાનો અને ખેતરો હતાં. ખૂબ પવન ફૂંકાતો અને પક્ષીવૈવિધ્ય પક્ષ ઘણું હતું. દર શિયાળે થરથરા (Black Redstart)નો એક સુંદર નર ઘરની પછવાડે આવેલી જાડીમાં રહેતો. નવાસવા નંબાયેલા વીજળીના તાર ઉપર દરજા (Common Tailorbird), બુલબુલ (Red-vented Bulbul), હોલાની ત્રણેથ જાતિઓ તથા કાળિયા કોશી (Black Drongo) દેખાતાં. ધાબે પડી રહેલા નકામા સામાનમાં દેવચકલી (Indian Robin)ની જોડી નિયમિત માળો કરતી. ઠંડીની જાતુમાં બહાર ફરવા નીકળીએ તો કાબરો પિંદો (Pied Wheatear), રણ પિંદો (Desert Wheatear) અને

## વિહંગાવલોકન

ઉજળો પિપ્પો (Isabelline Wheatear) અચૂક દેખાતા - સાથે સાથે ધાનચીડીઓ (pipits) અને ચંડુલો (larks) તો ખરી જ. અમારી ‘હાઉસિંગ કોલોની’માં મોટાં વૃક્ષો ઉછેર્યા હોવાથી ગમ આખાના હોલા રાત્રે તેના પર રાતવાસો કરવા આવતા અને પો ફાટતાં જ તેમના સામુહિક “ઘૂટરઘુ...”નો શોર એક અદ્વિતીય અનુભવ બની જતો. સમય જતાં ખેતરોમાં ‘લોટ’ પડી ગયા અને બાંધકામ શરૂ થયું. ભયાનક ચેપી રોગની જેમ ફેલાતા જતા આ ઈંટ-ચૂનાનાં ખોખાંએ અમારા ઘરને પ્રકાલતો અવિરત પવન અવરોધી લીધો. ખોરાકના સોત અને રાતવાસાનાં ડેકાશાં છીનવાઈ જતાં પક્ષીઓએ પણ ધીમે ધીમે વિદ્યાય લીધી. તે પછી સખેદ બહુ ઓછા બગીચા બન્યા અને વિશાળ વૃક્ષો તો ગણ્યાંદ્યાં રહ્યાં. મારો પોતાનો બાગ પણ કેટલાંક મોટાં ઝડપ કરતાં અવગાણિત થઈ ગયો હતો. તે સમયે આ વૃક્ષોની હ્યાતિએ બચ્ચી રહેલાં પક્ષીજીવનને પાયાની જરૂરિયાતનું માળખું પૂરું પાડ્યું. સદ્ગ્રાહ્યે હોલા આ પુરાતન વૃક્ષો પર રાતવાસો કરવા આવતા અને મારા અતિથિઓ તેમનાં પ્રભાતિયાંની અવશ્ય નોંધ કેતાં.

’૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં રાજકોટના મારા આ ઘરમાં હું ફરીથી સ્થાયી થયો ત્યાર બાદ મારો બગીચો પુનઃજીવિત થયો અને વૃક્ષો પણ વધુ પત્તલવિત અને ઘયાદાર બન્યાં. હોલો (Eurasian Collared-Dove), લોટશ હોલો (Red Collared-Dove) અને હોલી (Little Brown Dove) એ ત્રોય હોલાની જાતિઓ ઉપરાંત, દરજા, બુલબુલ અને શક્કરખોર (Purple Sunbird) હવે દર વર્ષે નિયમિત બચ્ચાં ઉછેરે છે, અને તે પણ બિલાડીની હાજરી હોવા છતાં! જો કે, આસપાસના જીવન ટકાવવા માટે વિષમ અને પ્રતિકૂળ કહી શકાય એવા વાતાવરણમાં એ બચ્ચાંનું પછી શું થતું હશે - એ ભગવાન જાણો!

શ્રી સલીમ અલીની ૮૬ મી વર્ષગાંઠ વખતે મારા જાંપાની બહાર રસ્તાની ચોકડીની વરચ્ચોવચ્ચ તેઓની પાસે મેં વડ રોપાવ્યો હતો. મારા નાનકડા પણ સુશોભિત બગીચાને હરીભરી પશ્ચાદ્ભૂમિ આપતો આ ઘેઘૂર વડ હવે સીમાચિહ્નરૂપ બની ગયો છે. મારી અગાસીમાંથી એક દીવાલ સર્જતી તેની વિશાળ ઘટા અને તેમાંથી ટહુકતી કોયલને માણવાં એ મારે માટે અન્ત આનંદનો સ્ત્રોત બની ગયો છે. જ્યારે ટેટા બેસે છે ત્યારે તે પક્ષીવૃદ્ધ માટે આમંત્રણ બની જાય છે; પણ આ ઘટના ઋતુ-અવસ્થાનિત છે. વળી, આસપાસમાં અન્ય સાથીવૃક્ષોની ગેરહાજરીમાં પક્ષીવૈવિધ્ય અને વિપુલતા મર્યાદિત થઈ જાય છે. આ વડની હાજરીથી ટ્રાફિકનિયમન તો થાય છે અને સાથે સાથે બહુવાંછિત છાંધો પણ મળે છે, એટલે લોકપ્રિય બન્યો છે, અને તેનાથી હું ખુશ થાઉં છું. હવે અન્ય પાડોશીઓએ પોતાની બાજુ આવાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું છે અને આશા છે કે સમય જતાં આ હરિત રણદ્વિપનું વિસ્તરણ થશે.

જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે છે પાણીની અછિત. પણ દરેક સમસ્યાનો ઉકેલ પણ છે, પાણીની જરૂરિયાત ઓછી હોય તેવાં વૃક્ષોનું ચયન કરી શકીએ. ખરેખર તો મેં જ્યારે મારા આંગણાનાં મોટા ભાગનાં વૃક્ષો વાવ્યાં ત્યારે ત્રણ વર્ષ સર્ગંગ દુકાળ પડ્યો હતો. નાના રોપાને તો થોડું અમસ્તું પાણી જોઈએ જે રસોડાના વપરાશ પછીનું વધીલું પણ પૂરતું થઈ રહે. બીજમાંથી ઉછેરેલા હોય તો તે રોપાના મૂળમાં ઘડી તાકાત હોય છે. અમે રસ્તાની બાજુમાં પણ વૃક્ષો વાવ્યાં હતાં. આજે જ્યારે અમારી કોલોનીની બહારના રહેણાંક વિસ્તારો ઉજજડ અને ગરમીથી શેકાતા જોઈએ છીએ ત્યારે અમારા આ નાનકડા રણદ્વિપ માટે અમને ગર્વ થાય છે. આપણાં સ્થાનિક દેશી વૃક્ષોને નાના રોપાની અવસ્થામાં પણ બહુ પાણી જોઈતું નથી. તેમને માત્ર


રખડતાં ઠોરઢાંખર - કે જે આપણા ભારતીય ભૂમિયિત્રનું એક આગવું લક્ષણ બની ગવું છે - થી સંભાળવા પડે. કોઈ એક મોટું અવરોધાત્મક પરિબળ હોય તો તે શહેર નગરપાલિકાના સજ્ઞાઈ કર્મચારીઓ જેમને ખરી પડેલાં પાંડડાં સાફ કરવા એ એક બોજો લાગે છે. તેઓ અચૂક આ પાંડડાંનો કોઈ નાના-મોટા વૃક્ષની નીચે ઠગલો કરશે અને આગ ચાંપી દેશે. ભભૂકૃતી જવાળાની અંચ લાગતા એ ઝડ ભાગે જ બચશે. અમારે ત્યાં અનેક વખત સીધી 'કમિશનરશ્રી'ને ફરિયાદ કરતા સદ્ગનસીબે હવે આ આચરણમાંથી મુક્તિ મળી છે. એ પણી આવે છે દૂરભાષ અને વીજળીખાતાના કર્મચારીઓ; સમયાંતરે તેઓ વૃક્ષોને આડેધડ કાપતાં રહે છે. મારા વર્ષો જૂના માણીને મેં એવી રીતે તાવીમબદ્ધ કર્યો છે કે અમારા વિસ્તારમાં તો વૃક્ષો દર વર્ષે સુવ્યવસ્થિત રીતે છંયતા રહે છે.

કદાચ ઘણાને ખબર નથી કે આપણે ત્યાં બારેમાસ લીલા રહેતા વેલાના પણ અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. વેલાની અનેક જાતિઓ અલગ અલગ જીતું આકર્ષક ફૂલો આપે છે, જેમાંનાં ઘણાં વિશેષ સુગંધ ધરાવે છે. મેં બાસ વિચારપૂર્વક ખાલી દીવાલો ઉપર વેલાનું આવરણ કરી દીધું છે - તો અમુક જગ્યાએ આ વેલાથી આડશ ઊભી કરી છે. એક વાર ચોંઠી જાય પછી વૃક્ષોની માફક વેલને પણ પાણીની ખાસ આવશ્યકતા નથી. વૃક્ષોની જેમ તેમને સમયાંતરે

છાંટવાની જરૂર પડે છે, છતાં ધાર્યા કરતાં ઓછી મહેનતે માત્ર આપણી કલાદણિને જ નહીં પણ પક્ષીઓને પણ સુખદાયક નીવડે છે. બે-ત્રણ વર્ષમાં મારે સૂર્યશક્તિને અસરકારક રીતે સંચિત કરી તેને જૈવિક તાકાત અને વૈવિધ્ય તથા સેન્દ્રિય સમૃદ્ધિમાં રૂપાંતરિત કરવી છે. જંતુનાશકોના સંપૂર્ણ નિરેધની સાથે સૂકાં-ખરેલાં પાંડડાંનું ખાતર સજ્જી મારીમાં રૂપાંતરિત થશે, જે પંખીઓ માટે આકર્ષણ ઊભું કરશે અને સાથે સાથે પાણીની જરૂરિયાત ઓછી કરશે. વેલાની આડશથી અગાસી ઉપર પણ છાંંયો રહેશે અને પસંદગીના થોર જેવાં છોડ(xerophytic plants)નાં ફૂડાં મૂકીશા તો માનું આ નાનકડું રહેઠાણ સંપૂર્ણપણે જૈવિક કવચથી આવરિત થઈ જતું હું કટ્ટી શરું છું. પક્ષીધરો અને ખોરાક-દાણાની તાસક મૂકીશા તો હજ વધુ પક્ષીઓને આમંત્રી શકીશ. કાબરો, ચકલાં અને પોપટો તથા કવચિત્ર વૃક્ષોની મુલાકાત લેતી અને રાત્રે દીવાબતીની આસપાસ જીવડાં પકડતી ચીભરી પણ કદાચ પક્ષીધરમાં રહેવા આવી જાય!

'વિહંગ'ના માધ્યમથી મને વિશ્વાસ છે કે વધુને વધુ મિત્રો તેઓના ઘરોને આડપાનથી સજાવવા માટે પ્રેરિત થશે અને કદાચ આ વૃક્ષાચ્છાદિત રહેઠાણો ભૂતકાળનાં વર્ષો કરતાં બેપાંખાળા દોસ્તોની મુલાકાતોમાં વધારો કરશે.

૧૪, જયંત સોસયટી, રાજકોટ-૩૬૪૦૦૪



## ખડમોર: પાંખોના અવાજથી પ્રજનનપ્રતુનું એલાન આપતું પક્ષી : ભાગ-૨

ડૉ. સલીમ અલીએ ૧-૮-૮૧ના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લીધી. તેઓનો ઉદ્દેશ હતો ખડમોર (Lesser Florican) તથા ઘોરડ (Great Indian Bustard) માટે અભયારણ્યો ઊભાં કરવાનો. તેમણે જ્યારે દૂરબીનથી ખડમોરને ઠેકડો મારતા જોયો ત્યારે પોતાનો આનંદ રોકી ન શક્યા; ગદ્ગાહિત અવાજ સાથે બોલ્યા, “અતિ સુંદર! હું ખડમોરને ૩૦ વર્ષ પછી જોઈ રહ્યો છું.”

નીજ વર્ષ શૈલાના અને સરદારપુરમાં કુલ બે ખડમોરને કરી પહેરાવવામાં આવી. પછીના વર્ષે જે-તે વિસ્તારમાં તેઓ પાછા ન આવ્યા. આ વિસ્તારમાં ખડમોર માત્ર પ્રજનન ઋતુમાં જોવા મળે છે; એટલે કે, ચોમાસામાં - જૂન મહિનાના અંત ભાગથી સાપેખ્યરના અંત સુધી (ગુજરાતની જેમ જ). ત્યાર બાદ તેઓ કોઈ અણાત સ્થળે ચાલ્યાં જાય છે. બિનપ્રજનન-ઋતુ દરમિયાનની તેમની ઉપસ્થિતિ તથા સ્થાનિક પ્રવાસો અંગેની ચોક્કસ માહિતી આજે ૨૮ વર્ષો પછી પણ મળી શકી નથી.

જો નાનું ‘દ્રાન્સમીટર’ મૂકી દીધું હોય તો? પણ બીજો પ્રશ્ન એ થાય કે, જ્યારે આ પક્ષીની આટલી ઓછી વસ્તિ બચી છે ત્યારે આવા પ્રયોગોની યોગ્યતા કેટલી?

ખડમોરની માદા ઘાસિયાં મેદાનોમાં તો ક્યારેક ખેતરમાં માળો કરે છે. વધતી જતી માનવ-વસ્તિને લીધે ઘાસિયાં મેદાનો અદશ્ય થઈ રહ્યાં છે.

જુનાશકોએ લગભગ બધી જ પક્ષીજાતિઓ ઉપર નકારાત્મક અસર કરી છે. છેલ્લાં ૨૫ વર્ષોમાં પ્રજનન વિસ્તારોમાં ખડમોરની સંખ્યા ઘટીને ૨૦% થઈ ગઈ છે. બિનપ્રજનન વિસ્તારોમાં તેઓ કયાં જોખમોનો સામનો કરી રહ્યાં છે, તે અંગે ભાગ્યે જ કોઈ માહિતી હોય.

૧૯૮૪-૮૫માં ડૉ. રવિશંકરને તેઓની પીએચ.ડી.ની ઉપાધિ માટે સૈલાનામાં ખડમોરનો અભ્યાસ કર્યો હતો. આ ગણામાં અમે નોંધું હતું કે, કૂદકો મારતી વખતે ખડમોર જે અવાજ કાઢે છે તે અવાજ, જ્યારે એ જમીન પર હોય ત્યારે નથી કાઢતો. કૂદકા સિવાય તો આ પક્ષી લગભગ મૂંગું છે એમ જ કહી શકાય.

‘નેચર કલાબ, સુરત’ના મુકેશ ભાડે કૂદકો મારતા ખડમોરની અનેક તસવીરો લીધી છે. છેલ્લાં ૨૫ વર્ષોમાં નવેન્દુ લાડ અને મેં પણ ખડમોરની અનેક તસવીરો લીધી છે. ખડમોર અવાજ કેવી રીતે કાઢે છે તે વિશે અમે કોઈ

નિર્ણય ઉપર ન હતા આવી શકતા. ૨૦૦૭ના ચોમાસામાં મુકેશ ભાડે ખડમોરના કૂદકાનું દર્શયમુદ્રણ (video-recording) કર્યું. અવાજનો ગાળો, અવાજના નવ ધ્વનિ-અંશ (bit) સાથે પાંખોનો નવ વખત ફેફડાટ (beat), આવર્તન વગેરે બધાની ચોક્કસાઈ થઈ પણ અવાજ ખરેખર ક્યાંથી ઉત્પન્ન થાય છે તે વિગતથી અમે વંચિત રહ્યાં.



દાદા સાહેબને  
દ્રાન્સમીટરની પ્રયોગોની વિશે

૨૦૦૮માં મેં ફરીથી પાંખોની જીણવટભરી વિગત સાથે તસવીરો લીધી પણ અવાજ કેવી રીતે નિષ્પન્ન થાય છે તે માહિતીથી અજાણ રહ્યા.

ધોડા મહિના પહેલાં બી.એન.એચ.એસ.ના ડાયરેક્ટર શ્રી અસં રહેમાનીનો ફીન આબ્દો કે ડૉ. રવિશંકરનું હવે આપણી સાથે રહ્યા નથી.

હું ચાલુ વર્ષના ચોમાસા માટે તૈયારી કરી રહ્યો હતો. ખડકમોરના કૂદકાની તસવીરો તથા દશયમુદ્રાણને ધ્યાનપૂર્વક જોતાં જગ્ઘાયું કે, પ્રાથમિક પોંથાં પાંખોની અંદર વળે છે. એ પણ સ્પષ્ટ થયું કે, પાંખોમાં બે પ્રકારનાં હળવન્યાલન છે; એક પાંખોનો ફૂદકા દરમિયાન અંદર વળું આ બીજી 'મુવમેન્ટ' કૂદકા દરમિયાન ઉત્પન્ન થતા અવાજ માટે જવાબદાર છે, તે આપણે ગયા અંકમાં (વર્ષ ૨૦૧૦, પા. ૧૦) જોઈ ગયા.

પી. એમ. લાડ

બી/૧૪૮, શાહપુરા, ભોપાલ

(શ્રી પરશુરામ લાડ ૧૯૮૧માં વન્યજીવ શાખામાંથી વનવિધાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા. તેઓ પક્ષીનિરીક્ષક હોઈ પક્ષી-અભયારણ્યો ઊભાં કરવાનું કાર્ય તેઓને સોંપાયું. ડૉ. સતીમ અલીની મધ્યપ્રદેશની મુલાકાતો વખતે શ્રી લાડ તેઓની સાથે રહેતા. છેલ્લે છેલ્લે તેઓ વન્યજીવ શાખામાં મુખ્ય વન-સંરક્ષક તરીકે સેવા આપતા હતા. ૧૯૯૮માં તેઓની નિવૃત્તિ પછીથી તેઓ ખડકમોરના વિસ્તારોની નિયમિત મુલાકાતો વે છે. ગત અંકમાં ખડકમોર દ્વારા કૂદકા દરમિયાન ઉત્પન્ન થતા અવાજ વિરોના તેઓના અભ્યાસની વિગતો આપવામાં આવી હતી. પ્રસ્તુત નોંધ એ અભ્યાસના પરિપ્રેક્ષયને સ્પષ્ટ કરવા માટે જરૂરી હતી – સં.)




## A photographic field guide to the **BIRDS OF GUJARAT**

Available at

**Dr. R. B. Balar**

10/A, Sweet Home Society,  
Shreyas Tekra, Ambawadi Vistar  
P. O. Ahmedabad-380 015  
Ph: 26610533 M:9427703589

**Gurjar Grantharatna Karyalaya,**  
Gandhi Road, Ahmedabad 380 001  
Ph: 22144663



**Shri Lavkumar Khachar**  
an eminent naturalist and  
bird watcher of Gujarat says

..... The photographs are of great fidelity and certainly help in identification of birds seen on any walk in a city garden or across the countryside, but above all, we Gujaratis must possess a copy of it for no other reason than as a reminder of the great joys right at our doorsteps if only we know when to stop and where to look.....

**Shri Laisinh Raol,**  
an eminent Gujarati writer and author of four books on birds of Gujarat says

The husband and wife team has made bird watching as an obsession spending more and more of their spare time visiting different areas of India. This book is the result of two decades looking at birds through their camera's lens.....

# નિરીક્ષણ નોંધ



## ખેરખડાનાં કેટલાંક વિરલ નિરીક્ષણો

મેં તા. ૭-૮ જૂન, ૨૦૧૦ના રોજ નાગપુર પાસેના તાડોબા વાઘ અભયારણની મુલાકાત લીધી. તા. ૮ની સવારે ત્યાં આશ્ર્ય સાથે વૃક્ષની ડાળીએ બેસી ખેરખડા (Indian Treepie)ને ભીમરાજને (Greater Racket-tailed Drongo) ખાતો જોયો. જો કે, મેં ખેરખડાને શિકાર કરતાં જોયો ન હતો પરંતુ હું આ શિકાર તેણે જ કર્યો હતો તેમ માનું છું, કારણ આજુબાજુમાં કોઈ અન્ય શિકારી હતું નહીં અને શિકાર તાજે સડ્ચા વગરનો જણાતો હતો. મેં કેટલીક તસવીર લીધી. મને આ વાતનું ઘણું આશ્ર્ય થયું, કારણ મેં ખેરખડો એક ભીમરાજ જેટલા મોટા પક્ષીનો શિકાર કરતો હોય તેવું સાંભળ્યું ન હતું.

તા. ૧૦ની સવારે લગભગ એ જ જગ્યાએ ખેરખડો અને ઝૂમતા ચામાચીડિયાની મંત્રમુખ કરતી લડાઈ જોઈ. ખેરખડો નિર્દ્યતાપૂર્વક ચામાચીડિયા પર સતત હુમલો કરતો હતો. તે પંજાથી તેનું ગળું પકડવાનો પ્રયત્ન કરતો હતો, જ્યારે ચામાચીડિયું તેને બટકા ભરતું હતું. લડાઈ ત મિનિટ જેટલી ચાલી. અંતે ચામાચીડિયાનું ગળું પકડવામાં તે સફળ થયો અને બીજી પ મિનિટ, ત્યાં સુધી પકડી રાખ્યું જ્યાં સુધી ચામાચીડિયાએ



હલનયલન બંધ ન કર્યું. મેં આ ઘટનાની સરળ લીધી.

ચામાચીડિયાની પ્રજાતિનો ખ્યાલ આવ્યો નહીં પરંતુ મોટે ભાગે 'ફૂટ બેટ' હતું, કારણ તેનું કદ ઉથી ૪ ટેંચ અને પાંખોની પહોળાઈ ઉથી ૮ ટેંચ હતી. મેં પ્રથમ વાર આ રીતે ખેરખડાને ચામાચીડિયાનો શિકાર કરતા જોયો.

આ ઉપરથી એવું જણાય છે કે, ખેરખડો માનીએ છીએ તે કરતાં વધુ માંસભક્તિ (carnivorous) અને તકસાધુ (opportunistic) છે.



રોહિત ગણપુરે

C/O પરશુરામ પોરટિ વર્ક્સ,  
નજરબાગ સેટેશન સામે, મોરબી-૩૬૪૨



## અતુલમાં નારંગી કસ્તૂરાનું આગમન

માનું ગામ અતુલ, ઘટાદાર વૃક્ષો અને હરિયાળીથી આશ્ચર્યાદિત છે. હાલમાં થયેલા ઝરમર વરસાદથી હરિયાળીમાં અભિવૃદ્ધિ થઈ છે. તા. ૧૪-૦૬-૧૦ના રોજ હું મારા કામ અર્થે કોલોનીના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને કોઈ એક પક્ષીનો અનોખો કલરવ સાંભળવા મળ્યો. મોટરસાઈકલ પાછું વાળીને ઉત્સુકતાપૂર્વક જ્યાંથી અવાજ સંભળતો હતો ત્યાં આવી ઊભો રહ્યો. આશ્ર્ય સાથે મને સામેનાં ગુલમહોરના વૃક્ષ ઉપર ૨૦ ફૂટ ઊંચે નારંગી કસ્તૂરો (Orange-headed Thrush) જોવા મળ્યો. સતત કલરવ કરી બીજાને આમંત્રિત કરી રહ્યો હતો. થોડી ક્ષણોમાં તેની જોડ પણ આવી પહોંચી. લગભગ દસ મિનિટ સુધી એક જ સ્થળે કલરવ કર્યા બાદ બંને પક્ષીઓ ઊરી ગયાં.

ત્યાર બાદ, સતત આ પક્ષી માટેની મારી શોધ ચાલુ રહી. મારા માટે આ પક્ષી અતુલ ગામમાં હોવું નવાઈજનક હતું. ૧૮-૦૬-૧૦ના રોજ મિત્ર રાજેશશ

પટેલ સાથે પાર નહીં નજીકના આંબાવડિયા અને ઝડીઓમાં શોધ કરી. લગભગ અડધો કલાકની મથામણ પછી મને ફરી એ જ કલરવ સાંભળવા મળ્યો. ધીમે પગલે નજીક જતાં પાણીના ખાબોચિયા પાસેથી ઊડીને એક પક્ષી ઝડીમાં ભરાઈ ગયું. છતાં પણ સતત શોધને અંતે અમને ડેડ ઉંબરનાં ઝડ ઉપર એક કસ્તૂરો જોવા મળ્યો. બે તસવીરો પણ લઈ લીધી.

#### મહામહિસન ઉસમાનભાઈ જત

૩, આનંદ કોલોની, પોલ્ટ્રી કાર્મ રોડ, ફર્સ્ટ ગેર્ડ, અતુલ-૩૮૬૦૨૦

### ગવિયર તળાવની મુલાકાત

તા. ૮-૫-૧૦ : સવારે ૬ વાગ્યે દુમસ માર્ગ પર આવેલા ગવિયર તળાવ પર પહોંચ્યો. પીળક (Eurasian Golden Oriole)નો અવાજ સાંભળ્યો. ૨ સુરુંગી પાનબગલી (Chestnut Bittern) જોઈ. ઉ દૂધરાજ (Asian Paradise-Flycatcher), બે માદા અને કથ્થાઈ રંગનો લાંબી પુંછડીવાળો નર જોયા. દૂધરાજનો નર એક નાનો, લાલ રંગનો વાણિયો (Dragon Fly) પકડી લાયો. અને ગાંડા બાવળ પર બેસી ૬-૭ વખત તેને પટકી ખાઈ ગયો. નાના પતરંગા (Small Green Bee-Eater)ને હવામાં ઊડતા વાણિયાને પકડતા જોયો. તે ચાંચયાં લઈને આગળ જતો જ હતો કે તરત જ કાળો કોશી (Black Drongo) અવાજ કરતો આવ્યો ને તેની પાછળ પડ્યો. તેણે પતરંગાને શિકાર છોડવાની ફરજ પાડી અને જાતે શિકાર લઈ ગયો. પ્રગતિ, સુમી અને હું – અમે ત્રણેએ કાસીદના ઝડ પર નાચણ (Fantail Flycatcher) જોઈ. ગવિયર પર તેની આ પહેલી નોંધ છે. (કઈ નાચણ? -સં)

તા. ૧૬-૫-૧૦ : ગવિયર તળાવ પર ઉ દૂધરાજ (બે માદા અને એક નર) જોયાં. નાના પતરંગાને હવામાંથી વાણિયો પકડતાં જોયો. ૪ સુરુંગી પાનબગલી અને ૧ પીળી પાનબગલી (Yellow Bittern) જોઈ. મેં મોટા ભાગે નીલ જલમુરઘા (Purple Moorhen)ને જળકુંભી પર જોયો છે, પહેલી વખત તેને ચિયા વાળીને

તેના ઉપર બેઠેલો જોયો. નાના કલકલિયા (Small Blue Kingfisher)ને સામાન્ય રીતે પાણીની સપાટીને સમાંતર ઊડીને અથવા ઝડની ઝાળી પર બેસીને પાણીમાં દૂબકી મારી શિકાર કરતા જોયો છે. હું, ધીરજ, વ્રજેશ અને હાર્દિક, અમે પ્રથમ વખત નાના કલકલિયાને કાબરા કલકલિયા (Lesser Pied Kingfisher)ની માફક હવામાં એક જ જીવાએ સ્થિર રહીને દૂબકી મારી શિકાર કરતાં જોયો. તેણે ઉ વખત આ રીતે દૂબકી મારી અને પછી નજીકના ગાંડા બાવળ પર જઈને બેસી ગયો.

#### કાગાવલોકન

૧૬-૦૫-૧૦ : મારી ઔદ્ઘિકીસ પાસે ચાની લારીની નજીક પાણીની કુંડી મૂકી છે. ચકલી, કબૂતર, કાબર, જિસકોલી, કૂતરાં બધાં જ તેમાંથી પાણી પીઠાં હોય છે. બપોરના સમયે જિરનારી કાગડો (Jungle Crow) માંસનો ટુકડો લઈને આવ્યો. આજુબાજુ જોઈ તેણે ટુકડો પાણીની કુંડીમાં નાખ્યો. પાણી પીધું અને પછી માંસનો ભીનો ટુકડો લઈ નજીકના સરગવાના ઝડ પર બેસીને ખાધો. વારાફરતી આ પ્રમાણે તેણે ત્રણ વખત માંસનો ટુકડો લઈ આવી ખાધો.

૨૦૫-૧૦ : ઔદ્ઘિકીસ પાસે ચાની લારી પર વિરલ અને હું ચા પીતા'તા. એવામાં જિરનારી કાગડો માંસનો ટુકડો લઈ આવ્યો. અમે બંને જણાએ જોયું કે તેણે ઉપર મુજબની રીતે જ તે ખાધો. આ અગાઉ, મેં ઘણી વખત જિરનારી કાગડાને રોટલી, ભાખરી પાણીમાં દુબાડી ખાતો જોયો છે. ઉમરા ઓવારા પર તેને ચાંચયાં ગાંઠિયા ભરી, પાણીમાં દુબાડીને ખાતો જોયો છે.

૨૨-૫-૧૦ : મજુરાગેટ, સુરતસ્થિત મારી ઔદ્ઘિકીસની બાજુની અગાસી પર ધાઢા કાગડાને અવાજ કરતા સાંભળ્યા. ઔદ્ઘિકીસ આઠમા માળે છે. હું છછા માળે પહોંચ્યો અને નીરે અગાસીમાં જોયું તો એક જિરનારી કાગડો બીજા જિરનારી કાગડાની સાથે પગના પંજ ભેરવી પાંખ અને ચાંચથી લડતો હતો અને બાકીના કાગડા “કા-કા”નો અવાજ કરી જાણે બંનેને ઉશ્કેરતા

## નિરીક્ષણ નોંધ

હોય એવું લાગતુંનું. મેં લગભગ ૧૫-૨૦ મિનિટ સુધી તેમને લડતા જોયા. મારી પાસે કેમેરાવાળો મોબાઇલ નહોતો તેથી ફોટો કે 'વિડિયો-ક્લિપ' લઈ શક્યો નહિં. ઓફિસથી ફોન આવતા હું ત્યાંથી ચાલી ગયો. અડધા કલાક પછી આવીને જોયું તો એક કાગડાએ બીજાનાં પીંછાં છૂટાં કરી નાખ્યાં હતાં, તેની છાતીનો ભાગ ફાડી નાખ્યો હતો અને માંસ ખાતો હતો. ૫-૧૦ મિનિટ મેં તે જોયું.

### કુદરતી કીટનાશક

૨૩-૭-૧૦ની સાંજથી વરસાદ બરાબર જામ્યો છે પણ દિવસના થોડા ઉકળાટને લીધે કાળી કીડી અને મંકોડા દરની બહાર ઘરની બહારની ભીતિ પર હારમાં ગોઠવાઈ પોતાના નિત્યકમમાં લાગ્યો પડે છે. બે દિવસથી કીડી-મંકોડાને લીધે મમ્મી અને કાકી હેરાન થતાંતા. આથી વાંચા પાઉડર કે કેરોસીન નાખી ઉપદ્રવ ઓછો કરવાનો પ્રયત્ન જ કરતાંતા ને મેં તેમને અટકાવ્યા. તેમને થોડી રાહ જોવા કહ્યું. ત્રણ-ચાર વખત ચકલી (House Sparrow) અને બે વખત કાબર (Common Myna) દરમાંથી નીકળતાં એકવદોકલ કીડી-મંકોડા ચાંચમાં દૂર લઈ જઈ ખાતાં જોયા. ઉકળાટ શરૂ થયો ત્યારથી જ આ મુજબ મેં અવલોકન કર્યું. ભીતિ પર ચડ-ઉતીર કરતી કીડીને પકડવા ચકલી એક જ જગ્યા પર ઊડે, થોડી ઉપર-નીચે થાય, પાંખ વીંજવાળો અવાજ, ભીતિ પર પકડ જમાવી બેસી જાય. ખૂબ સુંદર લાગ્યું. મારી સવા બે વર્ષની ભત્રીજી પણ આ જોઈ ખુશ થઈ ગઈ અને ચકલી આવતાં જ તે કીડી-મંકોડા ખાશે એવી આશાથી શાંતિથી જોતી રહે. આહારજાળ અને પોષણ કરી આમ જ તાદશ થતી'તી. કૃત્રિમ કરતાં કુદરતી કીટનાશક, વિહુંગાવલોકન, પર્યાવરણ શિક્ષણ, મોજમજા બધું જ એક સાથે. નવી પેઢીને આ જ રીતે શિક્ષણ મળે ને!?

દર્શન જરદોષ  
સ્વયંસેવક, નેચર કલબ, સુરત

### દરિયાકિનારે પક્ષીનિરીક્ષણ

તા. ૧૩-૦૬-૧૦ના રોજ હું, અશ્વિનભાઈ પોમલ અને મનોજભાઈ ટાંક વોંધ (તા. ભચાઉ, જિ. કરદા)થી ૩૦ કિ.મી. દરિયાકિનારા બાજુ પક્ષીનિરીક્ષણ કરવા ગયેલ. તેમાં અમે જોયેલ પક્ષીઓની યાદી નીચે મુજબ છે.

મોટો ચંદ્રુલ (Common Crested Lark) ૧૫, રાખોડીશિર ભૌંયચકલી (Ashy-crowned Sparrow-Lark) ૧૦, ચકલી (House Sparrow), દરિયાઈ બગલો (Western Reef-Egret) ૮, ચમચો (Eurasian Spoonbill) ૪૮, પીળીચાંચ ઢોક (Painted Stork) ૧૦, નાનાં હંજ (Lesser Flamingo) (પુષ્ટ-૪૭, અપુષ્ટ-૬), મોટાં હંજ (Greater Flamingo) ૨૬૨, વરેટ ધોળો બગલો (Median Egret) ૧૦, મોટો ધોળો બગલો (Large Egret) ૫, મોટો કાળિયો (Large Cormorant) ૨૦, નાની ખલિલી (Whimbrel) ૧૩ (૬ ઉડતી + ૭ બેઠેલી), કબૂત બગલો (Grey Heron) ૨, નાની વાબગલી (Little Tern) ૭, ગજપાંઉ (Black-winged Stilt) ૧૦, રિટોરી (Red-wattled Lapwing) ૧૦.

### રાજેન્દ્રભાગની માળાવસાહિત

તા. ૨૦-૦૬-૧૦ના રોજ મેં અને અશ્વિનભાઈ પોમલે હમીરસર તળાવ (તા. ભુજ)ની મધ્યે આવેલ રાજેન્દ્રભાગમાં ઢોર બગલા (Cattle Egret)ના માળાની ગણતરી કરી હતી.

- ઢોર બગલાના માળાની સંખ્યા આશરે ૮૬૮ જેટલી હતી.
- માળા મુખ્યત્વે લીમડા, ગુલમહોર તથા ખજૂરીનાં ઝડ પર હતા.
- ૮થી ૧૦ ઢોર બગલા (પુષ્ટ અને અપુષ્ટ) મૃત હાલતમાં જોવા મળ્યા હતા.
- બાગમાં જ આવેલા નીલગિરિના ઝડ પર ૧૦ મોટા કાળિયા પણ જોયા.

- હમીરસર તળાવની આજુબાજુના વિસ્તારમાં પીળીચાંચ ઢેંક ૨૨, ચમચા ૨૬, કેંચીપૂછ વાખગલી (River Tern) ૨, ટીલિયાળી બતક (Spot-billed Duck) ૨૦, સફેદછાતી કલકલિયો (White-breasted Kingfisher) ૧, કાબરો કલકલિયો (Lesser Pied Kingfisher) ૧ જોયેલા.

સચિન દવે,

કેલાશનગર, ભુજ-કચ્છ, ૩૭૦૦૦૧

## ગીરમાં લાલપગ તુરુમ્તી

તા. ૨૪-૨૭ એપ્રિલ ૨૦૧૦માં સિંહ વસતિગણાતરી માટે ગયો ત્યારે સાસણથી બાબરિયા જતાં આંકલવાડી પાસે ઝડ (ઝડ કયું હતું તે ખબર ન પડી) ઉપર બેઠેલ લાલપગ તુરુમ્તી (Amur Falcon) જોઈ. મારા સાથી મિત્ર શ્રી મુકેશ આચાર્યના ડેમેરામાં રેની સુંદર તસવીર કેદ થઈ ગઈ. લાલપગ તુરુમ્તીને જોવાનો આ પહેલો પ્રસંગ હતો. સાથે બીજાં ઘણાંબધાં પંખીઓ જોવાનો અવસર આ તારીખો દરમિયાન મળ્યો. સિંહ-ગણાતરી સાચે જ એક અમૂલ્ય સંભારણું બની રહી.

ડૉ. તરુણ જોશી

‘નૂતન’, ૮, લક્ષ્મણાંદેવ પાર્ક

ક્લેક્ટરના બંગલા સામે, પીજ રોડ, નડિયાદ-૨

## દાંદ્રોડામાં કંઠીલો ચુંગાડ

શિયાળાની ઋતુમાં ઈન્દ્રોડા પ્રકૃતિઉદ્યાન ખાતે પક્ષીદર્શન માટે અવારનવાર જઈએ. તેમાં કંઠીલો ચુંગાડ (Collared Scops - Owl) નિયમિત રીતે અમુક ચોક્કસ વિસ્તારમાં નજરે ચરી જાય છે; જેમ કે,

૧. પ્રકૃતિ-શિબિર સ્થળ નજીક સૂકા ઝડમાં ૨
૨. પાણીના પંપહાઉસ નજીક લીમડામાં ૧
૩. વિશળ પક્ષીગુહની સામેનાં ઝડી-ઝંખરામાં ૨

અમે સવારના ૬.૦૦થી ૧૦.૩૦ કલાક દરમિયાન અને ઘણી વાર ઓફિસ સમય પછી પણ નિયમિત જતાં હોઈએ છીએ.

## ડોકામરડી

ઇન્દ્રોડા પ્રકૃતિઉદ્યાન ખાતે આવેલ આયુર્વેદિક વનસ્પતિઉદ્યાનમાં સવારે બોર ખાવા માટે ૪૫ જેટલાં હરિયલ (Yellow-legged Green Pigeon) આવતાં જે જોવા માટે અમે જતા હતા. બપોરના સમયગાળમાં આ પક્ષીઓ ત્યાં જ નજીકના લીમડાના ઝડ પર બેસી રહેતોં હતાં.

તા. ૨૨-૧-૧૦ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે એક ડોકામરડી (Eurasian Wryneck) જોવા મળેલ. દેશી બાવળના ઝડ પર લાગેલી ઊધર્ય અને કીરીઓ ખાતી હતી. શિયાળાની ઋતુમાં આ પક્ષી આ વિસ્તારમાં એકલ-દોકલ જોવા મળી રહે છે. આ અગાઉ પણ આ પક્ષી ઇન્દ્રોડા પ્રકૃતિઉદ્યાન તથા ગાંધીનગરના અન્ય વિસ્તારોમાં જોવા મળેલું છે.

## લપકામણ તળાવ ખાને પક્ષીદર્શન

અમદાવાદ નજીકમાં આવેલ લપકામણ ગામ-તળાવ ખાતે તારીખ ૧૨-૨-૧૦ના રોજ પક્ષીદર્શન માટે ગયેલા. સવારના ૬.૩૦ કલાકથી ૧૦.૩૦ સુધી અમે ત્યાં પક્ષીદર્શન કરેલું, જેમાં અમને નીચે મુજબ પક્ષીઓ જોવા મળેલ.

નક્ટા (Comb Duck) ૫, ટીલિયાળી બતક (Spot-billed Duck) ૩, નાની મુરઘાબી (Common Teal) ૧૪ નર + ૧૧ માદા, ગયણો (Northern Shoveller) ૮૫ (૫૪ નર, ૪૧ માદા), નાની તુતવારી (Common Sandpiper) ૧૨, શેતપૂછ તુતવારી (Green Sandpiper) ૩, ટીલિયા (Ruff) ૨૮, ગજપાંડ (Black-winged Stilt) ૨૪, કબૂત બગલો (Grey Heron) ૧, તીલટીચાંચ (Pied Avocet) ૧૮, ટિટોડી (Red-wattled Lapwing) ૧૬, મોટા હંજ (Greater Flamingo) ૮૭, ચમચા (Eurasian Spoonbill) ૩, ધંટી ટાંકણો (Common Hoopoe) ૨.

આ પહેલાં પણ હું અવારનવાર લપકામણ તળાવ જતો હતો. ત્યાં જોવા મળતાં મોટા હંજની નોંધ નીચે

## નિરીક્ષણ નોંધ

મુજબ છે.

૨૮-૧૨-૦૮: ૭૦, ૨૨-૧-૧૦: ૪૨, ૭-૨-૧૦ :  
૩૭, ૧૩-૨-૧૦: ૨૮

તદ્વારાંત, તા. ૭-૨-૧૦ના રોજ એક સારસ  
(Sarus Crane) પણ આ જ તળાવમાં જોવા મળેલ.

તાજેતરમાં આ તળાવને ખોદકામ કરીને ઉંડું  
કરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં કદાચ આટલી  
સંખ્યામાં પક્ષીઓ જોવા નહીં મળે.

### શેલડ ડેલ્ફિન

બ્લોક નં. ૧૧૮/૧, “ચ” વાઈપ, સેક્ટર-૨૧, ગંધીનગર-૩૮૨૦૨૧

### બનાસકાંઠામાં પક્ષીનિરીક્ષણ

➢ દાંતીવાડા તથા સીપુ તેમ ખાતે સારસ (Sarus Crane) ગણતરી કાર્યક્રમમાં સુરેશ પ્રજાપતિ, રોહિત પ્રજાપતિ તથા નેમિ પ્રજાપતિએ ભાગ લીધો હતો.

તા. ૧૫-૫-૧૦ : સાંજે ૬.૩૦ થી ૭.૩૦ દાંતીવાડા તેમ : સારસ-૩.

તા. ૧૬-૬-૧૦ : સવારે ૬.૧૦થી ૬.૪૦ : દાંતીવાડા તેમ : સારસ-૧૩, મોટાં હંજ (Greater Flamingo)-૩૬, પીળીચાંચ ઢોંક (Painted Stork)-૩૨, ચમચા (Eurasian Spoonbill)-૪૬, સહેદ કંકણસાર (Oriental White Ibis)-૩૮.

તા. ૧૬-૫-૧૦ : સવારે ૬.૩૦ ૧૧.૦૦ : સીપુ તેમ : સારસ-૨૬, પીળીચાંચ ઢોંક- ૫૬, સહેદ કંકણસાર- ૪૧, ચમચા-૨૬, કાબરો કલકલિયો (Lesser Pied Kingfisher)-૬, ચેતપંખ જલમાંજર (Pheasant-tailed Jacana)-૪

➢ તા. ૨૬-૨-૧૦ના રોજ જેસોર અભયારણ્યમાં વિશ્વાન વિદ્યાલય, પાલનપુરના પ્રકૃતિમંડળના સભ્યોની ટુકડીએ પથભ્રમણ-પક્ષીનિરીક્ષણનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં નોંધીલ અગત્યાનાં પક્ષીઓની યાદી આ સાથે સામેલ છે.

કાબરી કારચિયા (Tufted Duck), ગયશો (Northern Shoveller), ભગવી સુરખાબ (Ruddy

Shelduck), ચમચા, રાજહંસ (Bar-headed Goose), ગાજહંસ (Greylag Goose), ફાટીચાંચ ઢોંક (Asian Openbill-Stork), મોટો ચકવો (Great Stone-Plover), નાની દૂબકી (Little Grebe) વગેરે.

(આપે આપેલ યાદીમાં મહદેશી પાણીનાં પક્ષીઓ છે. તે જેસોરમાં પ્રવેશતાં જ - તળેટીમાં આવેલા જળાશયમાં જોયાં હો. જળાશયો - ‘ક્યાં?’ તથા ‘ક્યાં?’ની વિગતો આપવી જરૂરી હતી. રાજહંસ તથા ગાજહંસ ઉત્તર ગુજરાતનાં જળાશયોમાં હવે નિયમિત જોવા મળે છે. છતાં, તેમની નોંધ અગત્યાની છે એટલે સંખ્યા અને સ્થળ વિશે તો માહિતી આપવી જ જોઈએ. સહેદ સુરખાબ (Common Shelduck) ખૂબ જ વિરલ છે. તસવીરના પુરાવા વિના તેની હાજરી પર પ્રશ્રાર્થ મૂકીએ છીએ. તે જ રીતે પચરંગી શક્કરખોરાનો વાપ ૬. ગુજરાતમાં નથી. તેની હાજરી સામે પણ પ્રશ્રાર્થ મૂકીએ છીએ. - સં.)

### સુરેશ પ્રજાપતિ

મદદનીશ પ્રાધ્યાપક આર. આર. મહેતા ડોલેજ એંફ સાયન્સ  
પાલનપુર, જી. બનાસકાંઠા



### પૂર્વ ગીરનો અમારો પ્રવાસ

તા. ૨૨-૬-૧૦ના રોજ સોમનાથ જતા રસ્તામાં સાવરકુંડલા રોકાઈ ગયા. ત્યાંથી શ્રી ભાનુભાઈ અધ્વર્યું અને શ્રી જી. કે. ત્રિવેદીની સંગાથે એમના માર્ગદર્શન પ્રમાણે ત્રણ દિવસ સુધી નજીકના અલગ અલગ વિસ્તાર જેવા કે ધોળીકુઈ, સેંજલ બંધાર, ઈશ્વરિયા હનુમાન, અને હનુમાનગણા વગેરેની મુલાકાત લીધી. દરેક વિસ્તાર વર્ષના પહેલા આગમનથી ભીજાઈ, લીલી ચાદર ઓકી, શાણગાર સજી બેઠો હતો. એ સુંદર વિસ્તારમાં અમે રોજિંદા રહેનાર સામાન્ય પક્ષીઓ ઉપરાંત નાનીમોટી સંખ્યામાં ખાસ નોંધનીય નીચે પ્રમાણેનાં પક્ષીઓ જોયાં.

ચકવો (Stone Curlew), નાનો ચંડૂલ (Sykes's Lark), મોટો ચંડૂલ (Common Crested-Lark),

લોટણ હોળો (Red Collard-Dove), તેતર (Grey Francolin), તાલેયો તેતર (Painted Francolin), શોબિંગી (Common Iora), સોનેરી શોબિંગી (Marshall's Iora), નાની ફુડકફુલ્ટી (Franklin's Prinia), લાલભાલ ફુડકફુલ્ટી (Rufous-fronted Prinia), ફુડકફુલ્ટી (Ashy Prinia), પાન ફુડકફુલ્ટી (Plain Prinia), વન ભડકિયું (Jungle Bush Quail), ધોળાપગ બિલ બેટર (Small Buttonquail), કાબરો રાજલાલ (White-bellied Minivet), નાનો રાજલાલ (Small Minivet), દૂર્ધરાજ (Asian Paradise-Flycatcher), પીળક (Eurasian Golden Oriol), રાખોડી રામચકલી (Great Tit), ચાતક (Pied Crested Cuckoo) વગેરે.

પરંતુ આ ત્રણ દિવસમાં ખાસ નોંધવા જેવી બે બાબત હતી. (૧) ઈથરિયા હનુમાનના પ્રાંગણમાં આવેલા વડના ઝડમાં નીલપંખો (Black-napped Monarch- Flycatcher) અને (૨) પ્રાંગણની બાજુમાં જ આવેલા બંધારામાં ટીલિયાળી બતક (Spot-billed Duck)-ની સાથે બેઠેલી એક નીલશિર (Mallard).

જૂનના અંતે પઢતી ગરમીમાં પણ આ વિસ્તારમાં નીલશિરની હાજરી એ મોટી આશ્ર્યજનક બાબત હતી.

ડૉ. આર. બી. બલર, ડૉ. રેખા આર. બલર  
૧૦-એ, સ્વીટહોમ સોસાયટી, શ્રેયસ ફાઉન્ડેશન પાસે, અમદાવાદ-૧૫

## રાજકોટમાં ફાટીયાંચ ટોંકની

### માળાવસાહત: સ્પષ્ટતા

ગ્રીઝ ૨૦૧૦ના 'વિહંગ'ના અંકમાં તા. ૨૦-૬-૧૦ની અમારી ફાટીયાંચ ઠોક (Asian Openbill-Stork)ની માળાવસાહતની નોંધ બાદ અમે સંભવિત વસાહત ચકાસવા તા. ૭-૭-૧૦ના રોજ તે સ્થળે ગયા. તે વખતે ત્યાં એક પણ પક્ષી ન હતું. જે માળા પર ફાટીયાંચ ઠોક બેઠેલો જોયો હતો તે માળો પણ ન હતો. અમે જે પહેલાં નોંધ્યું તે શરૂઆતની માળાપ્રવૃત્તિ હોઈ શકે અને પછી પક્ષીઓએ તે સ્થળ છોડી દીધું હોય. કદાચ તે રાતવાસો પણ હોય. પરંતુ હવે તે માળાવસાહત ગણી શકાય નહીં.

### અશોક મશરૂ

અ-૭, આલાપ હેરિટેજ, સત્યસાંઈ હોસ્પિટલ પાસે,  
કાલાકડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧

## કડીની આસપાસ મારી ચાતકની

### આ અંતુની પ્રથમ નોંધ

ચાલુ વર્ષે હું મહેસાણાથી કડી તરફ આવતો હતો રસ્તામાં ઊટેવા ગામ પાસે વનકુટિર અને નર્સરી છે. ત્યાં મેં ઋતુનું પ્રથમ ચાતક જોયું; તા. ૧૧મી જૂન, સમય સાંજે ૪ વાગ્યાનો. ત્યાર બાદ ૧૫મી જૂનના રોજ એક સાથે તુ ચાતક ઊડતાં અવાજ કરતાં મારી તદ્દન નજીકીથી પસાર થયાં. ચાલુ ચોમાસામાં મેં સારી

## ગોંડલના સદગત રાજવીનો વૃક્ષપ્રેમ

આવતી પહેલી તારીખે એક કરોડ વૃક્ષો વાવીને દેશવ્યાપી વૃક્ષારોપણ પર્વ ઊજવવાનો અનુરોધ થયો તે સમયે, ગોંડળ (સૌરાષ્ટ્ર)ના સદગત રાજવી ભગવતસિહુણા વૃક્ષપ્રેમનો એક પ્રસંગ યાદ આવે છે. એમની અંગત પરવાનગી વિના ઝડ કાપવાની એમના આખા રાજ્યમાં મનાઈ હતી. એક વખત રાજધાની ગોંડળની જ એક નવી થતી કુશાદે સરકની વચ્ચોવચ્ચ જંગી ઝડ આવતું હતું, તે કાપવાની સેટ એન્જિનિયરે

અનુમતિ માગી. તેને ના પાડતાં એમજો કહ્યું, "આપણો આ નવલખો મહેલ છે તે કદાચ પડી ગયે નવો ચણાવીને ઊભો કરવાનો સંકલ્ય કરીએ, તો ધારી મુહંતમાં અરે એક રાતમાં પણ, આપણે ચાહીએ ટેટલી લક્ષ્મી ખરચીને કરી શકીએ; પણ કાપી નાખેલું ઝડ આપણે ગમે ટેટલા ખર્ચે પણ ઊભનું કરી શકવાના હતા?"

સ્પોત 'કુમાર', જૂન ૧૯૫૦

## નિરીક્ષણ નોંધ

સંખ્યામાં ચાતક જોયા.

આ જ ઋતુમાં રોજ વહેલી સવારે તથા સાંજે બપૈયાનો અવાજ ખૂબ સાંભળવા મળ્યો. જે વિસ્તારમાં જાઉં ત્યાં બપૈયાનો અવાજ સાંભળવા અચૂક મળે. આજે તા. ૩૧-૭-૧૦ના રોજ સવારે મેં વીજળીના તાર પર હારબંધ બેઠેલા ત બપૈયા જોયા. તેમનું ગાન ચાલુ હતું.

### ચકલીનો રાતવાસો અને માણો :

અત્યારે જુલાઈના છેલ્લા દિવસો છે. મારા ઘરે વીજળીના મીટરની પેટી પર કેટલાક દિવસથી ચકલીની એક જોડીએ નવેસરથી માળો બનાવવાનું શરૂ કર્યું છે. ચાલુ વર્ષ કરીમાં પક્ષીપરબો બાંધવામાં આવતો ઘર આંગણો ચકલીની “ચક ચક” વધુ સાંભળવા મળી છે.

મારા ઘર હું બારેમાસ ચકલી જોઉ છું. વીજળીના મીટરની પેટી ઉપર રાતવાસો કરવા આવે છે. ક્યારેક ઘરમાં ટ્યુબલાઈટની લાકડી ઉપર પણ રાતે બેસે છે. મને ગમે છે. ચકલીની માળા બનાવવાની શરૂઆત ફાગણ માસ એટલે કે હોળી-ધૂળેટીની આસપાસથી થાય છે. આ દિવસોથી ગામ કે શહેરમાં ચકલીની આવનજાવન શરૂ થઈ જાય છે. માળા બાંધવા માટે તણખલાં, સૂરજી-દોચા વગેરે લાવવાં, માળામાં મૂકવાં, ઢીડાં મૂકી સેવવાં, બચ્ચાં થાય ત્યારે તેમને ખોરાક પૂરો પાડવો, આ બધાં કાર્યોમાં ચકલીની જોડ સતત વ્યસ્ત જોવા મળે છે.

અનિલ પટેલ,

બી-૨૬, શાયોના સોસાયટી, ડેન્રોજ રોડ, કડી-૩૮૨૭૭૫



### ગવિયરની મુલાકાતે સર્પગ્રીવ

તા. ૧૮-૭-૧૦ રવિવારે, ઝરમર વરસાદમાં હું અને મારા બીજા ૮ મિન્ટો સુરત હવાઈમથક નજીક આવેલા ગવિયર તળાવની મુલાકાતે ગયા હતા. તળાવની વચ્ચે પાણીમાં ‘નેચર ક્લબ, સુરત’ના સ્વયંસેવકો દ્વારા પક્ષીઓને બેસવા માટે ઊભા કરાયેલા લાકડા પર અમને સર્પગ્રીવ (Darter) નજીરે ચડી. ગવિયર ઉપર આ પક્ષી બીજ વખત મારી નજીરે ચડ્યું.

પહેલી વખત તા. ૨૧-૨-૧૦ના રોજ ડૉ. કલેકર અને વિરલ પ્રજાપતિ સાથે જોયું હતું. આ વખતે દૂરભીનથી નિહાળતો હતો અને તેણે લાકડાં પરથી પાણીમાં ઝંપલાયું. થોડી વાર ડોક ઉપર રાખી આમતેમ આંટા માર્યા. પછી પાણીની અંદર ગઈ. મને એ નવાઈ લાગી કે તે પાણીમાં લગભગ પાંચથી છ મિનિટ રહી. હું રાહ જોતો હતો કે ક્યારે અને ક્યાંથી એ બહાર આવશે? ત્યાં તો અચાનક બહાર આવી. તેની ચાંચમાં લગભગ એક વેંત જેટલી માછલી દેખાઈ. સર્પગ્રીવ તેની પકડ મજબૂત રાખી માછલીને આમતેમ હલાવી થોડી વાર પાણીની અંદર લઈ ગઈ. તેણે આવું ૪-૫ વખત કર્યું. મને એ નહોતું સમજાતું કે તે માછલી લઈને તે પાણીમાં શા માટે જતી હશે? ત્યાર બાદ, તેણે ચાંચમાં આડી પકડેલી માછલીને ધીરે-ધીરે ઉછાળી, ઊભી કરી અને ગળી ગઈ. એક પછી એક એમ બે માછલીનો અલ્યાંડાર કરી પાછી એ જ લાકડાં ઉપર જઈ પાંખો ફેલાવી બેસી ગઈ.

દક્ષેષ પટેલ

સ્વયંસેવક, ‘નેચર ક્લબ, સુરત’



### વિગર્સના શક્કરખોરા (પક્ષિમી

કૂલરાજ)નો ગુજરાતમાં વધી રહેલો

વ્યાપ

સાઈફ્રેસ (Sykes) વિગર્સના શક્કરખોરા (Aethopyga vigorsii)નું સૌ પ્રથમ ૧૯૭૨માં Cinnyris Vigorsii તરીકે વર્ણન કર્યું. રિપ્લી (Ripley)એ તથા અલી અને રિપ્લીએ ૧૯૭૪માં Aethopyga siparajaની ચાર ઉપજાતિઓનું વર્ણન કર્યું; seheriae, labecula, hicobarica અને vigorsii. ૧૯૮૮માં બ્રિમિટ તથા અન્યએ અને ૨૦૦૦માં કેન્ઝિમર્નેક તથા વાન પર્લોએ પણ આ ચાર ઉપજાતિઓને માન્યતા આપી, જેને તેમણે ‘races’ કહી. તાજેતરમાં (૨૦૦૫) રાસમુસેન તથા એન્ડરટને (Rasmussen and Anderton) પક્ષિમધાટની

ઉપજાતિને અનેક શારીરિક લક્ષણોના આધારે  
ઉપજાતિમાંથી પૂર્વી જાતિનો દરજજો આપ્યો.

### વર્ણન :

નર : A. s. seheriaeની જેમ ઉપરથી ઘણો  
વધારે ઘેરો, તેમાં તાલકું ચળકતું લીલું; તાલકાનો  
પાછળનો ભાગ તથા બોચી કાળાશ પડતાં, જેમાં  
તામ્રવરણી ઝાંય વધુ આવે; પીઠ ઘેરો ડિરમજુ-લાલ,  
અને તેમાંથી પીળાંનાં કાળાં મૂળ ડેકાય; ઢીકું પીળું;  
પૂછડીનો બહારનો દેખાતો ભાગ ચમકદાર લીલો; ઉડાન  
પીંછાં (flight feathers) ઘેરો છીકણી જે છેક ધાર  
ઉપર આછા બદામી થાય. ગાલની વચ્ચેની ચળકતી  
જંબલી પછી કાનની પાછળ સુધી લંબાય. ચહેરો ગળું  
અને છાતી ઘેરો લાલ. છાતીની વચ્ચેનો લાલ વધુ ઘેરો  
તથા ઊજળો અને તેમાં પીળી પાતળી રેખાઓ. પેટાળ,  
પડખાની પાછળનો ભાગ, પેદુ (vent) તથા પૂછડી  
નીચેનું ચકદું ઘેરો રાખોડી, જ્યારે પાંખની નીચેનો શરીર  
તરફનો ભાગ રાખોડી સહેદ.

માદા : આખી આછા ધૂળિયા લીલા રંગની,  
તાલકું બદામી પડતું જ્યારે નીચેના ભાગે રાખોડી વધુ.  
પેડાની ધારે ઝાંખો પીળો, શરીરની પડખેનો પાંખનો  
નીચેનો ભાગ રાખોડી સહેદ, જે ખભા નીચે પીળાશ  
પડતો થાય.

અપુણું પક્ષીઓ પણ માદા જેવાં.

### અંગ્રેજ પર્યાયો:

Violet-eared Red-Honeysucker  
Vigors's Yellow-backed Sunbird,  
Vigors's Sunbird  
Western Crimson Sunbird

### અવલોકનો :

તારીખ	સ્થળ	પક્ષીની સંખ્યા
૬-૧૦-૦૮	સગાઈ, શૂલપાણોશર	
	અભયારણ્ય	૧ નર

૬-૧૦-૦૮	"	૨ નર, ૧ માદા
૫-૮-૧૦	જૂના મોસડા, શૂલપાણોશર	
	અભયારણ્ય	૩ નર, ૧ માદા
૧-૧૦-૧૦	રતનમાળ રીછ	
	અભયારણ્ય	૬ નર તથા ૧ માદા
૬-૫-૧૦	પોળો, વિજયનગર, જિ. સા.કે.	૧ નર

સામાન્ય રીતે પદ્ધિમધાટમાં દક્ષિણે ગોવા સુધી  
જોવા મળતું ફૂલરાજ ઉત્તરે નર્મદા સુધી વાપ્ત છે.  
પદ્ધિમી સાતપુડા (ખાનદેશ)માં તળેટીથી ૧૦૦૦ મી.ની  
ઉંચાઈ સુધી તથા દક્ષિણે નીલગિરિ સુધી જોવા મળે છે.

ગુજરાતમાં શ્રી સલીમ અલીએ નર્મદાની દક્ષિણે  
ગચ્છીપળાનાં જંગલોમાં તેની નોંધ કરી છે (૧૯૫૪-  
૫૫). ૧૯૮૮માં મૌંગા તથા નવરોજુએ અને ૧૯૮૯માં  
દેસાઈ તથા અન્યએ તેને શૂલપાણોશર અભયારણ્યમાં  
નોંધ્યું છે.

રતનમાળ તથા પોળોની મારી નોંધ ઉત્તરે તેના  
વિસ્તારમાં વધારો સૂચવે છે. રતનમાળ નર્મદાથી ૭૫  
કિ.મી. ઉત્તરે જ્યારે પોળો નર્મદાથી ૧૪૫ કિ.મી. ઉત્તરે  
આવેલું છે.

અર્પિત દેવમુરારી  
'અવનિ', ૧/૮, આનંદ કોલોની, વિકાસગૃહ, જામનગર-૩૬૧૦૦૮

### કચ્છના મોટા રણમાં મળતાવડી

#### ટિટોડીની મોટી સંખ્યા

કચ્છના મોટા રણમાં સૌ પ્રથમ ૧૭મી નવે.  
૨૦૦૮ના રોજ મેં મળતાવડી ટિટોડી (Sociable  
Lapwing) જોઈ હતી, જ્યારે તે ત૦ની સંખ્યામાં હતી.  
પડતર જેતર હતું અને નજીકમાં કાર-આચ્છાદિત  
વિસ્તાર હતો. લાણો અથવા લુડા (*Cressa cretica*)  
મોટા પ્રમાણમાં હતો. પક્ષીઓ બયમુક્ત લાગતાં હતાં  
અને કામ કરતા મજૂરોની ખૂબ નજીક રહીને ફરતાં  
હતાં.

## નિરીક્ષણ નોંધ

૧૬ ડિસે. ૦૮ના રોજ અમે કુલ ૬૦ પક્ષીઓ એક સાથે જોયા જેમાંનાં ૫૭ એક વિસ્તારમાં હતાં, જ્યારે તું પક્ષીઓ છારી હંદમાં હતાં. આ પક્ષીઓ ૧૫મી ફેબ્રુઆરી ૧૦ સુધી રોકાયા હતાં.

લુણના પ્રાધાન્યવાળા ઘાસિયા મેદાનમાં આ પક્ષીઓ ચરતાં હતાં. રાતવાસો જમીન ઉપર જ કરતાં. તેઓ લુણો (*Suaeda fruticosa*) અને ગાંડો બાવળ થોડા પ્રમાણમાં હોય તેવા વિસ્તારમાં પણ ફરી આવતાં. સૂર્યાસ્ત પહેલાં તેઓ ખોરાક લેવામાં ખૂબ જ વ્યસ્ત રહેતાં અને ઉપર્યુક્ત વનસ્પતિમાં મળી આવતાં જીવડાં આરોગતાં.

જુગલકિશોર તિવારી

CEDO, મોટી વિરાણી, તા. નખત્રાણા, કરણ



## સૈયદપર રખાલની મુલાકાત

તા. ૨૨-૮-૧૦ના રોજ શ્રી શાંતિલાલ વડુ અને શ્રી નવીનભાઈ બાપ્ત સાથે કચ્છમાં કુકમા અને રતનાલ કચ્છમાં બટેર અને તેતર કચાં કચાં છે ?

કચ્છમાં બટેરની કુલ સાત જાતિ તથા તેતરની કુલ બે જાતિ જોવા મળે છે.

બટેર અથવા લાવરી :

૧. મોટી બટેર (Common Quail); ઝતુ પ્રવાસી (passage migrant)
૨. વર્ષા લાવરી (Rain Quail); પ્રજનનાર્થી ચોમાસુ મુલાકાતી (monsoon breeding visitor)
૩. વગડાઉ ભડકિયું (Rock Bush Quail); અસામાન્ય સ્થાનિક
૪. વનભડકિયું (Jungle Bush Quail); અસામાન્ય સ્થાનિક
૫. રાખોરી પગ બિલબટેર (Common Buttonquail)
૬. ધોળા પગ બિલબટેર (Small Buttonquail);

વર્ષે આવેલ સૈયદપર રખાલની મુલાકાત લીધી. અહીંનું મુખ્ય આકર્ષણી ત્રણ કાબેરા રાજાલાલ (White-bellied Minivet) હતા, જેમાં એક નર અને બે માદા હતા. અહીં ઝતુના પ્રથમ વાર જોયેલા યાયાવર પક્ષીઓમાં દિવાળી માખીમાર (Spotted Flycatcher) -૧, કાંટ હુત્કી (Booted Warbler) -૨ અને રેતિયો લટોરો (Rufous-tailed Shrike)-૧ હતા. આ ઉપરોંત અન્ય પક્ષીઓમાં નાનો રાજાલાલ (Small Minivet) -૨ નર અને ૧ માદા, સોનેરી શોબિંગી (Marshall's Iora) - ૧ નર અને ૨ માદા, વન કશ્યો (Common Woodshrike) -૧, પાન ફડકસુંકી (Plain Prinia) -૨, નાની ફડકસુંકી (Franklin's Prinia) -૨, વૈધાં (Rosy Starling) -૨૦૦ +, લક્કડખોદ (Yellow-fronted Pied Woodpecker) -૧, રાજુ (Yellow-throated Sparrow) -૫, લોટણ હોલો (Red Collared-Dove) -૫, આગિયો ચંદૂલ (Red-winged Bush-Lark) -૪ અને કાળી કંકણસાર (Black Ibis) -૩ જોયા.

અસામાન્ય સ્થાનિક

૭. પીળાપગ બિલબટેર (Yellow-legged Buttonquail)
- તેતર :

૧. કાળો તેતર (Black Francolin); સામાન્ય સ્થાનિક

૨. તેતર (Grey Francolin); સામાન્ય સ્થાનિક  
કચ્છમાં ત્રણો તેતર (Painted francolin) જોવા મળતો નથી. એ રસપ્રદ છે કે, નાના રણની સામેની બાજુએ સુરેન્દ્રનગર વિસ્તારમાં તે જોવા મળે છે. પર્યાવરણીય વિયોજન (ecological isolation)નું આ સુંદર ઉદાહરણ છે. રણના અઝીટ ખારા પટને લીધે કદાચ તેતરની આ જાતિ કચ્છમાં પ્રેરણી નહીં હોય.

જુગલકિશોર તિવારી



## જામનગરમાં જળહળનું આગમન

તા. ૧૨-૭-૧૦ના રોજ સ્વદીપસિંહ જાડેજા સાથે જામનગર શહેર નજીક આવેલા ઢીચડા જળપાવિત વિસ્તારની મુલાકાત લીધી. ત્યાં દૂર વાબગલી (Tern) જેવા એક મોટા પક્ષીને પાણીમાંથી ખોરાક શોધતું જોયું. તેને નજીક આવતા જોઈને જ્યાલ આખ્યો કે તે જળહળ (Indian Skimmer) હતું. એસ. પી. જાડેજાએ તેની સુંદર તસવીરો લીધી. તા. ૩૧-૭-૧૦ના રોજ અસ્થિનભાઈ ત્રિવેદી અને સ્વદીપસિંહ જાડેજા સાથે જામનગરના વિભાપર ગામ નજીક આવેલા ‘સેન્ચ્યુરી સોલ્ફ’ વિસ્તારની મુલાકાત લીધી. અહીં કાશ્મીરી વાબગલી (Whiskered Tern) અને ડેંચીપૂછ વાબગલી (River Tern)ના ટોળાની સાથે બેઠેલા કુલ પદ જળહળ નોંધ્યા. જુલાઈ મહિનામાં આ પક્ષીને આટવી સારી સંખ્યામાં જોઈને આશર્ચ થયું. તા. ૧૮-૮-૧૦ના રોજ આ જ જળથાએ કુલ ૬૬ જળહળ નોંધ્યા.

## નાના તારોડિયાના માળામાં ચકલી

જામનગરના રણજિતસાગર બંધ પાસેના નારણપર ગામના પુલ નીચે નાના તારોડિયા (Streaked-throated Swallow) નિયમિત માળા કરે છે. તા. ૮-૫-૧૦ના રોજ કમલભાઈ ભહ સાથે આ વિસ્તારની મુલાકાત લીધી. અહીં પાણી સુકાઈ ગયું હતું તેમજ નાના તારોડિયા પણ નજરે ચડતા ન હતા. તેથી અમે પુલની નીચે જઈને તેમના જૂના માળાઓનું નિરીક્ષણ કર્યું. માળાની સંખ્યા ૬૦૦ની આસપાસ હતી. તેમાંથી બે-ત્રણ માળામાં ચકલીઓ (House Sparrow)ની અવરજવર જોવા મળી. શું ચકલીઓએ તેમાં પોતાના માળા બનાવ્યા હો? (‘વિહંગ’ વર્ષ, ૨૦૦૦ અંકમાં પા. ૧૩ ઉપર ડૉ. રાધવજી બલરની નાના તારોડિયાના જૂના માળામાં ચકલી તથા કાબરની અવરજવર વિષે - તસવીર સાથેની નોંધ આપેલી છે. - સં.) તા. ૧૮-૭-૧૦ના રોજ અસ્થિનભાઈ ત્રિવેદી અને સ્વદીપસિંહ જાડેજા સાથે ફરીથી આ વિસ્તારની મુલાકાત


## જળહળ

(Indian Skimmer)

દેખાવે વાબગલી



(Tern) જેણું પણ કદમ્બાં મોટું અને પાંખો વધારે લાંબી અને સાંકડી; ઉપરનું શરીર અને માથું કાળું બદામી; ગળું, છાતી અને પેટાળ સહેદ, પગ લાલ; ચાંચ મહદાંશે લાલ પણ છેડો પીળાશ પડતો કેસરી; નીચેનું જડબું લાંબું અને છેદેથી બુઝું, ઉપરનું જડબું ટૂંકું. તેની ખુલ્લી ચાંચનો દેખાવ કાતર જેવો હોવાથી તેને ‘Scissorbill’ પણ કહે છે.



કૃત: શે. પ્રે.

મુખ્યત્વે મોટી નદીઓ એ તેનું રહેઠાણ. ક્યારોક મોટાં જળાશયો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળે. નાની માઇલીઓ તેનો મુખ્ય ખોરાક.

ભારતીય ઉપભાગમાં ભારત, પાકિસ્તાન અને મ્યાનમારમાં તેનો વ્યાપ છે. ભારતમાં ખાસ કરીને ઉત્તરપૂર્વ અને મધ્ય ભારતની મોટી નદીઓના વિસ્તારોમાં પ્રજનન કરે છે. આ સિવાયના વિસ્તારોમાં રખડુ પ્રવાસી તરીકે નોંધાયેલું છે.

તેની ખોરાક પકડવાની અદ્ભુત રીતના કારણે જ તેને જળહળ કહ્યું છે. પાંખો ખોલી પાણીની સપાટીની સાવ નજીક રહીને ઊડતું જાય તથા ચાંચનું નીચેનું જડબું થોડું પાણીમાં ડુબાડી રાખે. આમ પાણીને હળવું ચાંચ વડે ખેડતું હોય તેમ લાગે. ક્યારોક ચાંદની રાતમાં પણ શિકાર કરે.

## નિરીક્ષણ નોંધ

દરમ્યાન નોંધ્યું કે, સારા વરસાના કારણે પુલ નીચેથી પાછી વધુ પ્રમાણમાં વહેતું હતું તેમજ નાના તારોડિયા પણ મોટી સંખ્યામાં હાજર હતાં અને ચાંચમાં માટી લઈ વારંવાર પુલ નીચે જતાં હતાં.

### મેટા કિકમાં ભગતડાની

#### નોંધપાત્ર સંખ્યા

તા. ૧૬-૫-૧૦ના રોજ કપિલસિંહ ઝાલા સાથે હર્ષદ માતાજીના મંદિર પાસે આવેલ મેટા કિક વિસ્તારમાં પક્ષીનિરીક્ષણ કર્યું. અહીં આખા વિસ્તારમાં જ્યાં પણ દૂરબીન માંચીએ ત્યાં ભગતડાં (Common Coot)નાં ટોળાં નજરે ચડતાં હતાં. તેમની કુલ સંખ્યા ૨૫૦૦૦ કરતાં પણ વધારે હશે તેમ લાગ્યું. આ ઉપરાંત જોયેલા અન્ય પક્ષીઓની સંખ્યા પણ નોંધપાત્ર હતી. જેમાં મોટાં હંજ (Greater Flamingo)

૨૦૦૦+, નાના કાજિયા (Little Cormorant) ૧૦૦૦+, મોટા કાજિયા (Great Cormorant) ૫૦૦+, પીળીચાંચ ઢોંક (Painted Stork) ૫૦૦+, ચમચા (Eurasian Spoonbill) ૨૦૦+, નાની દૂબકી (Little Grebe) ૨૦૦+ અને ગિરજા (Cotton Teal) ૧૮નો સમાવેશ થાય છે.

ડૉ. મૌલિક વડુ,

દ્રિક્ષયોલોજ વિભાગ, શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગર



## કચ્છમાં ઘોરડ-ખડમોરનું નિરીક્ષણ

મિત્ર અનવર તુર્ક, મુંદ્રાના આમંત્રાણથી અક્ષય દેસાઈ, છિમાંશુ નાયક અને મિતુલ દેસાઈ સાથે મેં કચ્છનો પ્રવાસ કર્યો. ખાસ ખડમોર અને ઘોરડના દર્શનના લક્ષ્ય સાથે અમે ૮-૭-૧૦ના રોજ નિવિયા પહોંચ્યા. ત્યાં પહોંચતાં બપોર થઈ ગઈ હતી.

## કિલેશ્વર પાસે વિવિધ માખીમારો (Flycatchers)નું પ્રજનન

તા. ૧૦-૭-૧૦ના રોજ બરડા અભયારણમાં કિલેશ્વર મંદિરની આસપાસના વિસ્તારમાં પક્ષીનિરીક્ષણ કર્યું. મારી સાથે અચિનભાઈ ત્રિવેદી, સ્વર્ણપસિંહ જાડેજા, કમાંડર સુભાષ દાસ અને વત્સલ ત્રિવેદી જોડાયા હતા. અહીં નોંધેલ વિવિધ માખીમારોના પ્રજનનની માહિતી નીચે મુજબ છે.

માખીમારનું નામ	નોંધેલ પુખું	ઝાડનો પ્રકાર	માળાની ઉંચાઈ નોંધેલ પ્રવૃત્તિ
નીલપંખો (Black-naped Monarch-Flycatcher)	૧ નર, ૧ માદા	જાંબુ	૧૦ ફૂટ નર અને માદા દ્વારા બચ્ચાંને ખવડાવવાની (કુલ ૩ બચ્ચાં)
નાચણી (White-browed Fantail-Flycatcher)	૧	નીલળિરિ	૫ ફૂટ દ્વારા સેવવાની
દૂધરાજ (Asian Paradise-Flycatcher) (માળો ૧)	૧ નર, ૧ માદા	વણઓળખાયેલ	૭ ફૂટ નર અને માદા દ્વારા બચ્ચાંને ખવડાવવાની (કુલ ૨ બચ્ચાં)
દૂધરાજ (Asian Paradise-Flycatcher) (માળો ૨)	૧ નર	જાંબુ	૭ ફૂટ માળો બનાવવાની

ડૉ. મૌલિક વડુ, જામનગર



અનવરભાઈના ત્યાંના લોકો સાથેના સારા સંપર્ક થકી ઘોરડ અભયારણ્યમાં ગયા. શરૂઆતમાં જ કાંટાળી ઝડી પર એક દૂધિયો લટોરો (Southern Grey Shrike) તેનાં ત્રણ બચ્ચાને થોડી થોડી વારે ચાંચમાં ખોરાક લાવી ખવડાવતો જોયો. અભયારણ્યની લગભગ દરેક વાડ પર કાળા તેતર (Black Partridge) પ્રજનન છતુનો લલકાર કરી રહ્યા હતાં. આ કારણે તેમને ખૂબ જ નજીકથી જોઈ શકતાં હતાં. લાંબી શોધખોળને અંતે આશરે ૪-૦૦ વાગ્યે એવું નક્કી થયું કે હવે આવતી કાલે ઘોરડ માટે આવીશું, પરંતુ એક છેલ્લો આંટો મારી લઈએ. દરમિયાન દૂર ઘોરડ (Great Indian Bustard) જોવા મળ્યું તેથી અમે તેની નજીક પહોંચ્યા. ત્યાં એક સાથે બે નર ઘોરડ જોયા. બંને ઘોરડ તેની પ્રજનન છતુની લાક્ષણિક મુદ્રામાં (breeding display) હતાં. આ ક્ષણ જોવાનો અદ્ભુત લહાવો અમને સાંપર્કચો. બંને નર બિલકુલ નીડર બની અમારાથી ૫૦-૬૦ મીટરનાં અંતરે અમારા વાહનની આજુબાજુ ફરી રહ્યા હતાં. લગભગ ૧૫-૨૦ મિનિટ સુધી તેમની આ પ્રવૃત્તિ નિહાળી અમે ત્યાંથી નીકળી આવ્યાં.

બીજે દિવસે અમે ખડમોર (Lesser Florican) જોવાના લક્ષ્ય સાથે વહેલી સવારે નવિયા ઘાસનાં વીડમાં ગયા. શરૂઆતના અડધા કલાક પછી લગભગ

૨૦૦ મીટર દૂર એક નર ખડમોર ફૂદકા મારતું દેખાયું. તેની નજીક જતાં ખૂબ જ શાંતિથી જોવા મળ્યું. ત્યાં જ નજીકમાં બીજો એક ખડમોર પણ ખૂબ જ નજીકથી જોવા મળ્યો. ઘાસ નીંયું હોવાથી નરી આંખે પણ આંયું પક્ષી જોવા મળતું હતું.

મહમદહસન ઉસ્માનભાઈ જત  
અ, આનંદ કોલોની, પોલ્ટ્રી ફાર્મ રોડ, ફર્સ્ટ ગેર્ડિં, અતુલ-૩૮૬૦૨૦



## ડાંગમાં પક્ષીનિરીક્ષણ

તા. ૧૩-૧૦-૦૮૮ રોજ ડાંગમાં પૂર્ણ અભયારણ્યમાં પક્ષીનિરીક્ષણ કર્યું. જંગલ ખાતાની 'કેમ્પ સાઈટ'ની આજુબાજુ સારાં પક્ષી જોવા મળ્યાં.

સોનેરી લક્કડખોડ (Lesser Golden-backed Woodpecker)-૧૪, ટપકીલો લક્કડખોડ (Heart-spotted Woodpecker)-૧, ઝીણકો લક્કડખોડ (Brown-capped Pigmy Woodpecker)-૨, નાનો લક્કડખોડ (Yellow-fronted Pied Woodpecker)-૧, બીમારજ (Greater Racket-tailed Drongo)-૧૧, સફેદપેટો કોશી (White-bellied Drongo)-૨, સોનેરી પીળક (Eurasian Golden Oriole)-૨, શયામશિર પીળક (Black-headed Oriole)-૫, અધરંગ (Tickell's Blue-Flycatcher)-૧૦+, નીલાપંખો (Black-naped Monarch-Flycatcher)-૧૦+, દૂધરાજ (Asian Paradise -Flycatcher)-૪, મધ્યિયો બાજ (Oriental Honey Buzzard)-૨, ચોટલિયો સાપમાર (Crested Serpent-Eagle)-૨, શામા (White-rumped Shama)-૨, ચેતનયના (Oriental White-eye) -૧૫+.

જંગલખાતાની 'કેમ્પ સાઈટ' પાછળ નાની નરી જેવા ઝરણમાં કાબરા ટપુશિયા (White-rumped Munia)ને નહાતા જોવાની મજા પડી ગઈ. દર વખતે આ જગ્યાએ કાબરુ ટપુશિયું જોવા મળે જ છે.

આગળ જતાં વન દિવાળીઘોડો (Forest

## નિરીક્ષણ નોંધ

Wagtail) જોવા મળતાં ખૂબ આનंદ થયો. અગાઉ એક જ વખત વાસંદા નેશનલ પાર્કમાં જોવેલો. ૧૫થી ૨૦ મિનિટ સુધી એક જ જગ્યાએ બેસી રહ્યો. છાતી પર બે લીટી અને પૂછડીને આડી હલાવવાની ખાસિયત એ તેની ઓળખ છે. ડાંગમાં ભાડ્યે જ જોવા મળે છે.

તા. ૧૪-૩-૧૦ના રોજ વાસંદા નેશનલ પાર્કની મુલાકૃત લીધી. ઝાંપાથી છેક સાદહરેવી ચાલતા પક્ષીનિરીક્ષણ કર્યું. વૃક્ષો પણ્ણવિહીન હોવાથી દૂર સુધી નજર નાખી શકતી હતી. મહુડાના ફૂલની સુગંધ મનને તરબતર કરતી હતી. ભીમરાજ અને સોનેરી લક્કડખોદ સૌથી વધુ સામાન્ય જગ્યાયા. તે સિવાય નીચેનાં પક્ષીઓ જોવા મળ્યા.

**ક્રીટિઘર લક્કડખોદ (Roufous Woodpecker)-૨,** ઝીણકો લક્કડખોદ ૨, મોટો લક્કડખોદ (Great Black Woodpecker)-૧, સુહાગણ (Malabar Trogon) નર માદા, નીલમ હોલી (Emerald Dove)-૧, વન કશ્યો (Common Woodshrike)-૬, અધરંગ-૨, દૂધરાજ-૬, મધ્યિયો બાજ-૧, ચોટલિયો સાપમાર-૧૧.

સાપમારને આટલી સંખ્યામાં ઊડતા, ચકરાવા લેતા પ્રથમ વાર જોયા. કાબરુ ટ્પુશિયું મેં ડાંગમાં ઘણી વાર જોયું છે, પણ ‘વાંસદા નેશનલ પાર્ક’માં પ્રથમ વાર ૪થી ૫ જોયાં. વાંકીયાંચ લેલું (Indian Scimitar-Babbler), સીટીમાર લલેડી (Quacker Tit-Babbler) અને ટપકીલી લલેડી (Spotted Babbler)ના અવાજ ચારે બાજુથી આવતા હતી.

મુકેશ ભણ,  
સ્વયંસેવક, ‘નેચર કલબ, સુરત’

## બુલબુલ કુટુંબ-ઉછેર

બુલબુલે કટાઈ પણીની અંકુરિત મધુમાલતીની માળા માટે પસંદ કરી. જગ્યા એવી હતી કે માળો ઉપરથી સાવ ઢંકાઈ જાય. તા. ૩-૦૭-૧૦ના રોજ માળો બનાવવાનું શરૂ કર્યું ને તા. ૫-૦૭ એ તો ઈંડાં સેવવા લાગ્યું. માદા માળો બનાવતી હોય ત્યારે નર ઊંચે બેસી

“ઓલ રેલ” બોલી આસપાસમાં નજર રાખી ચોડીદારી કરે. બુલબુલ માણસોના સહવાસમાં માળો બનાવવાનું પસંદ કરે છે. કદાચ તેને અન્ય શિકારીઓથી આડકતરું રક્ષણ મળતું હશે. અમુક મર્યાદાથી વધુ નજીક જો માળા પાસે જવાઈ જાય તો તમારી તરફ તાકી અને ઊંઠે તથા ચેતવણીના ઊંચા સૂરે સાદ પોકારે. તેની દમદાર સંગીતમય સુરાવલી વહેલી સવારે પ.૪૫ વાગ્યે અચૂક ઊંઘ ઊડાડે. કયારેક ઊંઘ ઓછી થઈ હોય ત્યારે બારી બંધ કરવી પડે.

આ વખતે ધરખમ ચોમાસાના ગમે તેવા વરસાદ-તોફનમાં પણ માળાને વળગી રહી, ઈંડાંને રક્ષણ આપી બચાવ્યાં. તા. ૨૦-૦૭ આસપાસ બુલબુલને ચાંચમાં જીણી જીવાત લઈ માળામાં જતાં જોયું. નર-માદા બન્નેએ બચ્યાંને જોરશોરથી ફૂદાં-ઈયળ ખવડાવવાનું ચાલુ કર્યું. માદા જ્યારે આવે ત્યારે ખવડાવી બચ્યાં ઉપર રક્ષણ માટે બેસી જાય અને થોડી મિનિટો બાદ નર રોકેટની જેમ ઊતરે તેની સેકડ પહેલા જગ્યા ખાલી કરી આપે. નર ખવડાવીને નજીકની બારીએ થોડી વાર બેસીને ઊડી જાય. આમ બન્નેનો જબરદસ્ત તાલમેલ. કેળાં-સફરજનના કટકા ‘કુમ્માઉંડ વોલ’ પર મૂકીએ અને તરત જ બુલબુલની ચકોર નજરે ચડી જાય. તે પોતે આરોગે અને બચ્યાંને પણ ખવડાવવાનું શરૂ કરી દે. અડકીને ઊભેલા શેતુરનો ઈજારો તો તેમનો જ. કોયલ આવે કે તરત જ ઢેકારો કરી ભગાડી દે.

એકધારા વરસાદમાં પણ માળા પર બેસી બુલબુલે બચ્યાં સાચવ્યાં. બે બચ્યાં મોટાં થઈ માળામાં ડોકાવા લાગ્યાં. એક દિવસ અફલિત ઈંડું પણ નીચે હડકેલી દીંધું. જ્યારે મોટાં થયેલ બચ્યાં માળા બહાર નીકળી આસપાસની ડાળીએ બેસવા લાગ્યાં ત્યારે બુલબુલ વધુ ચેતવણી આપવા લાગ્યાં. પછી અચાનક બધાં ગુમ થઈ ગયા. શું થયું હશે? ચિંતા થઈ. પરંતુ થોડા દિવસો બાદ શેતુરમાં મૃદુ સ્વરો સંભળાતા જોયું તો બન્ને બચ્યાંને નજીક બેસી પાંખો ફષ્ફડાવી, લાલ ચાંચ ખોલી ખોરાક માંગતા જોઈ હાશકારો થયો. મા-બાપ તાજા

શેતૂર તોડી મોગમાં ભરી ઢેતાં હતાં. બચ્ચાં જગ્યા બદલે પણ શેતૂર છોડે નહીં. પછી તો બચ્ચાં નીડર બની ઊડી ‘કમ્પાઉંડ વૉલ’ પર રામેલ વાસણમાંથી પાણી પણ પીવા લાગ્યાં. મા-બાપ ત્યાં આવીને પણ શેતૂર ખવડાવી જતાં. બાદ દસ્તિએ બચ્ચાં મા-બાપ કરતાં પણ કદાવર લાગે છે. બસ અત્યારે તો આમ બુલબુલના સમગ્ર કુંઠંબનું શેતૂર પર એકહથું રાજ છે.

અશોક મથરુ

એ-૭, આવાપ હેરિટેજ, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧

## કાળા રંગનું સાદું તેતર

૧૯-૮-૧૦ના રોજ સાંજે ૫.૩૦ વાગે હું સુરેન્દ્રનગરની આસપાસના વગડામાં ફરતો હતો. શ્રી ભવાનીસિંહ મોરી તથા દેવકત મોરી મારી સાથે હતા. મારે વર્ષા લાવરી (Rain Quail)ની તસવીર લેવી હતી, એટલે અમારું ધ્યાન લાવરીઓને શોધવામાં ડેન્દ્રિત હતું. એટલામાં મેં કાળા પક્ષીઓની એક જોડીને જાડીમાં જતી જોઈ. ઘેરો રંગ હોવાથી પહેલાં અમે તેને કાળા તેતર (Black Francolin) માની લીધા. તેમની પાછળ અમે એકાદ કલવક ફર્યા હોઈશું જેથી સારો ‘ઝોડો’ મળી શકે.

તસવીરને પુસ્તકોમાંનાં ચિંતો સાથે સરખાવતાં એટલું જાણવા મળ્યું કે તે કાળાં તેતર ન હતાં. તેઓ તેતર (Grey Francolin) જ હતાં પણ અસામાન્ય ઘેરો રંગ ધરાવતાં હતાં. મેં ‘નેટ’ ઉપર વધુ રંગકણો ધરાવતાં તેતરની માહિતી માટે તપાસ કરી તો તેની ખૂબ ઓછી નોંધ મળી. હું માનું છું આવા કાળો રંગ ધરાવતાં (melanotic) તેતર ખૂબ જ અત્ય સંખ્યામાં મળતાં હશે.

આદિત્ય રોય

રબી, હેરિટેજ સોસાયટી, એ.એમ.એ.ની સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-૧૫

## સિંહગણતરી દરમિયાન પક્ષીનિરીક્ષણ

તા. ૨૩-૦૪-૧૦થી ૨૭-૦૪-૧૦ દરમિયાન ૧૫મી સિંહ વસતિ-ગણતરી વખતે મને ધારી તાલુકાના

ખાંભા રેન્જના ઠીંબરવા ગામ ખાતે સ્વયંસેવક તરીકે જવાબદારી મળેલી. ઠીંબરવામાં જંગલખાતાનાં કવાઈર્સ પાસેના વડ પરથી તા. ૨૪ એપ્રિલના રોજ વહેલી સવારે પક્ષીઓના અવાજ શરૂ થઈ ગયા. તરત જ દૂરભીન માંડચું. દૂર્ધરાજ (Asian Paradise-Flycatcher)ની જોડી, રાખોડી રામચકલી (Great Tit), નાના રાખલાલ (Small Minivet)નાં ૨ નર તથા ૩ માદા, ખેરખુંદો (Indian Treepie), ૩ નાચણ (White-browed Fantail-Flycatcher), દરજા (Common Tailorbird) તથા અધરંગ (Tickell's Blue-Flycatcher)ની ચહેલપહુલ નજરે ચઢી.

રાવજી નદીની પાછળ થઈને આ કુંગરાળ જંગલમાં બપોરે ૨ વાગ્યાથી સિંહગણતરીમાં નીકળ્યા

## ‘વિહંગ’માં જાહેરખબર

પ્રકૃતિ અને પક્ષી સંરક્ષણ અંગેનું સામયિક ‘વિહંગ’, છેલ્લાં દસેક વર્ષથી પ્રસિદ્ધ થાય છે અને તેણે ખૂબ જ લોકચાહના પ્રાપ્ત કરી છે. ગુજરાતના ખૂબો ખૂબો વસ્તા પક્ષીનિરીક્ષકો વચ્ચેના સેતુ તરીકે તે એક ઉમદા અને ઉપયોગી કામગીરી બજાવી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણની ભારતીય પરંપરા અને મૂલ્યોના જતનની સાથે તે દિશામાં કાર્યાન્વિત વૈજ્ઞાનિક અભિગમનું સન્માન કરતા આ સામયિકમાં જાહેરખબર મોકલી એક સમાજોપયોગી, સુંદર કાર્યમાં આપ પણ સહભાગી થઈ શકો છો. જાહેરખબરમાં જાહેરતની સાથે સાથે પ્રકૃતિસંરક્ષણ અંગેના કોઈ સંદેશને ઉપસાવી શકીએ તેવો અમારો પ્રયત્ન રહેશે.

‘વિહંગ’માં જાહેરખબરના દર નીચે પ્રમાણે છે:

આખું પાનું	(4 colour)	રૂ. ૫,૦૦૦/-
આખું પાનું	(B/W)	રૂ. ૨,૦૦૦/-
અડધું પાનું	(B/W)	રૂ. ૧,૦૦૦/-
બીજું/ત્રીજું મુખપૃષ્ઠ	(4 colour)	રૂ. ૬,૦૦૦/-
પાછળનું મુખપૃષ્ઠ	(4 colour)	રૂ. ૭,૫૦૦/-

## નિરીક્ષણ નોંધ

ત્યારે સૂક્ષ્મ જંગલ અને સખત ગરમીમાં ફક્ત ટૈયડ (Oriental Magpie-Robin), નાચણ તથા અમુક જર્વાએ તેતર (Grey Francolin) નજરે ચઢતાં હતાં. રાત્રે ર વાગ્યે રાજસ્થાનીના કુંગરિયા વિસ્તારથી ઠીંબરવા પાછા ફરતા ચાર દશરથિયા (Nightjar) ‘જીપ્સી’ની લાઈટ સામેથી ઊડીને રસ્તાની બાજુમાં બેસી ગયા. રસ્તામાં ઊભેલા ચકવા (Stone-Curlew) જીપ્સી નજીક પહોંચતા ઊડી જતા હતા.

## જમનગરના કાંઠાવિસ્તારમાં

### પક્ષીનિરીક્ષણ

તા. ૨૫ જુલાઈ ’૧૦ના સવારે ૯ વાગ્યે જમનગર નજીકના વાલસુરાથી બેડી પોર્ટ – ઢીચડાવાળા રસ્તે એક અચરજ ભરી વસ્તુ બની. નાના હંજ (Lesser Flamingo)ને હું દૂરબીનથી જોતો હતો ત્યાં દરિયાના કાદવિયા પટમાં એક કબૂતર ઊતર્યું અને કાદવમાં ફંઝોસીને કંઈક ખોરાક ગોતતું નજરે ચઢ્યું. દરિયાના પટમાં કબૂતર ઊતરે એ તો પ્રથમ વાર જોયું!

ત્યાંથી ઢીચડા તરફ રવાના થયો. ત્યાં ડાબી તરફના ઘાસિયા તથા કાદવિયા વિસ્તારમાં રસ્તાથી ૨૦ ડગલાં દૂર પાનલવા (Greater Painted-snipe)ની બે જોડી વચ્ચે વિસ્તારના આધિપત્ય (territorial claims) માટેનો જઘડો જોયો. તેમાં માદા વધારે કિયાશીલ હતી. અંતે એક જોડી દૂર ચાલી ગઈ. હવે મારી નજીકની જોડીએ બાજુમાં આવેલા ગજપાઉં (Black Stilt)ના માળા નજીક જવાનું શરૂ કર્યું, એટલે ગજપાઉંની જોડીએ ઉગ અવાજ કરી વિરોધ નોંધાયો. પણ પાનલવાની માદાએ નજીક જઈ બેઠક જમાવી. આ દરમિયાન ગજપાઉં તથા પાનલવાની માદા વચ્ચે ચાંચ્ય તથા પાંખો વડે એકામિક હુમલા થયા. પાનલવાની માદા પાંખો પહોળી રાખી હુમલા માટે તૈયાર રહેતી. પાનલવાનો નર આ જઘડાથી ત્રણ ફૂટ દૂર ઊભો ઊભો ફક્ત નિહાળતો હતો; પાનલવાની માદા જ ગજપાઉંની જોડી સામે ટક્કર લેતી હતી. કદાચ આ વિસ્તારમાં

પાનલવાનો માળો હોય અથવા માળો બનાવવાની પેરવી હોઈ શકે. રસ્તાની બીજી તરફના પાણીના ઝરમાં સામાં કાંઠે નાની દૂબકી (Little Grebe)નો માળો હતો.

### ખીજડિયા પાસે પક્ષીનિરીક્ષણ

તા. ૧૩ ઓગસ્ટ ’૧૦ના સવારે મારી સાથે શ્રી કમલ ભંજ ખીજડિયા પાસેના વિભાપર ગામ પણીના જાળવાચિત ક્ષેત્ર તરફ પક્ષીનિરીક્ષણ માટે જોડાયા. ૧૦ દિવસ પહેલા ડો. મૌલિક વડુએ આ વિસ્તારમાં જળહળ (Indian Skimmer)ના આગમનની મને જાણ કરેલી એટલે મુખ્ય આકર્ષણ તેનું જ હતું. વિભાપર ગામથી આગળના વગડા પાસે મરેલા ઢોરના મડદા પર કાગડા સાથે ધોળી કંકણસાર (Oriental White Ibis)ને પણ માંસ ખાતી જોઈ. (ધોળી કંકણસાર મૃતદેહમાંથી જીવત વીજીને ખાતી હોય તે શક્યતા વધુ છે. - સં.)

આગળ જતાં જાળવાચિત વિસ્તારના જમીનના પટ ઉપર ૪૦ જેટલી કેંચીપૂછી વાબગલી (River Tern) આરામ કરતી દેખાઈ. વધુ આગળ જતાં બાવળના ઝડપ પર કાળીઠોક ઢોક (Black-necked Stork)ની જોડી જોઈ આનંદ થયો. ડાબી બાજુના પાણી વચ્ચેના ચિયામાં મોટી ચોटીલી દૂબકી (Great Crested Grebe) માળો બનાવતી હતી; અડધો માળો બની ગયેલો જોયો. નજીકમાં ભગતડાનો પણ માળો હતો. જમણી બાજુના દરિયા તરફના પટના છીછરા પાણીમાં નજર કરતા અમારાથી ૧૦૦ મીટર દૂર ૪૬ જળહળ, ૮૫ ધોળી વાબગલીઓ (Gull-billed Tern) દણિગોચર થતાં ખૂબ રોમાંચ થયો. જળહળ છીછરા પાણીમાં ઊભા હતા. અડધી ધોળી વાબગલીઓ જમીન પર પીંધાની માવજત કરતી હતી તથા બાકીની આરામથી બેઠેલી નજરે ચઢી. પાંચ વર્ષ અગાઉ જળહળનું ૧૫૦નું જૂથ નિયમિત રીતે ઓગસ્ટ-સારે. માસ દરમિયાન ખીજડિયામાં રોકાનું. લાંબા સુમય પણી આઠલી સંખ્યામાં ફરી જોવા મળતા ખૂબ આનંદ થયો.

શ્રી જ્યાપાલસિંહ જેજા



## દક્ષિણ ગુજરાતમાં કાળી પાનબગલી

### અને કચ્છી પિદો

તા. ૨૭-૦૫-૧૦ના રોજ હાંસોટ તાલુકાના વધવાશથી એક કિ.મી. દૂર ધમરાડ રોડ પર ઘાબાજરિયામાં બેઠેલી કાળી પાનબગલી (Black Bittern) જોઈ. હાંસોટ, અંકલેશ્વર અને કોસંબા વિસ્તારના મારા ચાર વર્ષના પક્ષીનિરીક્ષણ દરમિયાન પ્રથમ વાર કાળી પાનબગલી નજરે પડી.

જુલાઈ '૧૦ મહિનાથી કોસંબા, તા. માંગરોળ, જિ. સુરતના મારા ઘરની આજુબાજુનાં મકાનોની દીવાલ અને ધાબા પર કચ્છી પિદો (Indian Chat) જોવા મળે છે. કુલ ચાર કચ્છી પિદો છે, જે એકલા કે સમૂહમાં દેખાય છે.



મુ. ઉદ્દીપાદરા, પો. હથુરણ, તા. અંકલેશ્વર, જિ. ભરૂચ

### ચાતક: નડિયાદની આસપાસ

થોડા સમય પહેલા, અમે 'સન-બર્ડ નેચર ગ્રૂપ'ના મિત્રો પ્રકૃતિ અને પંખીડાની ચર્ચા કરતા સવારના વિહંગાવલોકનમાં વસ્ત અને મસ્ત હતા. ત્યાં એક મિત્રએ પૂછ્યું, તમને સૌથી વધારે પ્રિય પંખી ક્યું?

નાનકડા મનોમંથન પછી એટલું કહી શક્યો કે, પ્રથમ પંક્તિની મારી યાદીમાં 'ચાતક' તો જરૂર હોય જ. અમે સાત-આઈ મિત્રોમાંથી માત્ર ત્રણ મિત્રોએ જ ચાતક (Pied Crested Cuckoo)ને કુદરતી અવસ્થામાં નિહાળ્યું હતું. બાકીના મિત્રોએ પુસ્તકમાં દર્શનથી અને નામથી ચાતકને પોતીકું બનાવ્યું હતું. આ વાતને લગભગ પાંચ-સાત મિનિટ થઈ હોય ત્યાં મારી નજર આંબાના વિશાળ વૃક્ષની એક આગળ પડતી ડાળી ઉપર સ્થિર થઈ ગઈ. આનંદ સાથે બોલાયું, “લગભગ ચાતક!!” વૃક્ષ ખૂબ દૂર હોવાથી દૂરભીન દ્વારા ઝીણવટપૂર્વક જોતાં સાનંદાશર્ય સાથે તે ચાતક નીકળ્યું. બધા મિત્રોનાં દૂરભીન ચાતકવાળી દિશા તરફ મંડાયાં.

ચાતક  
કદ : ૩૩ સે.મી.



થોડી જ કષણમાં અમારી ખૂબ જ પાસેથી ઊડીને તે ચાતક, નજીકના વૃક્ષની ડાળ ઉપર આવી બેઠું. બધા મન ભરી તેને માણી રહ્યા હતા, ત્યાં બીજા બે ચાતક પણ તેની પાસે આવી બેઠાં. બધા ખૂબ જ આનંદિંદિ થયા. બે-ગ્રાણ મિનિટ પછી વળી પાછું એક ચાતક. એક સાથે ચાર ચાતક જોવાનો આ મારા માટે પણ પહેલો પ્રસંગ હતો. આ સાથે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાનની મારી ચાતકની નોંધ આ મુજબ છે.

૩-૪-૫/૧૨/૦૪ દેવમોગરા (જિ. નર્મદા) ૧, ૨૬/૧૨/૦૪ માલસર (જિ. વડોદરા) ૧, ૧૩/૬/૦૫ પીજ (જિ. જેડા) ૧, ૧૪/૬/૦૫ દુંડેલ (જિ. જેડા) ૧, ૬/૭/૦૬ દુંડેલ (જિ. જેડા) ૧, ૧૮/૭/૦૬ દુંડેલ ૧, ૧૨/૭/૦૭ પીજ ૧, ૨૨/૬/૦૮ દુંડેલ ૧, ૬/૬/૦૮ પીજ ૨, ૧૬/૬/૦૮ દુંડેલ ૧, ૩૧/૭/૦૮ પીજ ૧, ૫/૮/૦૮ પીજ ૨, ૬/૮/૦૮ પીજ ૧, ૨/૮/૦૮ દુંડેલ ૧, ૪/૭/૧૦ નડિયાદ ૧, ૫/૭/૧૦ નડિયાદ ૨, ૮/૭/૧૦ પીજ ૨, ૧૭/૭/૧૦ દુંડેલ ૧, ૧૬/૭/૧૦ પીજ ૧, ૨૨/૭/૧૦ પીજ ૧, ૧/૮/૧૦ પીપલગ ૪, ૨/૮/૧૦ દુંડેલ ૧, ૩/૮/૧૦ દુંડેલ ૧.

ઉપરની યાદી પરથી વિશ્વેષણ કરતાં કહી શકાય કે, નડિયાદથી ૭-૮ કિ.મી.ની વિઝામાં જૂન માસથી સપેમ્બર માસ સુધી ચાતક જોવા મળે છે. ૨૦૦૪ના ડિસેમ્બર માસમાં વડોદરા અને નર્મદા જિલ્લામાં પણ જોવા મળ્યા.

જૂન માસમાં, કુલ ત્રણ વખત; તે ચાતક  
જુલાઈ માસમાં, કુલ દસ વખત; ૧૩ ચાતક

## નિરીક્ષણ નોંધ

ઓગસ્ટ માસમાં, કુલ પાંચ વખત; ૮ ચાતક  
સપેમ્બર માસમાં, કુલ ત્રણ વખત; ૪ ચાતક  
આમ જુલાઈ માસમાં સૌથી વધારે વખત અને  
સૌથી વધું સંખ્યામાં ચાતક જોવા મળ્યાં.

ડૉ. તરુણ જોશી

૮, 'નૂતન', લક્ષ્મણાદેવ પાર્ક કલેક્ટર બંગલો સામે,  
પીજ રોડ, નડિયાદ-૩૮૭૦૦૨



## સંગ્રહખોર કાગડો !

શહેરની વચ્ચોવચ એક કાગડાને ચાંચમાં મોટી  
પૂરી અથવા તો કંઈ ફરસાણ લઈ બેઠેલો જોયો.... પણ  
કાગડાએ એ પૂરી ખાદી નહિ ને એક છાપરાની નીચે  
ક્યાંક સંતારી દીધી. આવા બે-ત્રણ ફેરા કર્યા અને  
અલગ અલગ જગ્યાએ ખાવાનું સંતારતા જોયો.

આજુબાજુમાં રહેતી વ્યક્તિઓને પૂછતાં ખ્યાલ  
આવ્યો કે આ કાગડો અલગ અલગ જગ્યાએ ખોરાક  
સંગ્રહ કરી રાખે છે અને જરૂર પડે ખાય છે !

આટલું જ નહિ, પણ કાગડાઓને મેં કાયમ ખાતાં  
પહેલાં ખોરાકને પલાળતાં જોયા છે. ખોરાક કંદળ હોય  
કે પોચો, એ ખાતાં પહેલાં અચૂક એને પાણીમાં  
પલાળીને જ ખાતા હોય છે. ઉનાળા દરમિયાન  
ઓફિસની અને ઘરની બહાર જે પાણીનાં વાસણો મૂકેલાં  
એમાં હંમેશાં રોટલી, પૂરી, ટેંડા, હડકાં વગેરે મળતું.  
ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો કે કાગડો પાણીમાં નાખીને  
પણી જ બધું ખાય છે.

## કાબરનો માળો

ઘરની 'બાલ્કની'માં 'નેસ્ટ બોક્સ' મૂકેલું છે !

છિચા હતી કે ચકલીનો માળો થાય પણ  
શરૂઆતથી જ કાબર (Common Myna)ની જોડી  
અને પચાવીને બેઠી છે.

બે વર્ષમાં કાબર સતત માળો કરતી જોવા મળે  
છે. આ પક્ષીઘર માટે બે જોડીઓને અંદર અંદર જઘડા  
કરતી પણ જોઈ છે.

એક નવી વસ્તુ જોઈ. કાબર નજીકના ગરમાળાનાં

કુમળાં લીલાં પાંદડાં ચાંચથી તોડીને માળામાં લઈ  
જાય છે. લાગે છે કે, માળો બનાવવાની સામગ્રીમાં  
કદાચ તેનો ઉપયોગ કરતી હોય. ક્યાંક કોઈકે કહેલું  
અથવા તો કોઈ લેખમાં વાંચ્યું હોય એવું યાદ આવે છે.  
(પક્ષીઓ માળો બનાવવામાં (ખાસ કરીને ચોમાસમાં)

લીલાં પાંદડાંનો ઉપયોગ કરતાં હોય છે. તેનાં  
મુજબત્વે બે કારણો છે. એક, લીલાં પાંદડાંથી માળો  
ઢાંકતાં વરસાદનાં પાણીથી રક્ષણ મળે અને બીજું પાંદડાં  
સડવાથી ગરમી ઉત્પન્ન થાય અને વરસાદી ઋતુમાં  
ઠડક થતાં માળાનું તાપમાન જાળવવામાં સરળતા રહે.  
માળામાં વપરાતાં લીલાં પાનથી....

- બેજ જળવાય છે.
- તાપમાન જળવાય છે.
- માળાની ગુંથણીને મજબૂતાઈ મળે છે.
- બચ્ચાને 'ટીક્સ' જેવા પરોપણી કીટકોથી રક્ષણ મળે છે.
- ડૂબકી (grebe) જેવા તરતો માળો ધરાવતાં  
પક્ષીઓમાં ઢાંડાને ઢાંકવા માટે તેનો ઉપયોગ થાય  
છે.
- કદાચ કુમળાં પાનથી માળાની અંદરની સપાઈને  
નરમ આવરણ પણ મળતું હોય છે.
- ડૉ. ભવભૂતિ પારાશર્ય, આણંદ સાથે ઝોન ઉપર  
વાતચીત પરથી – સં.)

શૈવત હાથી

એ-૩, પ્રતિષ્ઠા એપાર્ટમેન્ટ, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫


## કચ્છમાં ખડ કુલ્કી (ઘાસ કુલ્કી)ની

### નોંધ

હું અને મારો ભાઈ શેતલ તા. ૧૯-૮-૧૦ના રોજ  
કચ્છમાં પક્ષીદર્શન તથા 'ફોટોગ્રાફી' માટે સુરેન્દ્રનગરથી  
નીકળ્યા હતા. અમારું લક્ષ્ય હતું કચ્છમાં જોવા મળતાં  
ઘાસિયાં મેદાનોનાં પક્ષીઓ જેવાં કે; ઘોર (Great  
Indian Bustard), ખડમોર (Lesser Florican),  
કાળો તેતર (Black Francolin) તથા અન્ય બટેરો

## ખડ ફુત્કી

(Bristled Grass-Warbler, *Chaetornis striatus*)



દેખાવે ચકલીથી મોટું, રંગ મુખ્યત્વે બદામી, માથાના ઉપરના ભાગ ઉપર, ડોકની પાછળ અને પીઠ પર કાળી રેખાઓ; ગળા અને છાતી પર આઢી, પાતળી રેખાઓ; ચાંચ કાળી, જાડી અને ટૂંકી, આંખ પર અસ્પષ્ટ મેલા ધોળા ભમ્મર; પેટણ આઢું બદામી અને અરેખાંકિત, પુંઝ લાંબી અને છેદેથી થોડી સફેદ. તેની આંખના આગળના ભાગ પર બંને બાજુઓ પાંચ ટૂંકા કાળા વાળ (Bristles) હોય છે, જે ઘાસમાં ઉડતી વખતે તેની આંખોને રક્ષણ આપે છે. નર અને માદા દેખાવે લગભગ સરખા.

મુખ્યત્વે ઘાસિયા વિસ્તારો, ચિયા, ડાંગરનાં ખેતરો અને ક્યારેક કાંટાળા પ્રદેશમાં જોવા મળતું પક્ષી. ઘાસમાં થતી જીવાત એ તેનો મુખ્ય ખોરાક. પ્રજનનઋતુમાં માદાને આકર્ષવા માટે નર ઘાસથી એકથી બે મીટરની ઊંચાઈ પર ગીત ગાતો ગાતો ચડે, પાછો નીચે ઉત્તરે અને આમ ચડઉતીર કર્યા કરે, જેથી પ્રજનન ઋતુમાં તેની હાજરીનો જ્યાલ તરત આવે. અન્ય ઋતુમાં તેની હાજરી પારખવી અધરી..

ભારતીય ઉપખંડમાં અસામાન્ય સ્થાનિક રહેવાસી છે અને ભારત, પાકિસ્તાન તથા નેપાળમાં નોંધાયેલું છે. ભારતમાં હાલમાં ઉત્તર પ્રદેશ, હિન્દુસ્થાન, પંજાਬ, આસામ અને મહારાષ્ટ્રમાં નોંધાયેલું છે. ગુજરાતમાં છેલ્લે ૧૮૭૪માં ડીસા પાસેની નોંધ બાદ અન્ય કોઈ નોંધ થઈ નથી. હાલના અભ્યાસ મુજબ તેના રહેઠાણને થતા નુકસાનના કારણે તેની સંખ્યામાં ભયજનક ઘટાડો થઈ રહ્યો છે.

(quails). આ સિવાય ઋતુપ્રવાસી (passage migrant) પક્ષીઓ ઉપર પણ નજર હતી. આ દરમિયાન જીવા અને અવલોકનની શક્યતાઓ અંગે શ્રી અશોક ચૌધરી સાથે સતત સંપર્કમાં હતા.

તા. ૨૦-૮-૧૦ના રોજ અમે સુરેન્દ્રનગર પાછા જવાની તૈવારીમાં હતા ત્યારે નવિયાના ઘાસિયા વિસ્તારમાં ધાનચીડી (pipit)ના કદનું પણ ફુત્કી (warbler) જેવું એક પક્ષી નજરે ચક્કાં. પહેલાં દૂરથી દૂરબીનથી જોતાં કોઈ પાન કરકરિયા (reed warbler) જેવું લાગ્યું. થોડાક 'રેકર્ડ શોટ્સ' લઈ નજીક ગયા, ત્યારે જોયું કે, તેના જેવી નાની, જાડી અને કાળી ચાંચ કોઈ પાન કરકરિયાને નથી હોતી. પક્ષી થોડી થોડી વારે ઊરીને અવાજ (call) કરતું હતું. તેનો 'કોલ' એકદમ લાક્ષણિક બે સૂર (double note)નો હતો; "ચક ચીક". તે ઊડતાં ઊડતાં સતત ૩-૪ મિનિટ સુધી બોલે અને પછી એક ચોક્કસ જગ્યામાં આવી બેસી જાય. આતું અમે દસ મિનિટ સુધી જોયું. મારા કેમેરામાં વીડિયોની સુવિધા હોવાથી હું તેના બોલવાની વીડિયો પણ લઈ શક્યો. એટલામાં એ પક્ષી ઘાસમાં જતું રહ્યું અને ઘાસમાંથી બે પક્ષીઓ બહાર આવ્યાં. મેં પહેલાં આ પક્ષી જોયું ન હોવાથી પુસ્તકમાં તપાસ કરતાં તે ખડ ફુત્કી હોવાનું માલૂમ પડ્યું.

ખડ ફુત્કી આ વિસ્તારમાં મળે છે કે નહીં તે જાણવા મેં શ્રી જુગલકિશોર તિવારીને ફૈન કર્યો તો તેમણે જણાવ્યું કે, કર્યાંતું તે પહેલા ક્યારેય નોંધાયું નથી. ઇતાં ઘેર પાછા ફર્યા બાદ મેં ફરી મારી તસવીરો જોઈને ખાતરી કરી અને જૂની નોંધના સંદર્ભો મેળવવાનો પ્રયત્ન કર્યો. એવી માહિતી મળી કે પહેલાનાં સમયમાં તે સામાન્ય હતું પણ છેલ્લાં ઘણાં વર્ષોથી જોવા મળ્યું નથી. બી.સી.એસ.જી.ના ગુજરાતનાં પક્ષીઓની યાદીમાં આ પક્ષી ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યાની નોંધ છે.

અમે જે કોલ કરતી ખડ ફુત્કીને જોઈ તે તેનું પ્રજનન નૃત્ય (display) હતું, જે માદાને આકર્ષવા માટે

## નિરીક્ષણ નોંધ

તથા અન્ય પ્રતિદ્વદ્ધી નરને દૂર રાખવા માટેનું હતું. મેં માત્ર ૧૫ મિનિટમાં આવા નાના વિસ્તારમાં ખડ કુટીની પ્રજનન કરતી એક જોડી જોઈ એ ઉપરથી એમ કહી શકાય કે આ આખા વિસ્તારની સરખી તપાસ કરવામાં આવે તો પ્રજનન કરતી ઘણી બધી જોડીઓ જોવા મળી શકે. મારું એવું માનવું છે કે, આ પક્ષી આપણે ત્યાં અસામાન્ય ભલે હોય પણ દુર્લભ તો નથી જ. તે કદાચ આપણા ધ્યાન બહાર રહી ગયું છે. ખડ કુટીની આ પ્રજનનની ઋતુ હોવાથી તે વધુ બોલકણું અને ચંચળ હતું. ભારતમાં કોર્ટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં તથા પંજાબ અને હરિયાશામાં પણ આ પક્ષી જુલાઈથી સપ્ટેમ્બર વધારે જોવા મળતાં હોવાની નોંધ છે.

મેં આ અવલોકનની વાત મારા મિત્ર અર્પિત દેવમુરારિને કરી. તેણે બે દિવસ પછી આ વિસ્તારમાં તેનું સર્વેક્ષણ કરી કુલ સાત પક્ષીઓ જોયાનું જણાવ્યું.

આ સિવાય કચ્છની આ મુલાકાતમાં અમે ૪ ઘોરડ (૨ નર, ૧ માદા, ૧ અપુષ્ટ), ૫ ખડમોર (૪ નર, ૧ માદા), વર્ષા લાવરી (Rain Quail), ઘોળાપગ બિલ બટેર (Small Buttonquail), ભારતીય કાળો ઝુમ્મસ (Indian Spotted Eagle), વીસો (White-eyed Buzzard), કાશીરી ચાસ (European Roller), વૈયાં (Rosy Pastor), કાળો તેતર (બર્ચાં સાથે) વગેરે પક્ષીઓ જોયાં. પક્ષીઓની સલામતી માટે ચોક્કસ સ્થળ જણાવ્યું નથી.

નીરવ ભંડ,

એચ-૫૨, શ.આઈ.ડી.સી. ઓફિસ સામે, વઠવાડા-૩૬ ૩૦૩૧

### અતિ દુર્લભ પક્ષીનું દર્શન

૨૧-૮-૧૦થી ૨૩-૮-૧૦ વચ્ચે હું નલિયા ‘શોયોગ્રાસી’ માટે જતો હતો ત્યારે મારા મિત્ર નીરવ ભંડનો ઝોન આવ્યો. તેણે ખડ કુટી જોઈ હતી. હું ભુજ પહોંચવામાં જ હતો પણ તરત જ નલિયા તરફ વધ્યો. મેં આ પક્ષીના પાંચ નર અને બે માદા જોઈ. ૨૧મીના આ અવલોકન બાદ હું બાકીના બે દિવસ પણ એ વિસ્તારમાં જ ફર્યો જેથી ‘જી.પી.એસ.’ની મદદથી

તેઓની હાજરીની સરહદ આંકી શકું.

ગુજરાતમાં આ પક્ષીજાતિની નોંધ ૧૩૪ વર્ષો પછી થઈ. નામ પ્રમાણે ઘાસિયા વિસ્તારનું પક્ષી છે. ઘોવાણ અને જેતીમાં ઉપયોગમાં લેવાથી હવે ઘાસિયા મેદાનોની અવનતિ થઈ રહી હોવાથી ખડ કુટીની વસ્તી ઘણી ઓછી રહી છે. ‘બર્કલાઈફ ઇન્ટરનેશનલ’ દ્વારા તેને ભયગ્રસ્ત પક્ષીજાતિઓની વાઈમાં ‘ભયગ્રસ્ત’ (vulnerable)ના જીથમાં મૂકવામાં આવી છે. (A1C; A2C; C1)

ઇન્સ્ક્રેપ્ટ (૧૯૯૬) જણાવ્યું છે કે, ભારતીય ઉપયંડમાં તે વ્યાપક હોવા છતાં તેની નોંધ ખૂબ જ ઓછી છે. તેણે મૂળ માહિતી સાથેના માત્ર તર સંદર્ભો આપ્યા છે જેમાં છેલ્લાં ૨૫ વર્ષોમાં તો ખૂબ જ જૂજ છે.

ઇ.સ. ૧૮૭૬ ઓંગસ્ટ-સપ્ટેમ્બર બટલરે ડીસામાં ખડ કુટીના ત નરની નોંધ કરી હતી.

અર્પિત દેવમુરારી

‘અવનિ’, આનંદ કોલોની માર્ગ નં. ૧, ઋષિ એપાર્ટ.-ની સામે, વિકાસગૃહ માર્ગ, જામનગર-૩૬ ૧૦૦૮

### કચ્છમાં બેકાલ કસ્તૂરાની પ્રયમ નોંધ

ગત મહિનાની તારીખ ૨૪-૫-'૧૦ના રોજ અંજાર તાલુકના ગામ બીટા (વલાડિયા)થી મહંતશ્રી આદેશબાપુનો મારા ઉપર ઝોન આવ્યો કે, ચલમાં બે દિવસથી મંદિરના પરિસરમાં એક નવી જાતનું પક્ષી આવ્યું છે, જે કાબરથી સહેજ નાનું છે, તમે આવીને જોઈ જાવ. બીજા દિવસે સવારના હું મારા મિત્ર શ્રી રણજિતસિંહ જાડેજાની સાથે મંદિરે પહોંચ્યો. ત્યાંના મહંતશ્રી આદેશબાપુ એક પ્રકૃતિપ્રેમી વ્યક્તિ છે. તેમણે અમને મંદિરના આંગણામાં બેસી જવા કહ્યું. ત્યાં જ પાંચ મિનિટમાં એક પક્ષી આવીને અમારી સામે જમીન ઉપર ટથી ૧૦ ફૂટના અંતરે બેઢું. જમીન ઉપર ચાંચથી કંઈક ખોદવાની પ્રક્રિયા કરતું તથા જીવાત વગેરે ખાતું જોવા મળ્યું. ગ્રાનચાર મિનિટ પછી ઊરી ગયું અને પાછું એકાંક મિનિટના અંતરે અમારી સામે આવીને બેઢું. આમ સતત બે કલાક જેવું ચાલ્યું. તે દરમિયાન મેં તેની ઘણી

Incredible India



Lets flock together  
to the glory of  
our feathered friends...



Khijadiya Bird Sanctuary with its unique twin ecosystems of Marine and Freshwater habitats, has been an avian paradise that hosts over 300 species of bird from India & Eurasia every winter. Come... See... Appreciate...

We welcome you to be a part of

**Global Bird Watchers' Conference 2010**

and know them at

Destination  
*Khijadiya*

Date: 25th - 27th November, 2010

Venue: Khijadiya Bird Sanctuary,  
Jamnagar, Gujarat - India

We Invite: Avid Bird Watchers & Ornithologists, Tour & Travel Operators, Hospitality Institutes, Students of Zoology and Researchers working on Ph.D.

To participate in a interactive Conference, register online on

[www.gujarattourism.com](http://www.gujarattourism.com) OR [www.gbwc2010.org](http://www.gbwc2010.org)

**Register now before your limited chance flies off...**

**ORGANISERS**



**CO - ORGANISER**



**PRINT MEDIA PARTNERS**



**SUPPORT ORGANISATIONS**



**KNOWLEDGE PARTNERS**





આંગણે બગીયો વિકસાવવો એ સાચું ‘અન્ટિવિઝન’ છે. આપ કોઈપણ વ્યવસાયમાં હોવ, ગમે તેટલા વ્યસ્ત હોવ, જો આપના અસ્તિત્વની આસપાસ લીલોતરી ઊભી કરશો, તો ગમે તેટલો નાનો ઉદ્ઘાન પણ કેટકેલાં કીટકો, સરિસૂપ વર્ગના કેટલાક પ્રતિનિધિઓ તથા અનેક બેપાંખાળાં જીવો માટે અભ્યારણ્ય પૂરવાર થશો. આપનો પ્રકૃતિ પ્રેમ તો નવપદ્ધિત થશે જ, સાથે સાથે કુટુંબના સૌસભ્યોનાં ચિત્તની શાંતિ પણ પાંગરશે. ‘ગાજવા’ કરતાં ઘરના ખૂણે કુંદુસ જીવવામાં પાયાની કર્મશીલતા અભિવ્યક્ત થાય છે, એમ હું દેખપણે માનું છું.

- લવકુમાર ખાચર




## Foliage Unlimited

Landscape Concepts

1003, Shailraj Tower, B/h. Management Enclave,  
Nehrupark, Vastrapur, Ahmedabad-380015.  
Mobile: 09376187060 / 09376112215  
Email: [foliageunlimited@yahoo.co.in](mailto:foliageunlimited@yahoo.co.in)

**શ્રી અજય દેસાઈ લિભિટ**  
 ગુજરાતના સાપ અંગોના પુસ્તકની  
 પાંચમી આવૃત્તિ ટૂંક સમયમાં જ પ્રકાશિત થઈ રહી છે.



આ પુસ્તકની કેટલીક વિશેષતાઓ  
નીચે મુજબ છે....

- ◆ સામાન્ય જન સમજ શકે તેવી સરળ ગુજરાતી ભાષા
- ◆ છેલ્લી માહિતી મુજબ ગુજરાતમાંથી મળી આવેલા ૫૭ સર્પોની માહિતી
- ◆ આ પૈકીના ૫૨ સર્પોની રંગીન તસવીરો ઉપરાંત 'બ્લેક એન્ડ હાઇટ' તસવીરો - મેટાલોસી પેપર ઉપર
- ◆ અનેક રેખાંકનો તથા ચિત્રો
- ◆ અંદાજે ૨૬૦ પાનાં
- ◆ બી.સી.એસ.જી. ના સભ્યોને પડતર કિંમત (તે માટે આગોતરી જાણકારી આવશ્યક રહેશે.)

વધુ સંપર્ક :  
**શ્રી અજય દેસાઈ : ૦૯૪૨૬૪૧૧૧૨૫**  
**ડૉ. બફુલ ત્રિવેદી : ૦૯૮૨૫૬૮૫૮૭**

બધી તસવીર લીધી. પ્રથમ દસ્તિએ મારાથી તેની ઓળખ ન થઈ શકી. ઘેર આવ્યા બાદ પાટેલ ફોટો મારા પિતાજી શ્રી ફકીરમહમદને બતાવ્યા. તેઓએ એ કસ્તુરા (Thrush)ના વર્ગનું હોવાનું પ્રથમ દસ્તિએ જણાવ્યું. તેની ઓળખ કરાવવા માટે મેં શ્રી શાંતિલાલભાઈ વરુને તેનો 'ફોટો' બતાવ્યો. એમાંથી પણ કસ્તૂરો હોવાનું પાડું કર્યું. જેના પછી શ્રી જુગલકિશોર તિવારીએ તેની ઓળખ બૈકાલ કસ્તૂરા (Eyebrowed Thrush) તરીકે કરી બતાવી અને કહ્યું કે સંભવત: ગુજરાતમાં તસવીર સાથે આ સર્વપ્રથમ નોંધ છે.

## કચ્છમાં કાળીઓડ પીળકની

### સર્વ પ્રથમ નોંધ

તારીખ ૧૩-૧૧-૦૮ના રોજ વહેલી સવારના મારી વાડીની અંદર ખાટી અંબલીના ઝાડ ઉપર એક પીળક જોવું. સદ્ગ્રાઘે ત્યારે મારી પાસે કેમરો હોવાથી તરત જ મેં તેની તસવીર લઈ લીધી. તે મને સોનેરી પીળક (Eurasian Golden Oriole) કરતાં જરા જૂદું લાગ્યું એટલે મેં નેટ ઉપર તેની તસવીર મૂકી. તેની ઓળખ શ્રી જુગલકિશોર તિવારીએ કાળીઓડ પીળક તરીકે કરી. કચ્છવિસ્તાર માટે આ પક્ષીની સર્વ પ્રથમ નોંધ છે, તેવું તેમણે જણાવ્યું.

તુર્ક અનવરબેગ

પો. ધ્રબ, તા. મુન્દ્રા, કચ્છ-૩૭૦૪૨૧



## જામનગરમાં કાળીઓડ પીળકની નોંધ

જામનગરમાં કાળીઓડ પીળક (Black-naped Oriole)ની નોંધ સ્ક્રોર્ડન લીડર શ્રી એસ. એસ. મહેશ દ્વારા થઈ. તેઓ વાયુદળમાં નવરચિત 'ઓર્નિથોસેલ પ્રોગ્રામ'ના ડાયરેક્ટર છે. તેઓ તેમની ટીમ સાથે 'બ્લેકકાઈટ સર્વે'ની યોજના અંતર્ગત જામનગર આવેલા.

તેઓએ આ મુલાકાત દરમિયાન તા. ૨૩-૧૧-૦૭ના રોજ સવારે ૭.૩૦ વાગ્યે જામનગર શહેરમાં આવેલી આયુરેંટ યુનિવર્સિટી પાસે કાળીઓડ પીળકની એક જોડી જોઈ, જે જામનગર ખાતે પ્રથમ નોંધ લેતી અને કદાચ ગુજરાત ખાતે પણ! તેમણે કેટલાક દિવસ

## કાળીઓડ પીળક

(Black-naped Oriole, *Oriolus chinensis*)

દેખાવે મોટેલાગે સોનેરી પીળક (Eurasian Golden Oriole) જેવું પરંતુ તેની આંખ પાછળથી ડેકના પાછળના ભાગ સુધી લંબાતો જાડો કાળો પણ્ણો (black nape) એ તેને સોનેરી પીળકથી અલગ પાડે. માદા કરતાં નર વધુ દેખાવડી મુખ્યત્વે વનશાળનું પક્ષી. વૃક્ષોનાં નાનાં ફળો અને જીવાત એ તેનો મુખ્ય ખોરાક.



તે સાઈબીરિયા, ચીન, કોરિયા, વિયેટનામ અને મંચુરિયા જેવા દેશોમાં પ્રજનન કરે છે. ભારતીય ઉપખંડમાં મુખ્યત્વે અસામાન્ય શિયાળુ મુલાકાતી પક્ષી છે અને ભારત, શ્રીલંકા, બાંગલાદેશ તેમજ બર્મામાં નોંધાયેલું છે. તેની અન્ય બે પેટાજાતિઓ આંદામાન અને નિકોબાર દ્વારાઓ પર પ્રજનન કરતી નોંધાયેલી છે. ભારતમાં ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ ભારતમાં તેનો વ્યાપ છે. ગુજરાતમાં કચ્છ અને જામનગરમાં રહ્યું (vagrant) તરીકે નોંધાયેલું છે.

## નિરીક્ષણ નોંધ

સુધી આ પક્ષીનું નિરીક્ષણ કર્યું.

ત્યાર બાદ તેમણે મારા મિત્ર વન્યજીવ તસવીરકાર શ્રી યશોધનભાઈ ભાટ્યાને આ પક્ષીની નોંધ વિશે જાણ કરતાં, તા. ૩૦-૧૧-૦૭ના રોજ શ્રી યશોધનભાઈ સાથે હું અને મારા પક્ષીનિરીક્ષક મિત્ર શ્રી ચિરાગ સોંવંકી કાળીઓડ પીળક જોવા ગયા. શ્રી મહેશે જળાલ્યું હતું કે તે સવારે લગભગ ૭.૩૦ વાગ્યાની આસપાસ ત્યાં આવેલા એક સૂક્ષ્મ ઝડપની ટોચ પર આવે છે. થોડી વાર ત્યાં રહી પછી જતા રહે છે. અમે સવારે ૭.૦૦ વાગ્યે જ તે સ્થળે પહોંચી ગયા. થોડી રાહ જોયા બાદ કાળીઓડ પીળકની જોડી ત્યાં આવી પહોંચી. શ્રી યશોધનભાઈ તેના કેટલાક ‘રેકર્ડ શૉટસ્’ લીધા.

આ ઉપરાંત તા. ૩૦-૧૧-૦૮ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે પક્ષીનિરીક્ષક મિત્રો શ્રી ધૈર્યત હાથી, શ્રી સૌરભ દેસાઈ અને શ્રીમતી સ્વાતિ દેસાઈ સાથે રણજીતસાગર ડેમની મુલાકાતે ગયા. અહીં તેઓએ થોડી વાર આરામ કરવાનું નક્કી કર્યું. આ દરમિયાન અહીંના બગીચામાં હું ફરી રહ્યો હતો ત્યારે મેં એક કાળીઓડ પીળક જોઈ. એક વર્ષ પહેલાં આ જ તારીખે જામનગર શહેરમાં મેં કાળીઓડ પીળક જોઈ હતી જે એક અદ્ભુત સંયોગ છે.

કૃષ્ણલ જોધી,

૧૮૨, નારાયણનગર, ગુલાબનગર સામે, જામનગર-૩૬૧૦૦૭

## રાગળુની નોંધપોથી

૧ ફેબ્રુઆરી ૧૦ના દિવસે અમદાવાદ થઈ વિરમગામ, બજાણા, પાટડી, દસાડા, વણોદ, બહુચાળ, સીતાપુર, વાસણા, સોલગામ થઈ પરત વિરમગામ સુધી નાનાં નાનાં જળાશયોમાં જઈ પક્ષીનિરીક્ષણ કરવાનો કાર્યક્રમ બનાવ્યો. મેં આ વાત કાસમને કરી, તો તેણે મારી સાથે આવવાની ઈચ્છા વ્યક્ત કરી. અમો વહેલી સવારે નળસરોવર થઈ ભાસ્કરપુરા, લખતર, માલવશ, બજાણા, પાટડી, દસાડા, વણોદ થઈ બહુચાળ આવ્યા. અહીંના તળાવમાં નીલાશિર (Mallard), ટીલિયાળી બતક (Spot-billed Duck) સફેદ કંકણસાર

(Oriental White Ibis) જોયા. ત્યાર બાદ સીતાપુર, જાલીસણા, ઝંગવા, વાસણા, સોલગામ, કૃષ્ણપુરનાં જળાશયો તપાસ્યાં. અહીં યાદ રાખવા જેવી વાત એ છે કે ભૂતકાળમાં સોલગામના સલાસર તળાવમાં મેં પ્રવાસી બતકો જોયેલી. આજે તો આ તળાવને ગંડો બાવળ ભરખી ગયો છે, પાણી સુકાઈ ગયું છે. વાસણા સોલગામ વચ્ચે એક બોરીના ઝડ પર બાદમીંપૂછ માખીમાર (Rusty-tailed Flycatcher) જોવા મળ્યો. કદાચ આ ઉત્તર ગુજરાતમાં જોવા મળેલ આ પક્ષીની પ્રથમ નોંધ છે. તેના ફોટો લીધા.

થોળના તળાવમાં જ ફેબ્રુઆરી અને ૧૧ ફેબ્રુઆરીના દિવસે જળયર પક્ષીઓ સાથે જોવા મળેલ શિકારી પક્ષીઓમાં શાહી જુમ્પસ (Eastern Imperial Eagle), રાખોડિશિર ગરુડ (Greater Grey-headed Fish-Eagle), મત્સ્ય ગરુડ (Pallas's Fish-Eagle), મધિયોબાજ (Oriental Honey-Buzzard), પાન પણાઈ (Marsh Harrier)નો સમાવેશ થાય છે. (ઓળખી શક્યા તેવી તસવીરોના અભાવમાં રાખોડિશિર તથા મત્સ્ય ગરુડની નોંધ અમે ‘પ્રશ્રાર્થ’ સાથે સમાવીએ છીએ. - સ.)

૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૦ના દિવસે વાચા ઈડર, જેડબ્લાન્ડ, અંબાળ થઈને પક્ષીનિરીક્ષણ કરતો માઉન્ટ આબુ જવા નીકળ્યો. રસ્તામાં અંબાળથી ગબ્બર જવાના રસ્તે એક પથર પર કાળા થરથરાની પેટાજાતિ (P.o. rufiventris)નો નર જોવા મળ્યો. સાંજના માઉન્ટ આબુ પહોંચ્યો.

૨૫ ફેબ્રુઆરીના બીજા દિવસે દટ મંદિર જવાના રસ્તે નખી તળાવથી આગળ જતા પીપળના ટેટા ખાવા આવેલ પીળી ચોટીલી રામચકલી (Black-lored Yellow Tit) જોવા મળી. ચારે બાજુ પથારો પાથરી વૃક્ષ-વેલીઓને ભરખી જવા મથતા લેન્ટાના (Lantana)ના વિસ્તરણથી વાતાવરણ શુષ્ણ - કલરવિલોણું લાગી રહ્યું હતું. ત્યાંથી આગળ જતા રસ્તામાં જમીન પર ચણતાં મોરગંદમ (Crested

Bunting)ના નર-માદાના યુગલને જોઈ સંતોષ અનુભવ્યો. એ જ દિવસે ‘જોસ્ટ હાઉસ’ પર પરત આવ્યો.

૨૮ ફેબ્રુઆરીના દિવસે માતર (જેડા) તાલુકાના લીંબાસીથી આરંભ થતા અને પરિઅએજ સુધીમાં આવતાં નાનાંમોટાં જળપ્લાવિત ક્ષેત્રોમાં પક્ષીનિરીક્ષણ માટે નીકળ્યો. ત્રાજ ગામથી પહેલા આવતા જળપ્લાવિત વિસ્તારમાં રાતી સંતાકૂકડી (Ruddy-breasted Crake) જોવા મળી. ગયા વર્ષે આ જ સંતાકૂકડી મને પરિઅએજ પાસેના જળપ્લાવિત વિસ્તારમાં જોવા મળી હતી. મને લાગે છે કે, આ જળકૂકડી આ જળપ્લાવિત વિસ્તારની નિયમિત મુલાકાતી છે. આગળ આવતા પરિઅએજના જળપ્લાવિત વિસ્તારમાં સણીપુંછ ગારખોદ (Greater Pintail-Snipe) અને પાનલવા (Painted Snipe)નો નર જોવા મળ્યો. અન્ય જળચર પક્ષીઓ પણ જોવા મળ્યાં.

૧ માર્ચ ’૧૦ના દિવસે નળસરોવર તરફ પક્ષીનિરીક્ષણ માટે નીકળ્યો. નળસરોવર પહોંચતા જ કાસમને મળ્યો. એણે મને ધ્યાબલા ટાપુ તરફ પક્ષીનિરીક્ષણ માટે જવા આગહ કર્યો. અનું કહેવું હતું કે, તેણે એક નવી ફડકફૂતકી જોઈ છે અને એણે પણ પ્રથમ વાર જોઈ છે. હું તેની સાથે જવા તૈયાર થયો. ‘બોટમેન’ હાસમ ચલવાણી જોડાયો. એ પણ પક્ષીનિરીક્ષણ અને પક્ષીઓના બચાવ માટે કાસમને સાથ આપી રહ્યો છે. અમો ત્રાજે આવીને વન અધિકારીઓ માટે બનાવેલ મકાનના બગ્ગીયામાં આવીને બેઠા. હાસમ મોટો વાંસ શોધવા તળાવ તરફ જવા લાગ્યો. એટલામાં તો પાસેના ઝડપ પર એક પક્ષી તીણી ચીસ પાડી ધબ દઈ જમીન પર પટકાયું. અમારી ત્રાજેની નજર તેની ઉપર પડી તે કલકલિયો (White-breasted Kingfisher) હતો. એ

જ સમયે અમોએ ઝડપ પર નજર કરી તો ઉપર શકરા (Shikra)ને બેઠેલો જોયો. અમો વાત સમજ ગયા કે કલકલિયો નીચે કેમ પટકાયો. તે શકરાનો શિકાર બનતો બચી ગયો. અમો ત્રાજે ત્યાં બેઠા વિચારવા લાગ્યા કે હમણાં આવીને શકરો કલકલિયાને ઉઠાવી જશે, પરંતુ એવું ન બન્યું એણે તો ત્યાંથી ઊરી નજીકની ઝડીમાં દેકારો મચાય્યો. જોઈ પક્ષીનો પીડાકારક અવાજ આવી રહ્યો હતો. કાસમ દોડી તે તરફ ગયો કે શકરાએ બીજું પક્ષી તો પકડયું નથી ને? એવું જ હતું. કાસમે તુરત જ ડેમેરો લઈ દોડી આવવા કશ્યું. હું ડેમેરો લઈ ધીરે ધીરે એ તરફ ગયો. અમો ત્રાજે આશ્રયમાં ગરકાવ થઈ ગયા. અમે દૂરથી જ જોવા લાગ્યા તો જણાયું કે, શકરાએ પોતાના પંજામાં કંઠીલા ચુગડ (Collared Scops Owl)ને ખૂબ ચુસ્ત રીતે પકડી રાખ્યું હતું અને ચાંચ પર ચાંચ મારી તે ઘાયલ કરી રહ્યો હતો. મેં દૂરથી જ તેની તસવીરો લીધી. અમારી પર નજર પડતાં જ તે પોતાના વજન કરતાં પણ વધુ વજન ધરાવતા ચુગડને પંજામાં ફસાવી બીજા ઝડપ પર જવા પ્રયત્ન કરતા તે પેલા ચુગડ સાથે જમીન પર પટકાયો. અમો ત્રાજે તેને જોઈ પણ પ્રકારે ખલેલ ન પહોંચાડવાનો નિર્ણય લઈ ત્યાં જ બેસી રહ્યા. શકરો ત્યાંથી ઊરી બીજા ઝડપ પર પોતાના શિકાર સાથે ચાલ્યો ગયો ને અમો ત્રાજે તળાવ તરફ જવા ચાલી નીકળ્યા.

હાસમે બોટમેનની ફરજ બજાવી. અમો ત્રાજે ધ્યાબલા બેટ પર આવ્યા. અહીં ધાસમાં ઊડાઊડ કરતી એક ફૂતકી દેખાઈ. મેં દૂરબીજી જોયું તો તે રણ ફડકફૂતકી (Streaked Wren-Warbler અથવા Graceful Prinia) હોવાનું જણાયું. કાસમે કશ્યું કે – “સાહેબ હું તેને અહીં પ્રથમ વાર જોઈ રહ્યો છું.” મેં તેના ફોટો લીધા. અહીં અમોએ ગાંડાબાવળ નીચે લપાઈને બેઠેલા

Publisher, Printer and Editor : Dr. Bakul Trivedi, 19/414, Satyagrah Chhavni, Satellite Road, Ahmeabad 380015. Owner : Vihang Research Foundation, Ahmedabad. Printed at : Bhagwati Offset, Bansidhar Estate, Bardolpura, Ahmedabad-380001. Laser Typesetting : Sharda Mudranalay, 201 Panchwati 1st Lane, Ambawadi, Ahmedabad-380015.

## નિરીક્ષણ નોંધ

ચાબુક દશરથિયા (Franklin's Nightjar)ને જોયું. ફોટા લીધા, પરંતુ સ્પષ્ટ રીતે ન લઈ શકાયા કારણ કે સામે જ સૂરજ હતો. થોડા નિરાશ તો જરૂર થયા. અહીં અમોને એ જ હિવસે પીલુડીના ઝડમાં છુપાઈને બેઠેલો રવાઈડો (Short-eared Owl), વગડાઉ બટાવડા (Chestnut-bellied Sandgrouse)નું યુગલ અને મોટી ધાનચીરી (Brown Rock Pipit) પણ જોવા મળ્યાં.

૨૬ માર્ચના હિવસે નળસરોવરથી કાસમનો ફોન આયો કે, “સાહેબ ! મોટા પાન કરકરિયો (Indian Great Reed-Warbler) ગુજરાતમાં ઈડા મૂકે છે ખરો ?” મેં તેને જવાબ આય્યો કે, “ના હજુ સુધી મને ક્યારે પણ ગુજરાતમાં તે ઈડા મૂકૃતો જોવા મળ્યો નથી.” એણો કહ્યું, “મારો અને હાસમનો રમત્તાન લાસા બેટ તરફ ગયા હતા તેમને જોવા મળ્યો છે. તમારે જો જોવો હોય તો આજે જ આવી જાવ.”

હું તુરત જ તૈયાર થઈ રિક્ષા દ્વારા નળસરોવર પહોંચ્યો. હાસમને બોલાવી હોડીનું સુકાન સંભાળી લઈ લાસા બેટ તરફ હંકારી જવા સૂચન કર્યું.

આકાશ આગ ઓકી રહ્યું હતું. અમો ત્રણો અડધા કલાકમાં લાસા બેટની નજીક આવી ગયા. હાસમને દૂરથી મોટા પાન કરકરિયાએ ઘાસમાં જ્યાં ઈડા મૂક્યાં હતા તે જગ્યા દેખાડી. મેં એને સ્પષ્ટ સૂચના આપી કે આપણે તેનું નિરીક્ષણ ૩૦-૪૦ ફૂટ જેટલા અંતરેથી જ કરવું. સાથે સાથે આસપાસમાં પાનપણાઈ (western Marsh-Harrier) જેવું શિકારી પક્ષી તો ઊરી તો રહ્યું નથી ને તે ચકાસવું. કારણ કે તેની વૃત્તિ લગભગ કાગડા જેવી હોય છે. (પાણીનાં સંગાથીમાં શ્રી લાલસિંહ રાઓએ તેને ઓગરસ્તમાં જોયા-ચાંભણ્યાનું તથા તેની અહીં માળા કરવાની શક્યતા વિષે જગ્યાવ્યું છે. ગુજરાતમાં તે નિયમિત માળા કરે છે પણ દુભૂંયે આ માહિતી છપાતી નથી તેમ ડૉ. પારાશર્યાએ જગ્યાવ્યું. - સં.)

હોડીને અમોએ માળાથી બને તેટલી દૂર રાખી.

દૂર રહી દૂરબીનથી જોવાનું નક્કી કર્યું. મોટા પાન કરકરિયાના નર-માદા બચ્ચાને ખવડાવવામાં મશગૂલ હતા. અમે દૂરથી જ તસવીરો ઝડપી અને તુરત જ ત્યાંથી હટી જઈ લાસા ટાપુ પર આવી પહોંચ્યા. અહીં પ્રાણયચેષ્ટામાં તલ્લીન પાનલવા (Painted Snipe)ના યુગલને જોયું. ઘાસ કાપી નાખ્યું હોવાથી તેમને સ્પષ્ટ રીતે જોવાનું સરળ હતું. અમો ત્રણી ત્યાં જ થોભી જઈ નીચે બેસી તેમનું નિરીક્ષણ કર્યું. તસવીરો ઝડપી. અહીં અમોને પાણીમાં ઊભેલું સણીપૂછ ગારખોદ અને પ્રજનન પોશાકમાં સુસજ્જ મોટા તેજપર (Collared Pratincole)નું યુગલ પણ જોવા મળ્યું. જંગલખાતાના અવિકારીઓ દ્વારા ઉનાળાની પ્રજનન ઝતુમાં જ ઘાસ કપાવી નાખવાની પ્રવૃત્તિ યોગ્ય લાગી નહીં. રસ્તામાં પ્રજનન પોશાકમાં તૈયાર અન્ય જળચર પક્ષીઓ પણ જોયા.

### રજની ત્રિવેદી

સી. મંગલકીર્તિ ફેલેટસ, સેટ. રોડ, જોધપુર ગામ પાસે, અમદાવાદ-૧૫

### બુલબુલનો વિજય

આમ તો દર વર્ષે આ ઝતુમાં અમારે ચકલા અને બુલબુલ વર્ષે માળાની લડાઈ ચાલે તેમાં ચકલા જીતી જાય. પરંતુ આ વખતે બુલબુલનો વિજય થયો. બુલબુલે માર્ચ '૧૦માં અમારી લોભીના ડિરોળા પરના નાના 'ટેબલફેન'ની ઉપરના ભાગે માળો બાંધેલ. મેં આ બાબત નોંધ પણ રામેલ. તા. ૨૨-૩-૧૦ના રોજ બે ઈડાં જોવા મળ્યાં. ઈડાં એરેંડીનાં બીજ જેવાં તપખીરિયા ટપકાંવાળાં હતાં. તા. ૩-૪-૧૦ના રોજ બે બચ્ચાં જોવા મળ્યાં. જો કે, એ ચોક્કસ ખ્યાલ નથી રહ્યો કે બન્ને ઈડાંમાંથી બચ્ચાં સાથે આવ્યા કે વારાફરતી. હાલ તેની માદા બચ્ચાને બહારથી જીવાત લાવીને ખવડાવે છે, તેમજ રાત્રે પણ માદા જ માળા પર બેસે છે. બચ્ચાનું ધ્યાન બંને રાખે છે.

સાથોસાથ મકાનના 'ઓર પાઈપ'માં ચકલીએ ઈડા મૂકી દીધેલ તેમાંથી પણ બચ્ચાં નીકળી ચૂક્યાં છે. તા. ૧૮-૩-૧૦ના રોજ સવારનો નાસ્તો કરવા બે દૈયક

(Oriental Magpie-Robin), કોયલ (Asian Koel)નાં નરમાદા, બ્રાહ્મિણી મેના (Brahminy Myna)-ર અને ઘોડા કાબર (Bank Myna) આવેલા. (ધારે જવાના પગથિયા પર જ્યાં દાઢા અને રંધીલો ખોરાક રાખીએ છીએ.)

તા. ૧૧-૪-૧૦થી ફરી એક ચકલીયુગલે ‘મીટર બોક્સ’ પર માળો બાંધવાનું શરૂ કરેલ છે. ક્યારેક બુલબુલ અને ચકલા વચ્ચે અફ્ઝાતફ્ઝા બોલી જાય છે.

નિરાલી ભંડ

૧, ભારતીય, સરદારનગર-૧, ધરી-૩૬૫૬૪૦



### ગીરમાં બદામી રણગોધલાનાં ઈંડાં

તા. ૨ માર્ચ '૧૦ના રોજ ડાંગરભાઈનો ફૈન આવેલો કે દલખાણિયા પાસે એક ખેતરમાં બદામી રણગોધલા (Indian Courser)-નો માળો તથા ઈંડાં છે. મને આ સમાચાર જાણી આનંદ થયો. કારણ પ્રથમ વખત આ પક્ષીને ગીરમાં જોવાનો લહાવો મળશે. હું બીજા દિવસે વહેલી સવારે ૬.૩૦ કલાકે અહીંથી રવાના થઈ ૭.૦૦ કલાકે દલખાણિયા પહોંચ્યો. ત્યાંથી મારી સાથે બાધાભાઈ ચોકીદાર જોડાણા. અમો બન્ને સેમરડીના નાકા આગળના ભાગેથી એક ખેતરના રસ્તે ફીફાઈ ગયા. ખેતરમાં ઘણી બધી તપાસ કરતા ડાંગરભાઈની નિશાની પરથી નીલગાયની લીંડીની વચ્ચે બે ઈંડાં (ટિટોડીનાં ઈંડાં જેવાં) બિલકૂલ વાતાવરણ સાથે ભળી ગયેલા જોયાં. અમે દૂર જઈને બેઠા, બાજુમાં

કુવામાંથી ગાળ કાઢવા માટે ઓઈલ એન્જિન ચાલુ હતું. પક્ષી ઈંડાં પર ન હતું. લગભગ દોઢ કલાક બાદ આવતું જણાયું. આવી અને ઈંડાં પર બેસી ગયું. ઘણું દૂર હતું. ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો. અમે તેમને ખલેલ પહોંચાડ્યા વિના. ૧૧.૦૦ વાગ્યે રવાના થયા.

તા. ૭-૩-૧૦ના ફરી બપોરના ૪.૦૦ કલાકે ત્યાં જોવા ગયેલ. પક્ષી ઈંડાં પર બેટું હતું. મેં બાજુની ખાડા જેવી જગ્યામાં જઈ આડશ (hide) કરી તસવીર લીધી. તેમણે થોડું ટિંબુનીયું જોયું. પરંતુ હવે બહુ હલચલ કરતું ન હતું. ખેતરના માલિક મનસુખભાઈને આ વાતની જાણ કરતા તેમણે પણ એટલો ભાગ બાકી રાખીને ખેતર ખેડ્યું. તેમને ધાચવાદ !

તા. ૧૮-૩-'૧૦ રજાનો દિવસ હોવાથી મેં અને મારા મિત્ર અર્જુનભાઈ વિરાણીએ સાપનેસ પાસેના એક ઘટાટોપ વડની નીચે બપોર ગાળવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે દેખાતાં પક્ષીઓમાં, ચેતનયના (Oriental White-eye), દૈયડ (Oriental Magpie-Robin), રાખોડી રામચકલી (Great Tit), અધરંગ (Tickell's Blue-Flycatcher), દૂધરાજની માદા (Asian Paradise-Flycatcher), તૂંઈ (Plum-headed Parakeet), નાચડા (White-browed Fantail-Flycatcher), શકરો (Shikra) અને તેનાં બે બચ્ચાં, આ બધું જોયું. નીલપંખાના (Black-naped Monarch-Flycather) નરને વારંવાર નેવરીના ઝાડ પર આવતો જોયો. થોડું

### સ્ટોલિકગ્રૂકા વિષે...

જેના નામ પરથી રણપિદા (Stoliczka's Bushchat, *Saxicola macrorhyncha*)નું અંગ્રેજ નામ પડ્યું છે તે વૈજ્ઞાનિક વિશે જાણો છો ? ફર્દિનાન્ડ સ્ટોલિકગ્રૂકાનો જન્મ ૧૮૮૮માં એકોસ્લાવેકિયામાં થયો હતો. ૧૮૬૨માં આ ભૂત્તરશાસ્ત્રી બ્રિટિશ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં જોડાયા. અહીં એમણે ભારત અને

હિમાલયના પ્રાણીશાસ્ત્ર અને ભૂત્તરશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૮૭૧માં ફર્દિનાન્ડ સ્ટોલિકગ્રૂકાએ કચ્છની મુલાકાત લીધી હતી. એમણે કચ્છમાં જોવા મળતા ચિત્તાનો અભ્યાસ કર્યો અને રણપિદાની શોધ કરી. આ સાહસપ્રિય વૈજ્ઞાનિક કારાકોરમના પર્વતોના સર્વેક્ષણ દરમિયાન ૧૮૭૪માં મૃત્યુ પામ્યા. એમની કબર લેહમાં આવેલી છે.

- સંકલિત

## નિરીક્ષણ નોંધ

ઉત્ત્મ થઈ નજીક જતા ઉડીને બીજા ઝડ પર ચાલ્યો  
જાય. ગયા વખતે આ વિસ્તારમાં તેનો માળો જોવા મળેલ  
એટલે મેં અનુમાન બાંધ્યું કે કદાચ આવતા ચોમાસામાં  
તેનો માળો અહીં ફરી જોવા મળે.

અજિત ભંજ

૧, ભારતીજ, સરદારનગર-૧, એસ.ટી. ટેપો પાસે, ધારી-૩૬૫૬૪૦



### શરદ પંથ પ્રવાસી પક્ષીઓની વર્ષ

#### ૨૦૦૮ની મારી નોંધ

(ઓગસ્ટ ૨૦૦૮થી નવેમ્બર ૨૦૦૮ દરમિયાન)

#### ૧. કાશ્મીરી ચાસ (European Roller)

સ્થળ	તારીખ	સંખ્યા	અંતુનો પ્રથમ
દેવપર મોટા વક્ષ, તા. નખત્રાણા	૮-૮-૦૮	૦૧	
બાબીયા ડેમ, તા. મુન્દ્રા	૨૬-૮-૦૮	૦૩	
રતનાલ - નિંગાળ, તા. અંજાર	૬-૯-૦૮	૦૨	
ભુજ - રદ્માતાડેમ, તા. ભુજ	૮-૯-૦૮	૦૨	
ભડલી - મોટી વિરાણી - છારીગામ અને પરત સામત્રા - ગોડપર	૧૦-૯-૦૮	૧૮	
માંડવી - ડોણ, તા. માંડવી	૧૮-૯-૦૮	૧૦	
દેવળિયા - સાપેડા, તા. અંજાર	૨૫-૯-૦૮	૦૬	
એડમન્ડ લેક, તા. ભુજ	૩૦-૯-૦૮	૦૧	
સામત્રા - છારી વર્ચ્યે,			
તા. નખત્રાણા	૮-૧૦-૦૮	૨૦	
નખત્રાણા - છાતીર, તા. નખત્રાણા ૮-૧૦-૦૮		૦૭	
દેશલપર - કીરો કુંગર	૧૧-૧૦-૦૮	૧૪	
કનૈયા બે - આડેસર			
તા. ભચાઉ - રાપર	૨-૧૧-૦૮	૧૦	
નખત્રાણા - મોટી વિરાણી			
તા. નખત્રાણા	૫-૧૧-૦૮	૦૧	
મંજલ - દેશલપર,			
તા. નખત્રાણા	૬-૧૧-૦૮	૦૧	
૨. હિવાળી માખીમાર (Spotted Flycatcher)			
૧. નિંગાળ રખાલ, તા. અંજાર	૬-૯-૦૮	૦૩	

અંતુનો પ્રથમ

૨. નખત્રાણા - ભડલી,		
તા. નખત્રાણા	૧૦-૯-૦૮	૦૨
૩. એડમન્ડ લેક, તા. ભુજ	૩૦-૯-૦૮	૦૪
૪. કૂલાય ગામ, તા. નખત્રાણા	૮-૧૦-૦૮	૦૧

### ઉનાળામાં છારીટંટ પર પક્ષીનિરીક્ષણ

તા. ૨૮-૪-૧૦થી ૧-૫-૧૦ દરમિયાન છારીટંટ પર ગીર ફાઉન્ડેશનની ટીમ સાથે જવાનું થયું ત્યારે જોયેલાં મુખ્ય પક્ષીઓની યાદી આ સાથે સામેલ છે.

પક્ષીનું નામ	સંખ્યા
ગુલાબી પેણ (Great White Pelican)	૪૦૦ +
કબૂત બગલો (Grey Heron)	૧૦
નરી બગલો (Purple Heron)	૦૫
પીળીચાંચ ઢોક (Painted Stork)	૬૦
સરેટ ઢોક (European White Stork)	૦૧
કાળીડોક ઢોક (Black-necked Stork)	૦૪
મોટો હંજ (Greater Flamingo)	૧૦૦૦ +
નાનો હંજ (Lesser Flamingo)	૮૦૦ +
નાની કંકણાસર (Glossy Ibis)	૧૫
શીલિયાળી બર્ટક (Spot-billed Duck)	૬૦
પિયાસણ (Eurasian Wigeon)	૬૦
ચેતવા (Garganey)	૦૫
ગયણો (Northern Shoveller)	૪૦
નીલ જલમુરઘો (Purple Moorhen)	૩૦
ભગતું (Common Coot)	૨૧૦
ભુલામણી ઢોગિલી (Kentish Plover)	૩૦
ખલિલી (Eurasian Curlew)	૦૮
મોટો ગડેરો (Black-tailed Godwit)	૧૬૦
કાળો રાતાપગ (Spotted Redshank)	૧૫
નાનો લીલાપગ (Marsh Sandpiper)	૦૧
ટપકીલી તુતવારી (Wood Sandpiper)	૦૧
શીલિયો (Ruff)	૦૫
ગજાંડુ (Black-winged Stilt)	૩૫

વાધોમડી (Slender-billed Gull)	૧૦૦	છે. મોટા ભાગનાં યાયાવાર પક્ષીઓએ વિદ્યાય લીધી છે,
કાશ્મીરી વાબગલી (Whiskered Tern)	૧૮૦	ઇતાં અમુક યાયાવાર પક્ષીઓ હજુ પણ દેખાય છે;
મોટી વાબગલી (Caspian Tern)	૫૦	જેમાં, અમુક વિરલ યાયાવાર પણ છે. તેઓ ટૂંક સમયમાં
શૈતપંખ કાળી વાબગલી (White-winged Black Tern)	૦૧	વિદ્યાય લેશે.
પતરંગો (Blue-cheeked Bee-Eater)	૦૩	<b>ગુલાબી તૂતીની મારી કચ્છમાં નોંધ</b>
નાનો પતરંગો (Small Bee-Eater)	૦૨	કચ્છમાં ગુલાબી તૂતી (Common Rosefinch)
(માળમાં બરચાંને ખવડાવતાં)	૦૨	અલભ્ય પક્ષી છે. અને અનિયમિત શિયાળુ મુલાકાતી છે.
રાજ (Yellow-throated Sparrow)	૦૩	મારી કચ્છમાં નીચે મુજબની નોંધ છે.
મોટો ચંડૂલ (Common Crested Lark)	૦૩	ફૂલાય રખાલ, તા. નખત્રાણા, તા. ૧૮-૧૨- ૨૦૦૭ (૦૨ સંખ્યા)
પાન ફડકુરૂતી (Plain Prinia)	૦૩	ફૂલાય રખાલ, તા. નખત્રાણા, તા. ૨૪-૧૨- ૨૦૦૮ (૦૧ સંખ્યા)
ઢંઢમાં પાણી સારાં પ્રમાણમાં છે પરંતુ હવે પાણી આનું થઈ ગયું હોઈ ખારા પાણીનાં પક્ષીઓ જોવા મળે		શાંતીભાઈ વડુ,

### કચ્છમાં માળાવસાહિતની માહિતી, વર્ષ ૨૦૧૦

આ વરસે કચ્છમાં જુલાઈ-ઑગસ્ટ ૨૦૧૦ દરમ્યાન જે માળાવસાહિતો (herony) જોઈ, તેની માહિતી આ સાથે રજૂ કરેલ છે.

#### ૧. રાજેન્ડ્રખાગ, હિમીરસર તળાવ, બુજ (૨૮-૭-૨૦૧૦)

ઢોર બગલા (Cattle Egret) : ૪૦૦ માળા ૨૦ વૃક્ષો પર. અમુક માળમાં બચ્ચાં હતાં. અમુક માળમાં ઈડાં હતાં, જેના સેવનની કામગીરી ચાલુ.

સર્પશીવ (Darter) : ઝડપ પર ૨ અપુખ્ત જોવા મળેલ જેનું અહીં પ્રજનન થયું હોવું જોઈએ.

મોટો કાજિયો (Great Cormorant) : ૫ અપુખ્ત જોવા મળેલ. તેનું અહીં પ્રજનન થયેલ હોય તેમ જણાય છે.

#### ૨. બોચા આડબંધ, તા. મુંદ્રા (૧-૮-૨૦૧૦)

ઢોર બગલા : ૨૦૦ માળા અમુકમાં બચ્ચાં, અમુકમાં ઈડાં સેવવાનું ચાલુ.

વચેટ ધોળો બગલો (Median Egret) : ૩ માળા, ૨થી ૩ બચ્ચાં, ૩ પુખ્ત પક્ષીઓ.

નાનો કાજિયો (Little Cormorant) : ૧૦ માળા, ૧૨ પુખ્ત પક્ષીઓ, ઈડાંસેવન ચાલુ.

સર્પશીવ : ૨ માળા, ૩ પુખ્ત પક્ષીઓ, ઈડાંસેવન ચાલુ.

#### ૩. મોથાળા નજુક આડબંધ, તા. અબડાસા (૧૫-૮-૨૦૧૦)

ઢોર બગલા : ૪૦૦માળા તથા પુખ્ત પક્ષીઓ, ઈડાંસેવન ચાલુ.

નાનો કાજિયો : ૭૦ માળા તથા પુખ્ત પક્ષીઓ, ઈડાં સેવન ચાલુ.

સર્પશીવ : ૦૧ માળો તથા પુખ્ત પક્ષી, ઈડાંસેવન ચાલુ.

## નિરીક્ષણ નોંધ

૪. કંકેશ્વર શિવમંદિર નજુકનું તળાવ, રતનાલ, તા. અંજાર (૨૮-૮-૨૦૧૦)

ઢોર બગલા : ૨૫૦ માળા, ૪૦૦ પુખ્ત પક્ષીઓ, ઈંડાંસેવન ચાલુ, જૂજ બર્ચાં.

સર્પશ્રીવ : ૮ માળા, ૮ પુખ્ત પક્ષીઓ, ૧ માળામાં ૪ બર્ચાં, બાકી ઈંડાંસેવન ચાલુ

નાનો કશ્યાંઘ : ૫ માળા, ૮ પુખ્ત પક્ષીઓ, ઈંડાંસેવન ચાલુ.

ચમચો (Eurasian Spoonbill) : ૧૦ પુખ્ત પક્ષીઓ, ૮ માળા, ઈંડાંસેવન ચાલુ.

૫. નિંગાળ તળાવ, તા. અંજાર (૨૮-૮-૨૦૧૦)

પીળીચાંચ ઢોક (Painted Stork) : ૨૦૦ માળા, ૨૫૦ પુખ્ત પક્ષીઓ, અમુકમાં માળાની તૈયારી તો અમુકમાં ઈંડાંસેવન ચાલુ, ૭ વર્ષ બાદ અહીં પ્રજનન થયેલ છે.

સર્પશ્રીવ : ૩ માળા તથા ૩ પુખ્ત પક્ષીઓ, ઈંડાંસેવન ચાલુ.

ઢોરબગલા : ૨૦૦ માળા ને તેટલા જ પુખ્ત પક્ષીઓ, ઈંડાંસેવન ચાલુ.

આ વસાહતની મુલાકાતમાં આ લખનાર ઉપરાંત નવીન બાપટ, ઈભાહીમ દરવાડિયા, સુબોધ હાથી તથા ફીરમામદ ટૂર્ક જોડાયેલ.

શાન્તિલાલ વડુ

જૂના વાસ, મંદિરવાળો ઝાંચો, માધ્યમિક, ભુજ-૩૭૦૦૨૦

## માટી કામના કલાકાર (કુંભાર)નું નવું સોપાન

તમારામાં જો કોઈ પણ કામની આગવી પ્રતિભા હોય અને તે પ્રતિભાને જો કોઈ ઓળખનાર મળી રહે તો સોનામાં સુગંધ ભણે છે.

આનું જવતુંજગતું ઉદાહરણ છે, શ્રી દામજભાઈ કેશુભાઈ ભરડવા (પ્રજાપતિ). મૂળ જાફરાબાદના આ સોરઠિયા પ્રજાપતિ, જે હાલમાં ઘણાં વર્ષોથી જૂના વાડજ, અમદાવાદમાં રહી માટીકામના વ્યવસાયમાં છે.

પ્રકૃતિપ્રેમી શ્રી લવકુમાર ખાચરના વિચારોને મૂર્તિમંત કરી દામજભાઈએ પક્ષીઓના સુંદર માટીના માળાઓનું સર્જન કર્યું. અત્યારે જુદી જુદી જગ્યાએ આવા માટીમાંથી બનાવેલા માળાઓનો ખૂબ જ બહોળો ઉપયોગ થઈ રહ્યો છે.

આ માટીના માળા પક્ષીઓ માટે વધારે સલામત, વધારે અનુકૂળ અને સુંદર પણ છે. તમે તેને જાડ ઉપર છિત ઉપર કે થાંભલા ઉપર રાખી શકો છો.

સરનામું : શ્રી દામજભાઈ કેશુભાઈ પ્રજાપતિ (ભરડવા), પ્રકાશ નર્સરી, કલીર ટેકરી, નદીકિનારે, દશામાના મંદિર પાસે, જૂના વાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩ મો. ૯૮૮૮૨૮૭૦૪૫

Advt.



## કચ્છની પ્રવાસ-ગાથા

ગિરીશ આથર

પ્રવાસવિષયક સાહિત્ય, સુખ્યાત પક્ષીવિદોનાં વખાણ તથા સુંદર તસવીરોએ મારા મનમાં કચ્છ પ્રત્યે હંમેશાં અનેરું આકર્ષણ ઊભું કર્યું છે. આમાં સ્વ. સલીમ અલીની સ્મૃતિનોંધ મોખરે છે. હું ૨૦૦૮માં અમદાવાદ આવ્યો પછી પહેલી વાર કચ્છની સ્વનયાત્રાને નક્કર સ્વરૂપ મળવાનું હતું. એ હતું ૨૦૦૮નું કિસમસ એટલે કે ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ.

૨૫મી ડિસે. '૦૮:

અમદાવાદથી ૬.૦૦ વાગ્યે સવારે પ્રવાસનો આરંભ કર્યો. ૧૧.૦૦ વાગ્યે હળવદ વટાવ્યું ત્યાં સુધીમાં જ મેં ન જોયેલી કેટલીક પક્ષીજાતિઓ મારી યાદીમાં ઉમેરાવા માંડી. શરૂઆત થઈ મોટા કાબરા પિંડા (Variable Wheatear)થી. રસ્તામાં બદામી રણગોધલા (Indian Courser) તથા વગડાઉ ટિટોડી (Yellow-wattled Lapwing)ની જોડ જોઈ. મોરઝીના પુલ પાસે પહોંચતાં કાંટવિસ્તારમાંથી અણાટ ખુલ્લો ખાર-ન્યાંદેશ શરૂ થઈ ગયો. રસ્તાની બાજુનાં ખાંબોચિયાંમાં અમને ધોમડા (Gulls), વાબગલીઓ (Terns), પીળીચાંચ ઢોક (Painted Stork) તથા નાનાં હંજ (Lesser flamingo) છૂટાંછવાયાં મળ્યાં. ધોમડા અને વાબગલીની ઓળખ માટે અમારી પાસે પૂરતો સમય ન હતો, છતાં કાળીપીઠ ધોમડો (Heuglin's Gull) શ્યામશિર ધોમડો (Black-headed Gull), ધોળી વાબગલી (Gull-billed Tern), કાશ્મીરી વાબગલી (Whiskered Tern) તથા મોટી વાબગલી (Caspian Tern)ને ઓળખ્યાં. અમારે બપોર સુધીમાં ભુજ પહોંચવાનું હોઈ ત્યાંથી નીકળી ગયા. થોડી ચચ્ચીવિચારણા બાદ ભુજથી માંડવી તરફ ઊપરી ગયાં.

બપોર પછી માંડવી તરફ જતાં નાનાં પક્ષીઓનું

એક મોટું ટોળું જોયું. તેને અમે સડ્રચંકૂલ (Greater Short-toed Lark) તરીકે ઓળખી. ભુજથી ૧૦-૧૨ કિ.મી. દૂર હતા ત્યાં વાહનમાંથી જ રણ બુલબુલ (White-eared Bulbul)ના એક જૂથની સાથે ભૂખરા રંગનું એક પક્ષી જાડ પર બેઠેલું જોયું. આ રાખોડી - બદામી રંગનું પક્ષી પાતળું અને ઉભડક બેઠેલું હતું, જે ભૂતકાળમાં મેં જોયેલા એક પણ પક્ષી સાથે સામ્ય ધરાવતું ન હતું.

આ પક્ષી પીળા-વાલ બોર ખાતું હતું. અમે જેવું વાહન ઊભું રાખ્યું તેવું તે પક્ષી નીચાણની જાડીમાં ઉત્તરી ગયું. પક્ષીની આ આઈ જલક મસ્કતી લટોરા (Hypocolius)ની માદાને મળતી આવતી હતી. ભલે પાંચમાંથી બે જ જણા પક્ષીનિરીક્ષકો હતા, પણ આ કાણ અમારે માટે મહાન હતી. માંડવી પહોંચવું હતું એટલે પક્ષીની પાછળ પાછળ જવાનો સમય નહોતો. શ્રી અચ્ચિન પોમલ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે આ ખૂબ જ વિરલ પક્ષી છે. કચ્છમાં પણ તે ફુર્દ્દભ છે તેની મને ખબર નહીં. અચ્ચિનભાઈના જણાવ્યા પ્રમાણે વર્ષો પહેલાં તેમણે માંડવી પાસે મસ્કતી લટોરાને જોયો હતો. કમનસીબ બહુ સારો કેમેરા ન હોવાથી અમે તેની તસવીર ન લઈ શક્યા. નવા પક્ષીઓની યાદીમાં મારો આ એક વધુ ઉમેરો. સાંજે ૪.૩૦ વાગ્યે માંડવી પહોંચી અમે વિજય-વિલાસ મહેલ તરફ આગળ વધ્યા. રસ્તામાં ખરાબાની જમીનમાં અમે થોડાં કાદવિયાં (waders) જોયા. ધ્યાનથી જોતા સોએક ટીલિયા (Ruff) ચરતાં દેખાયાં. એ જ જેતરમાં ૨૦ બદામી રણગોધલા (Indian Courser) દેખાયા. બે જુદા જુદા પ્રકારનાં કાદવિયાંનું એક જ વિસ્તારમાં હોવું રસપ્રદ લાગ્યું. ટીલિયા મહાંદશો કણભક્ષી છે, જ્યારે રણગોધલા જીવાતભક્ષી. આમ એક જ વિસ્તારમાં તે બંનેની

ઉપસ્થિતિમાં કોઈ હરીફાઈનું તત્ત્વ ન હતું.

જેમ જેમ અમે દરિયાકિનારા તરફ જતા ગયા તેમ તેમ સૂકા ઉજજડ વિસ્તારમાંથી વધુ વનરાજ્ઞવાળો વિસ્તાર શરૂ થયો. મહેલનો બગીચો દેખરેખ વિના જંગલ-સ્વરૂપ થઈ ગયેલો હતો. એવું ધારી શકાય કે સોદોફસો વર્ષ પહેલાં રાજા-મહારાજાઓ દ્વારા રચિત તે અતિસુંદર બાગ હતો – જે હવે કુદરતી રીતે ફાલીને જંગલ બની ગયો છે. હું મહારાજા મદનસિંહજી જેઝે, જેઓના પ્રયત્નોથી આ વિસ્તાર વનશ્રીથી આટલો સમૃદ્ધ બન્યો છે, તેઓને બિરદાવું છું. મહેલના પ્રાંગણમાં પ્રવેશતાં જ ઝાંખી લીલી હુટી (Greenish Leaf-Warbler)નો અવાજ સંભળાયો અને તરત જ પછીથી સાદી હુટી (Hume's Warbler)નો પણ. આગળ જતાં પેલ્ટોફોરમની ઘટામાં સાદી હુટીને તો મેં શોધી કાઢી. આ વિસ્તારને ‘જંગલ’ તરીકે સંબોધવું મને યથાર્થ લાગ્યું, કારણ કે આ બંને હુટીઓ જંગલ વિસ્તારમાં જ શિયાળું મુલાકાતી તરીકે, જોવા મળે છે. મહેલની છત ઉપર થોડી અભાબીલ (Dusky Crag Martin) તથા અભાલી (House Swift)ને જોઈ.

પછીથી અમે માંડવીના દરિયાકિનારે ગયા. ત્યાં પહોંચીને અમે ઘણી સફેદ પેણ (Great White Pelican), ધોમડા તથા કાદવ ખૂંદનારાંને પચ્ચિમ દિશા તરફ ઊડતાં જતાં જોયા. તેઓ કદાચ કચ્છના અખાતના દક્ષિણ કિનારા પર ઓખાની આસપાસ આવેલા ટાપુઓ પર જતાં હોઈ શકે – તેનું સીધું અંતર અહીંથી માંડ ઉડ કિ.મી. થાય. કિનારા પર કરચલાની પાછળ દોડતાં કાચબરંગી (Ruddy Turnstone) જોયા. સુંદર સૂર્યાસ્તને માફી રાતવાસા ભણી ઊરી જતાં પક્ષીઓનાં દોળાની સાથે અમે પણ ભુજ તરફ રવાના થયા.

૨૬ મી. ડિસે. '૦૮:

શ્રી અશ્વિન પોમલ સાથે ચર્ચા કરી અમે નલિયા થઈ લખપત તરફ જવા નીકળ્યા. ભુજથી સવારે ૬.૦૦ વાગ્યે નલિયા તરફ પ્રયાણ આદર્દું. રસ્તામાં બે-ત્રણ ઠેકાણે વિરામ કરતાં થોરિયો ગંદમ (Grey-necked

Bunting), મોટો કાબરો પિંફો, ગુલાબી તૂટી (Common Rosefinch) તથા સદ્ગંડુલ જોયા. એકદમ અળગું તરી આવે એવું અવલોકન હોય તો તે ઓર્ટોલાન ગંદમ (Ortolan Bunting)નું. અમે તેની ઓળખ એકદમ ખાતરીપૂર્વક ન કરી શક્યા કારણ કે તે ઝડીમાં જતું રહ્યું. રસ્તે પડતર ખેતરોમાં અમે સેંકડોની સંખ્યામાં કુજ (Common Crane) તથા કરકરા (Demoiselle Crane) જોયા.

સવારે ૮.૦૦ આસપાસ, નલિયાથી ૨૨ કિ.મી. દૂર બીટા ગામ પાસે એક નાની ટેકરી પર ગીધ જોઈને ઊભા રહ્યા. ૧૩ ગીધ (Indian White-backed Vulture) અને ૨ પહાડી ગીધ (Eurasian Griffon) હતાં. તેઓ એકદમ સાવધ થઈ ગયેલાં લાજ્યાં. અમે વ્યવસ્થિત જોવા જોવા વાહનની નીચે ઊતર્યા કે કૂતરા જેવું એક પ્રાણી પાછળથી તોકિયું કરતું દેખાયું. એ શું હતું તે જાણી શકીએ તે પહેલાં જ ગીધ ઊડ્યાં.

તે પ્રાણી કદાચ વરુ હતું – તેના પાતળા શરીર, પ્રમાણમાં મોટું માથું અને રાખોડી બદામી રંગ ઉપરથી એવું લાગ્યું, પણ વધુ ચોકસાઈ કરી શકીએ તે પહેલા જ અદશ્ય થઈ ગયું. એ વિસ્તારમાં વધુ શોધખોળ કરતા એક નાળા પાસે વાણરડાનું સંપૂર્ણ ખવાઈ ગયેલું મૃતશરીર જોયું. વરુની તપાસ કરવા એ વિસ્તારમાં ફર્યા તે દરમિયાન બે મોટાં પક્ષીઓને અમે અમારી દિશામાં આવતાં જોયા. દૂર એક ટીંબા પર અમે એક જી પણ ઊભી રહેલી જોઈ. કેટલાંક પક્ષીનિરીક્ષકો દૂરબીનથી જોઈ રહ્યા હતા. અમારા સાનંદાશર્ય વચ્ચે તે પક્ષીઓ ઘોરડ (Great Indian Bustard) નીકળ્યાં. બે પક્ષીઓનાં કદમાં ફેર હતો. નાનું પક્ષી ક્યાં તો માદા અથવા અપુષ્ટ હોઈ શકે. તેમને કેમેરામાં કેદ કરવાનું શક્ય ન હતું.

પછીથી અમે નલિયાની વન-વિભાગની કચેરીમાં જઈને વનપાલ શ્રી ગોપાળભાઈને મળ્યા. તેઓ અમને નલિયાથી ૪ કિ.મી. દક્ષિણમાં સુજલોનના પવનચક્કીના ‘ફાર્મ’ પાસે લઈ ગયા. તેઓએ અમને એવા સ્થળ સુધી

લઈ જવામાં મદદ કરી જ્યાંથી અમે બે ટિલોર (Houbara) જોઈ શક્યા. અમારા વાહનની ખલેલથી તેઓ ઉડીને ૧૦૦ મી. દૂર ઉત્તર્યા. અમે વાહનમાંથી નીચે ઉત્તરી તેમને શોધવા નીકળ્યા પણ અડધા કલાકના એ વ્યાયામમાં નિષ્ફળતા મળતાં પાછા ફરવાનું નક્કી કર્યું. ગોપાળભાઈએ જણાવ્યું કે 'વીન ફાર્મ'ને લીધી હવે ટિલોર આવતાં નથી. તેઓ માગસો અને જાનવરની હાજરી ન હોય તેવા એકાંત વિસ્તારો પસંદ કરે છે. ત્યાંથી નજીકમાં આવેલા એક જળાશય તરફ જતાં ગોપાળભાઈએ ટિલોરના પંજાનાં નિશાન બતાવ્યાં; કદાચ અમે જોયેલાં પક્ષીઓનાં જ હશે. અમે ટિલોરના રહેઠાણના તથા પગના નિશાનની તસવીરો લીધી. જળાશય પાસે અમે સેંકડોની સંખ્યામાં કુઝ તથા કરકરા જોયા. આ ઉપરાંત, ઘણી સર્ફ પેણ અને પૂર્વી મોટાં તેજપર (Oriental Pratincole) તથા થોડીક સીંગપર (Northern Pintail) અને ગયણા (Northern Shoveller) જોયા. બપોરનાં હુંફણા પવનના કારણે કુઝ કદાચ પાણી પીવા જળાશય પાસે આવી હશે, કારણ કે અમે કેટલીક કુઝને પાણી પીતાં જોઈ.


બપોરના ભોજન પછી કોટેશ્વર તરફ આગળ વધ્યા. એકાદ કલાકની મુસાફરી બાદ એક નાના ઝરણા પાસે ઉભા રહ્યા, જ્યાં આસપાસ લીલોતરી અને ચિયાનાં ઝૂંડ હતાં. એકાદ-બે મિનિટ ચાલ્યા બાદ છીછા પાણીમાં ઉ સર્ફ ફોર્ક (European White Stork) આરામ કરતા જોયા. દસ મિનિટ સુધી નિરાંતે તેમનું અવલોકન કરી અમે અમારા રસ્તે આગળ વધ્યા. બપોરે ૩.૦૦ વાગ્યે કોટેશ્વર પહોંચ્યા તો અમારા આશ્ર્ય વરચે સેંકડોની સંખ્યામાં હજ (Flamingo) નદીની આસપાસ દેખાયાં. સાથે, સંખ્યાબંધ કાળીપીઠ ધોમડા, મોટા

ધોમડા (Pallas's Gull) તથા લડાખી ધોમડા (Brown-headed Gull) હતા. અડધોએક કલાક અહીં ગાળ્યા પછી અમે લખપત બાજુ ગયા. લખપતથી ૮ કિ.મી. દૂર હોઈશું ત્યાં શિકારી પક્ષીઓના એક નાના ઘોળાને માથે ચકરાવા લેતું જોઈ ઉભા રહ્યા. તેમાંના મોટા ભાગનાં ટીસા (Buzzard) લાગ્યાં પણ ક્યા તે ઓળખી ન શક્યા. ૮.૩૦ વાગ્યે લખપત પહોંચ્યા ત્યારે અજવાણું ઓછું થવા આવ્યું હતું. અમે વૈયાં (Rosy Starling)ને ગામમાં એકઠાં થતાં જોયાં. અમે લખપતના કિલ્લાની દીવાલ ચઢી અને રણનું દર્શન કર્યું. થોડાંક છિંકારા તથા એક રણલોમડી (Desert Fox) જોઈ. પુંછડીના સર્ફ છેડાથી અમે રણલોમડીને ઓળખી. અમારે માટે આ અવલોકન મહત્ત્વનું કહેવાય. આટલા ટૂંકા પ્રવાસમાં અમારે માટે તો ખજાનો મળ્યા જેવું હતું.

૬.૩૦ વાગ્યે પાછા ફરવાનું શરૂ કર્યું. આગળ બે નીલગાય રસ્તો ઓળંગીને ગઈ. નખત્રાણાની મુલાકાત, અંધારું થવાને લીધી ન થઈ શકી. માત્ર ત્રણ દિવસમાં અમારી પક્ષીયાઈ ૧૨ ઉની થઈ! વળતા પ્રવાસમાં કશું નોંધપાત્ર જોવા ન મળ્યું.

જ્યાં અમે અમદાવાદ-રાજકોટ ધોરીમાર્ગ પર પહોંચ્યાં કે ૧૫ ઘુડખરની હાર આથમતા સૂર્યની પશ્ચાત્ભૂગિમાં જોઈ. આકાશમાં ઉડી રહેલાં કુઝનાં ઘોળાં દશ્યને વધુ કાચ્યાત્મક બનાવી રહ્યાં હતાં. આ મનોહર દશ્યે અમારી કર્ણની પ્રવાસગાથાને અવિરમણીય બનાવી દીધી.

'સુનાથ' ૮૪/૧, પ્લોટ નં. ૧૨, વૃદ્ધાવન પાર્ક,  
કલામા રોડ, કોલહાપુર-૪૧૬૦૦૭



# ગીધ પર જપતો

## પાંજરાપોળની મુલાકાત

તા. ૧૫મી જુલાઈ ૨૦૧૦ના રોજ હું તેમજ અમદાવાદથી આહિત્ય રોય બન્નેએ અમદાવાદ જિલ્લાના કેટલાક તાલુકા વિસ્તાર - વીરમગામ, દેશોજ, રામપુરા, માંડલની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન આ વિસ્તારમાં આવેલી પાંજરાપોળ, પશુદ્વાખાનાં, પશુચિકિત્સકો તથા ઉપયોગમાં લેવાતી દવાઓની માહિતી રૂબરૂમાં મેળવી. અમે જાણ્યું કે, 'ડાયકલોઇનાક' દવાનો ઉપયોગ થતો નથી. તેની જાયાએ 'મેલોક્ઝીકેમ' દવા જોવા મળી.

આ વિસ્તારોમાં ચાર પાંજરાપોળ આવેલી છે. (કૌસમાં હાલની ઢોરની સંખ્યા દરખાવી છે.)

(૧) વીરમગામ પાંજરાપોળ (૩૭૬૫) (૨) રામપુરા પાંજરાપોળ (૮૮૩) (૩) માંડલ મહાજન પાંજરાપોળ, મુ. માંડલ (૧૦૮૧) (૪) માંડલ મહાજન પાંજરાપોળ, મુ. ઉઘરોજ (૨૦૦૦)

આજથી ચાર વર્ષ પહેલાં ઓગસ્ટ-૨૦૦૬માં વીરમગામ પાંજરાપોળ પાસે ઘડી સંખ્યામાં ગીધ જોવા મળેલાં, પણ ચાલુ વર્ષ ગીધની ગણતરી દરમ્યાન તે સ્થળે ફક્ત ૬ ખેરા (Egyptian Vulture) જોવા મળ્યાં. કારણ જાણ્યું. ઉનાના દરમ્યાન ત્યાં પાસેનું તળાવ સુકાઈ જાય છે. તળાવમાં પાણી હોય તો ગીધ આવે છે. જો આ સ્થળે તળાવમાં પાણી ભરવાની વ્યવસ્થા થાય અથવા પાકા ચણતરથી નાની તળાવરી બનાવવામાં આવે તો ગીધ જરૂર ખોરાક માટે આવશે.

રામપુરા પાંજરાપોળમાં મૃત ઢોરના ખોરાક માટે ક્યારેક ગીધ આવતાં જોવા મળે છે.

માંડલ મહાજન પાંજરાપોળમાં ઢોર મૃત્યુ પામે ત્યારે તેને જમીનમાં ખાડો કરીને દાટી દેવાય છે. જો આ મૃતદેહને ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે તો ગીધ માટે ખોરાકનું આદર્શ સ્થળ બની શકે તેમ છે.

અનિલ પટેલ  
કડી

## 'વનવિભાગ' દ્વારા

### માળા વિખેરવાનું ટેન્ડર !




વનવિભાગ, ગુજરાત દ્વારા હવાઈમથકની નજીકના ૫ ક્રિ.મી. વિસ્તારનાં સમરીનાં માળા વિખેરવા માટેની જાહેરાખબર તા. ૧-૧-૧૦ના રોજ 'દિવ્યભાસ્કર'માં આવી. સમરીના હવાઈજહાજ જોડે અથડાવવાના બનાવો મુખ્યત્વે નોંધવામાં આવે છે. હવાઈમથકને અડીને આવેલ 'કેન્ટોનમેન્ટ' અને શાહીબાગ વિસ્તારો એ એક શહેરીજગલ છે. સમરીની સાથે અન્ય અનેક પક્ષીઓના માળા અહીં જોવા મળે છે. જગલભાતા દ્વારા સમરીના માળા વિખેરવાના આ ટેન્ડરને લીધી મુખ્ય શંકા એ રહેશે કે જેને ટેન્ડર મળશે એ માણસો સમરી તથા તેના માળાને જુદાં તારવી શકશે? વળી માળા દીઠ પૈસા મળવાના હોય તો તેની ઓળખ હોવા છતાં સમરી સિવાયના માળા નહીં વિખેરાઈ જાય તેની શી ખાતરી? આ વિસ્તારમાં ગીધની પડા સંખ્યા ૮૦થી ૧૦૦ નોંધવામાં આવી છે. આ 'શિડ્ચુલ' I પક્ષીજાતિના માળા પડા તેમાં હોમાઈ જાય તેવી પૂરી શક્યતા રહે.

મુખ્ય પ્રશ્ન એ છે કે સમરીને હવાઈમથકની આસપાસ વિપૂલ પ્રમાણમાં ખોરાક મળી રહે છે. હવાઈમથકની અંદર ઘાસ સમયસર ન કપાવાના લીધી ઈયળો, ઊંફર, સાપ વગેરે તેમને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આજુબાજુમાં ચિમનપુરાની 'ફિશ માર્કેટ' તથા 'મટન શોપ' છે; કોલરપુરા આગળ ગટરો ઊભરાય છે; હવાઈમથકની દીવાલો પાસે રાતોચાત ઝૂપડાં બની ગયા છે. આ બધું સમરીને આકર્ષે છે, તો તેનો નિકાલ વધુ યોગ્ય ગણાય.

કર્તિક શાસ્ત્રી  
અશોકવાડી, પંચવટી, અમદાવાદ-૩૮૦ ૦૦૬

# પ્રવૃત્તિવૂત



## ઉત્તરાયણ દરમિયાન 'બર્ડ-રેસ્ક્રૂયુ'

ઉત્તરાયણ દરમિયાન મોટાં શહેરોમાં 'શહેરી-પક્ષીઓ' મોટા પ્રમાણમાં ઘાયલ થતાં હોય છે. છેલ્લાં બે વર્ષથી કાઈએ કોલેજના વિદ્યાર્થીઓની મદદથી 'બર્ડ-રેસ્ક્રૂયુ'નું અભિયાન નિયમિત રીતે હાથ ધરીએ છીએ. આ વર્ષ પણ વર્તમાનપત્રોમાં જાહેરખબર દ્વારા લોકોને ઘાયલ પક્ષી દેખાય તો અમારી સંસ્થાના 'હેલ્પલાઇન' નંબર ઉપર જાણ કરવા અનુરોધ કર્યો હતો. વર્તમાનપત્રોએ પણ બહોળો પ્રતિસાદ આપ્યો. ૨૩ પક્ષીઓ ઉગારવામાં આવ્યાં, જેમાંથી ૧૦ને ફરીથી ગગનમાં મુક્ત કરવામાં સહિળ રહ્યાં.

ચાજદીપાંદ્રિંહ આલા

કો-ઓર્ડિનેટર, નેચર કલબ, કાઈએ કોલેજ, રાજકોટ-૫



## વનપ્રકૃતિ મિત્રમંડળ – સાવરકુંડલા

આ મંડળની રચના ઈ. સ. ૧૯૮૮માં પમી જૂન, વિશ્વ પર્યાવરણ દિનના દિવસે કરવામાં આવી. આ મંડળના સ્થાપક શ્રી કૃષ્ણાલ ડી. બારેયાને હાલની કથળતી પર્યાવરણની સ્થિતિ જોઈને પર્યાવરણ અંગે કામ કરતું મંડળ સ્થાપવાની ઠથણ થઈ અને મંડળની સ્થાપના થઈ. શ્રી બારેયા છેલ્લાં બાર વર્ષથી એટલે કે જ્યારથી મંડળની રચના થઈ ત્યારથી પ્રમુખ પદે રહ્યા. આજે શ્રી સતીશભાઈ બી. પાંડે (હનુમાન)એ મંડળના પ્રમુખપદની જવાબદારી સ્વીકારી છે. વનપ્રકૃતિ મિત્રમંડળ છેલ્લાં ૧૨ વર્ષથી વન્યજીવ-સંરક્ષણ, પર્યાવરણ અંગેના બધા જ દિનોની ઉજવણી, વૃક્ષારોપણ, સર્પ વિશેની જગૃતિ, પક્ષીઓ અંગેની જાણકારી, ઘાયલ પક્ષી-બચાવો અભિયાન, પ્રકૃતિ અનુભૂતિ શિબિરો, વન્ય જીવોની તસવીરોનું પ્રદર્શન, રોપા-વિતરણ કાર્યક્રમ, પર્વતારોહણ, ઉનાળામાં પક્ષીઓ

માટે પાણીનાં કુંડાનું નિઃશુલ્ક વિતરણ, ચકલી બચાવો અભિયાન તથા શિબિરો માટે માર્ગદર્શકો ઊભા કરવાનું કાર્ય કરી રહ્યું છે.

આ મંડળ એક સ્વૈચ્છિક સંસ્થા છે. આ મંડળમાં પર્યાવરણ જગૃતિના કાર્ય માટે ક્યારેય સરકારની ગ્રાન્ટ લેવામાં આવતી નથી તથા ક્યારેય રોકડમાં ફૂડફાળો ઉધરાવવામાં આવતો નથી. મંડળના સભ્યો પોતે જ પ્રવૃત્તિઓનો ખર્ચ આપે છે. છેલ્લાં દસ વર્ષોમાં અમે શાળાના હજારો વિદ્યાર્થીઓને પર્યાવરણલક્ષી વાર્તાલાપો અને પ્રશ્નોત્તરીમાં સામેલ કર્યા. સાવરકુંડલાની આસપાસ ૧૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું તથા ૧૫૦ ઘાયલ પક્ષીઓની સારવાર કરી. છેલ્લાં તુ વર્ષથી 'વગડો' મુખપત્ર પ્રસિદ્ધ કરીએ છીએ.

સતીશ પાંડે

પ્રમુખ, વનપ્રકૃતિ મિત્રમંડળ  
લાડુ ડિઝિટલ, દેવણ ગેટ, સાવરકુંડલા, જી. અમરેલી ઉદ્યોગ



## ચકલી અભિયાનનું વાર્ષિક સરવૈચ્યું

છેલ્લાં બે વર્ષથી નવરંગ નેચર કલબ, રાજકોટ ચકલી માટે પૂંડા તથા લાકડાના માળા બનાવી તેને વિવિધ જગ્યાએ લટકાવી અખતરા કરતા હતા. અનુભવે એવું જાણવા મળ્યું કે ચકલીને પૂંડાના ૫ x ૫ એંચના



## પ્રવૃત્તિવૃત

માળા અનુકૂળ આવતા હતા. આ પૂંઠાના માળા ઘરની બહાર છજા, રવેશ, બાલકનીની નીચે એવી રીતે લગાવવાના હતા કે જેથી ત્યાં તડકો ન આવે અને બિલાડી પહોંચ્યી ન શકે. ઝડ પર માળા ટંગવાથી બિલાડીની બીકે ચકલી માળા બનાવતી નથી, તેથી આ માળા ઝડ પર ટંગવાના ન હતા.

નવરંગ નેચર કલબ – રાજકોટ છલ્લાં ૫ વર્ષથી ગુજરાતમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તથા મહાવિદ્યાલયોમાં વન્યજીવ સપ્તાહ ઊજવે છે. રેમાં જે-તે શાળામાં જઈ વિદ્યાર્થીઓને વન્ય જીવો પર વાર્તાલાપ આપી, લેખિતમાં કસોટી લેવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપી દર ૨૦૦ વિદ્યાર્થીએ એકને ઠનામ આપવામાં આવે છે. આમ દર ૧૦૦૦૦ વિદ્યાર્થીની વન્યજીવ જાગૃતિની પરીક્ષા લેવાય છે.

આ શાળાઓને ‘ચકલી બચાવો’ અભિયાનમાં સહભાગી બનાવી. ૨૦૧૦માં ચકલી માટે પૂંઠાનાં ૫૦,૦૦૦ ઘર બનાવી તેનું વિતરણ કરી સહામત જગ્યાએ લગાવી દીધેલ.

ચકલી માટેના પૂંઠાના માળામાં એક અરજ છાપેલી કે, જો ચકલી આ પૂંઠાના ઘરમાં માળો બનાવે તો નીચેના નંબર પર જાણ કરવી. વિદ્યાર્થીઓના આવેલ ફોન પરથી એવી માહિતી મળી કે ગામડાં તથા તાલુકા કક્ષાએ ૮૩% માળા થયેલ છે. મહાનગરોમાં ૩૫% માળા થયેલ છે. આમ ૫૮%નો સરેરાશ છે. ૨૮૫૦૦ માળામાં ચકલીએ સરેરાશ બે બચ્ચાં ઉછેરી લીધાં છે તેમ માનીએ તો ૫૮૦૦૦ પક્ષીઓનો ઉમેરો થયો તેમ અંદાજ મૂકી શકાય.

લોકો ચકલીની ઘટતી સંખ્યાથી ચિંતિત બની તેની વૃદ્ધિ થાય તેવી કોશિશ કરવા લાગ્યા. ચકલીના માળાની બાજુમાં પાણીનું પરબ ટંગવા લાગ્યા. પર્યાવરણ જાગૃતિનું કામ કરતી બીજી સંસ્થાઓ પણ પોતાની રીતે આ પવિત્ર કામમાં લાગી ગઈ.

સીમરન પ્રિન્ટર્સ પ્રા. લિ. – રાજકોટ ‘કોરોટેડ બોક્સ’ બનાવી આપેલ. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ બોક્સ પહોંચાડી આપવાની કિંમત ૧૦.૦૦ રૂ. રાખેલ.

વી. ડિ. બાલા


પ્રમુખ, નવરંગ નેચર કલબ

A-3/૨, નીલકંઠ પાર્ક, નીલકંઠ ટેક્સિન્ઝ, બાજુમાં, રાજકોટ



‘બર્ડ કન્જર્વેશન સોસાયટી,  
ગુજરાત’ (BCSG) દ્વારા  
ચોઝયેલ ‘સારસ અને હેરોનરી  
વોચ’નો કાર્યક્રમ

‘બર્ડ કન્જર્વેશન સોસાયટી, ગુજરાત’ (BCSG) દ્વારા તા. ૨૮-૮-૧૦ના રોજ, જેડા જિલ્લાની આસપાસ, ‘સારસ અને હેરોનરી વોચ’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કુલ ૭૫ વ્યક્તિઓએ ભાગ લીધ્યો. ભાગ લેનાર સભ્યો પૈકી ડેટલાક વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડોક્ટર તથા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બધા સભ્યો પોતપોતાના વાહનમાં અથવા બસ દ્વારા પ્રવાસ જેરી, માત્રાર બસ સ્ટેન્ડ પાસે ભેગા થયા. સવારે ૮.૩૦ વાગ્યે ચા-નાસ્તા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ. બી.સી.એસ.જી.ના માનદ્દ સહમંત્રી



પ્રોફેસર ભવભૂતિ પારાશર્યએ સારસ અને હેરોનરી વિશેની માહિતી આપી. સારસ એ ભારતનું સૌથી મોટું ઉડતું કુજ પક્ષી છે. વિશ્વમાં કુજની ૧૫ (પંદર) પ્રજાતિઓ પૈકીનું એક એવું સારસ, ભારતમાં મુખ્યત્વે ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજ્યસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. તદ્વારાંત તે હરિયાણા, પંજાબ, જમ્બુ-કાશમીર, ઉત્તરાંગલ, હિમાચલ પ્રદેશ વગેરે પ્રદેશોમાં પણ જોવા મળે છે. સારસ એ વિશ્વસ્તરની સંકટગ્રસ્ત જાતિ (vulnerable) તરીકે ઓળખાય છે. વિશ્વમાં તેમની અંદાજિત વસ્તી આશરે ૧૫,૦૦૦-૨૦,૦૦૦ જેટલી ગણાય છે. પ્રોફેસર પારાશર્યના જણાવ્યાનુસાર ગુજરાતમાં તેમની વસતિ ૨૦૦૦થી પણ ઓછી છે. તે રાજ્યમાં છૂટાછવાયા જોવા મળે છે. ખેડા, આંશંદ અને અમદાવાદ જિલ્લામાં તેમની વસતિ વધુ છે, તેમાં પણ સવિશેષ ખેડા જિલ્લામાં. આમ તો સારસ જળાશયનું પક્ષી છે પરંતુ તેણે ડાંગરનાં ખેતરો સાથે પણ અનુકૂલન સાધેવું છે. ડાંગરનાં ખેતરોમાં સારસ સામાન્યપણે જોવા મળે છે. તે જળાશયોમાં, પાણી ઉપર કે કંઈ અથવા ડાંગરની કાયરીઓ વચ્ચે માળા કરે છે. માળા બનાવવાની કિયાથી તે ડાંગરના તેટલા ભાગને નુકસાન પહોંચાડે છે તેથી ખેડૂતો સાથે ધર્ષણ થાય છે. પ્રોફેસર પારાશર્યના જણાવ્યાનુસાર હાલ ગુજરાત સરકારે જેનાં ખેતરોમાં સારસ માળો કરતાં હોય તે ખેડૂતોને વળતર આપવાનું શરૂ કર્યું છે, જેથી સારસના માળાનું જતન થાય અને સાથોસાથ ખેડૂતની નુકસાની ભરપાઈ પણ થાય. પરંતુ, આ સિવાય પણ સારસની વસતિને અસર કરતાં પરિબળો જેમ કે, પ્રદૂષણ, જંતુનાશક દવાઓનો ઉપયોગ, વીજળીના તાર, જળાશયોની અછત, શિકાર વગેરે સારસ માટે પડકારરૂપ છે.

સૌ સભ્યોને સારસ અને હેરોનરીની વિસ્તૃત માહિતી આપતું સાહિત્ય આપવામાં આવ્યું. રજિસ્ટ્રેશનની વિધિ પતાવ્યા બાદ સારસ અને હેરોનરી

વોચની શરૂઆત થઈ. સૌએ પોતપોતાના વાહનમાં બેસી માતરથી ગ્રાજ ગામ તરફ પ્રયાગ કર્યું અને રસ્તામાં ડાંગરનાં ખેતરોમાં સારસ પક્ષીઓની નોંધ લીધી.

માતર ગામથી ગ્રાજ ગામના રસ્તે પુષ્ટ સારસની ત જોડ અને ૧ પુષ્ટ જોડ બચ્ચાં સાથે એમ કુલ ૮ સારસની નોંધ થઈ. માતરથી આશરે ૬૦૦-૭૦૦ મી.ના અંતરે એક સારસ ઠેડા સેવતું દેખાયું.

સવારે ૧૦.૦૦ વાગ્યે સૌએ ગ્રાજ ગામની મુલાકાત લઈ, ગામના તળાવમાં ટાપુ ઉપર આવેલાં વૃક્ષો ઉપરની માળાવસાહ્ત (herony) નિહાળી, જેમાં ઢોર બગલા (Cattle Egret), નાના ધોળા બગલા (Little Egret) અને ધોળી કંકણસારે (Oriental White Ibis) માળા બનાવ્યા હતા. તળાવના કિનારે શ્રી ધવલભાઈ પટેલને એક સારસની ખોપડી મળી આવી. તે સ્થળે ખોડકામ કરતા, જે પુષ્ટ સારસના હાડપીંજર અને પીંછાં દટાયેલાં મળી આવ્યાં. કોઈ કારણસર અથવા જંતુનાશક દવાને લીધે મૃત્યુ પામેલાં આ સારસ ગ્રામજનોએ દાટી દીધાં હતાં. ગ્રાજ ગામથી આગળ વધતી ગ્રાજ અને ચાનોર વચ્ચે ડાંગરના ખેતરમાં છૂટાછવાયા ૨૩ વધુ સારસ જોયા જેમાંથી ઘણા જોડીમાં હતા. એક સ્થળે ૮ પુષ્ટ સારસ નજીક નજીક હતાં. પુષ્ટ થઈ જતાં સારસ, માળો કરવા માટે જોડીઓ બનાવે તે ખેલેલાં સાથે ફરતાં હોય છે. જોડી બન્યા બાદ તેઓ જોડીમાં જ ફૂરે છે. આ પ્રવાસમાં બીજા ઘણાં પક્ષીઓ જોવા મળ્યાં. જેમકે, ટિટોડી (Red-wattled Lapwing), ગજપાંવ (Black-winged Stilt), સફેદધાતી કલકલિયો (White-breasted Kingfisher), કાબરો કલકલિયો (Common Pied-Kingfisher), ઢોર બગલો (Cattle Egret), નડી બગલો (Purple Heron), કાણી બગલી (Pond Heron), નાની કંકણસાર (Glossy Ibis), ધોળી કંકણસાર (Oriental White Ibis), કાળી કંકણસાર

## પ્રવૃત્તિવૃત

(Black Ibis), ચમચા (Eurasian Spoonbill), શંટીચાંચ ઢોક (Asian Openbill-Stork), પીળીચાંચ ઢોક (Painted Stork), પાન ફડકફૂતી (Plain Prinia) અને રણ બુલબુલ (White-eared Bulbul).

આશરે ૧૧.૪૫ વાગ્યે ચાનોર ગામમાં પહોંચ્યા બાદ સૌએ ગામની શાળાની પાછળ આવેલા ડાંગરના ખેતરમાં બે પુષ્ટ સારસ નિહાળાં, જે પૈકી એક માળામાં ઈડાં સેવતું હતું, માળો શાળાથી આશરે ૨૦૦-૨૫૦ મી.ના અંતરે હતો. માનવ વસાહતથી નજીક માળા કરતાં અને માણસો/બેડૂતોની અવરજવર વચ્ચે ડાંગરમાં ફરતાં સારસ માણસોથી કેટલા ટેવાયેલાં છે તેની પ્રત્યક્ષ જાડકારી થઈ. સાથોસાથ સારસનું જતન કરવામાં ગ્રામજનોનો કેટલો મોટો ઝાળો છે તેનો પણ જ્યાલ આખ્યો. ચાનોરથી પરિઅભેજ તરફ જતાં રસ્તામાં બે પુષ્ટ સારસ જોયા. બાપોરના સમયે, ચાનોર-તારાપુર રસ્તામાં બીજી એક માળાવસાહત જોઈ, જેમાં મુખ્યત્વે ઢોર બગલાએ માળા કર્યા હતા. અહીં એક કાગડો કોયલના બચ્ચાને ખવડાવતો નિહાળ્યો. આશરે ૧.૩૦ વાગ્યે પરિઅભેજ તળાવે પહોંચ્યા. ઈકોટુરિઝમ માટે વિકસાવેલ પરિઅભેજ તળાવે વોચ ટાવર પર, આછા વરસાદ વચ્ચે, નૈસર્જિક વાતાવરણમાં સૌએ ભોજન લીધું. ત્યાર બાદ સૌએ મળીને પોતપોતાના અનુભવો કર્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જોયેલાં સારસની સંખ્યા આશરે ત૧૩૦ પ્રાંતીઓ અને અલગ અલગ આવવા-જવાના રસ્તાને લીધી જણાઈ. થોડા ઘણા સત્યોએ ત્યાર બાદ વિદ્યાય લીધી જ્યારે મોટા ભાગના સત્યો ચીખલિયા ગામમાં આવેલ પીળીચાંચ ઢોકની માળા વસાહતની મુલાકાત લેવા ગયા. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને બાળકોને ઘણું નવું જાણવા મળ્યું.

ડૉ. અનિકા તેરે

જવશાસ્ત્ર વિભાગ, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા-૩૯૦૦૦૨.



## ચકવાક

કવિકુલગુરુ કાવિદાસે બે સ્થળે પોતાની સૂક્ષ્મ નિરીક્ષણશર્કિતના આધારે ચકવાક (ભગવી સુરખાબ, Ruddy Shelduck)ના મનોહર રંગોનો ખૂબ સુંદર ઉલ્લેખ કર્યો છે. ઉર્વશીના વિરહમાં વિબળ બનેલો રાજ પુરુરવા ચકવાકને સંબોધીને કહે છે : ચંદન અને કેસરના રંગવાળા હે ચકવાક ! કહે, તે વસંતના દિવસોમાં કીડા કરતી મારી પ્રેયસીને ક્યાંય જોઈ છે ?

ગોરોચનાર્કુલમવર્ણ ચક ભણ મામ્ર ।

મધુરવારસે કીડની ધન્યા ન દંધા તવ્યા ॥

(‘વિકમોર્વશીય’ ૪/૩૬)

ચંદનનો રંગ પીળો અને કુમકુમનો રંગ લાલ-નારંગી જેવો હોય છે. ચકવાકનો રંગ પણ આ રીતનો જ હોય છે.

‘કુમારસંભવ’માં વિવાહના સમયે મંગલ સનાન અને શુંગાર પણી પાર્વતીના સૌંદર્યનું વર્ણન કરતાં મહાકવિ કહે છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ શેત અગરુથી બનાવેલો અંગરાગ (પાઉડર) એમના શરીર પર લગાયો અને પીળા ચંદનથી એમના દેહ પર ચિત્રાંકનો કર્યા. એ સમયે પાર્વતીજી એવાં સુંદર લાગી રહ્યાં હતાં કે એમની સમક્ષ ગંગા નદીનું એ રમણીય સ્વરૂપ પણ ફિક્કું પડી ગયું, જેના તટની શેત રેતી પર લાલ-પીળા રંગના ચકવાક બેઠાં હોય.

વિન્યસ્તશુક્લાગુરુ ચકુરંગં ।

ગોરોચનાપત્રેવિભક્તમન્યા ।

સા ચકવાકાંક્ષિતસૈક્તાયાસ્ત્રિસોતસઃ ।

કાન્તિમત્યીવ તરસ્થૌ ।

(‘કુમારસંભવ’ ૭/૧૫)

સ્તોત : ‘કાવિદાસ કે પક્ષી’, શ્રી હરિદાસ વિદ્યાલંકાર પ્રકાશક - ગુરુકુલ સંગ્રહાલય, ગુરુકુલ કાંગડી વિશ્વવિદ્યાલય, હરિદ્વાર.



# ભારતનાં પુષ્પવિહંગો તથા વિહંગ-પુષ્પો (૬)

એચ. ખુલર પંગારના કુળનાં વૃક્ષોની લાક્ષણિકતા વિશે આ પ્રમાણે લખે છે : ‘આ કુળનાં વૃક્ષોના ફૂલમાં વિવિધ અંગો વણઢાંકેલાં હોય છે. તેની પાંખડીઓ, પુંકેસર કે બંને ક્રીટકોને આકર્ષે છે.’

ભારતમાં ‘Erythrina’ ગોત્રની આઈ જાતિઓ થાય છે. આ તમામ જાતિને લાલ રંગનાં ફૂલ આવે છે. આ આઈ ઉપરાંત *Erythrina crista-galli* અને *E. blakei* આ બે પ્રજાતિઓ બહારથી લાવવામાં આવી છે.

## પંગારો કે પનરવો (Indian Coral Tree, *Erythrina indica*)

ફેલાતી શાખાઓ ધરાવતું આ કંઠારણું વૃક્ષ પુષ્પો આવે ત્યારે પણ્ણવિહીન બની જાય છે. એનાં મોટાં, રાતાં ફૂલ શાખાઓની ટોચ પર ગુચ્છ સ્વરૂપે આવે છે. પાંચ પાંખડીઓ મળીને તેનો પુષ્પમણિ બને છે. એક ટણાર પાંખડી લંબગોળ આકારની હોય છે અને મૂળ નજીક સાંકડી થઈને નહોરનું સ્વરૂપ ધારાશ કરે છે. (આના કારણે પંગારાનું એક અંગ્રેજી નામ ‘Tiger Claw’ પણ છે. – સ.) તેની આસપાસ બે નાની પાંખડી આવેલી હોય છે અને એ ઉપરાંત નોંધપાત્ર રીતે વધુ ઘેરા રંગની બીજી બે ઉપસેલી, જોડાયેલી પાંખડી પણ આવેલી હોય છે. આ જોડાયેલી પાંખડીઓ, પાસેની બે પાંખડીથી કેટલાક ઊંશો ઢંકાયેલી હોય છે. મૂળ પાસે પૂળાની માફક નજીક-નજીક આવેલાં પુંકેસરો લગભગ પૂરેપૂરા બહાર નીકળેલાં હોય છે. દસમું પુંકેસર ઉપર જતાં છૂટું પડીને અલગ તરી આવે છે. ઉપસેલ પાંખડીઓની કોર એકબીજા પર વીંટળાયેલી હોય છે; અને મોટી ટણાર પાંખડીની સાથે મળીને આ પાંખડીઓ ફૂલના મૂળમાં એક ઊંધો શંકુ બનાવે છે, જેમાં મધુરસ ભરેલો હોય છે.

આ ફૂલોમાં વિપુલ માત્રામાં મધુરસનું સર્જન થાય છે; મેં એક ફૂલમાંથી મધુરસનું સાત કે તેથી પણ વધુ ટીપાં મેળવ્યાં છે. મેં ખાલી કરેલાં આવાં ફૂલ પર પણ પંખડીઓની આવજા સતત ચાલુ રહેતી હતી; જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમાં મધુરસનું ઉત્પાદન અવિરત ચાલ્યા કરતું હોશે.

પુષ્પની ઋતુ : ફેબ્રુઆરીથી મે

વ્યાપ : બ્લેટરના અનુસાર આ વૃક્ષ થાણા, કોકણ, ઉત્તર કન્નડ અને મલબારના પણ્ણપાત્રી વનોનું વતની છે. તે ઉપરાંત સુંદરવનથી શરૂ કરીને અરાકાન (બર્મા), પેગુ (બર્મા), ટેનાસેરમિ, આંદામાન, નિકોબાર, જાવા અને પોલિનેશિયાના સાગરકંદાનાં જંગલોમાં પણ જોવા મળે છે.



પંગારો

## ભારતનાં પુષ્પવિહંગો તથા વિહંગમુખો (૬)

- મુલાકાતીઓ :** ફૂલોની બહારમાં હોય ત્યારે ભારતવર્ષના અતિસુંદર નૈસર્જિક દશ્યોમાંનું એક બની રહેતું આ વૃક્ષ ત્યારે આસપાસનાં તમામ વૃક્ષેચર (arboreal) પંખીઓને ચુંબકની જેમ આકર્ષ છે. પંખીઓના કલરવ અને હળવાલથી વૃક્ષ જીવંત બની ઉઠે છે. મધુપાન માટે ઊડાઊડ કરતાં ચંચળ વિહંગોની હરફરથી તેની ડાળીઓ સતત ડોલ્યા કરે છે. આઓ દિવસ આ ડોલનનૃત્ય ચાલુ રહે છે. જો કે સૂર્યોદયથી સવારના અગ્નિયાર વાગ્યા સુધી પક્ષીઓ સૌથી વધુ પ્રવૃત્ત હોય છે. ત્યાર પછી ‘નાનકડો વિરામ’ આવે છે, જે ત્રણ વાગ્યા સુધી ચાલે છે. દિવસના સૌથી ગરમીવાગ્યા આ સમયગાળામાં પક્ષીઓની પ્રવૃત્તિ પ્રમાણમાં મંદ થઈ જાય છે. ત્રણ વાગ્યા પછી ધીમે ધીમે પક્ષીઓ ફરીથી સક્રિય બનવા લાગે છે. મેં નીચે પ્રમાણેનાં પક્ષીને પંગારાનાં ફૂલમાંથી મધુરસ આરોગતાં જોયાં છે. જે પંખીનાં નામ તારાંકિત છે તેમનો નમ્નો મેળવીને સૂક્ષ્મદર્શક ધેર દ્વારા તેમના કપાળ તથા ગળા પર ચોટિલી પરાગરજની ચકાસણી કરવામાં આવી છે.
- ૧.\* જિરનારી કાગડો (Jungle Crow) – વસતી બહાર ઊગેલા પંગારાનાં પુષ્પો પર નિયમિત રૂપે જોવા મળે છે.
- ૨.\* કાગડો (Common Crow) – વસવાટની વચ્ચેનાં વૃક્ષો પર પણ જોવા મળે છે.
૩. જેરખણો (Indian Treepie) – પ્રસંગોપાત્ર મુલાકાતી.
- ૪.\* વન લેલાં (Jungle Babbler) – વન લેલાં પંગારા પર સૌથી નિયમિત મુલાકાતી છે. ખીલેલા પંગારા પર આ લેલાં અચૂક હાજર હોય છે.
- ૫.\* પીળીઆંખ લલેડું (Yellow-eyed Babbler) – વારંવાર આવે છે.
- ૬.\* ફૂટકી લલેડી (Rufous-bellied Babbler) –

- વૃક્ષ અનુકૂળ વિસ્તાર હોય ત્યાં આ પક્ષી અસામાન્ય નથી.
૭. હરિતભાલ હરેવો (Jerdon's Chloropsis) તથા
- ૮.\* સોનેરીભાલ હરેવો (Gold-fronted Chloropsis) – આ બંને પક્ષી પંગારા પર નિયમિત રીતે મધુપાન કરવા આવે છે; પણ તેમને સામાન્ય તો ન જ ગણી શકાય. હરેવા બીજા મુલાકાતીઓ પર વારંવાર હુમલો કરી તેમને ફૂલ પરથી ઉડાડી મૂકે છે.
- ૯.\* બુલબુલ (Red-vented Bulbul) – નિયમિત, સામાન્ય મુલાકાતી.
- ૧૦.\* સિપાહી બુલબુલ (Red-whiskered Bulbul) – નિયમિત, સામાન્ય મુલાકાતી.
૧૧. શોબિંગી (Common lora) – શોબિંગીને મેં માત્ર એક જ વાર નિયમિત રીતે મધુરસ આરોગતું જોયું છે. શક્ય છે કે મધુરસ કરતાં પણ પંગારાનાં ફૂલ પરનાં કીટકો તેને વધુ આકર્ષતાં હોય.
- ૧૨.\* શેતનેશ બુલબુલ (White-browed Bulbul) – સામાન્ય
- ૧૩.\* શ્યામશિર કસ્તૂરો – નિયમિત મુલાકાતી છે, છતાં પંગારા કરતા શીમળાને વધુ પસંદ કરતું જોવા મળે છે.
- ૧૪.\* દૈયડ (Oriental Magpie-Robin) – આસપાસનાં વૃક્ષો પર પોતાની હદબંધી કરીને ગીત લલકારતા નર થોડી થોડી વારે પંગારાના ફૂલમાંથી મધુરસનું પાન ચાલુ રાખે છે.
- ૧૫.\* કાળો કોશી (Black Drongo) – અતિ સામાન્ય. ફૂલ પર એકલો કે જોડીમાં અચૂક હાજર હોય છે. ઈર્ષાભર્યું અને આકમક વલાણ; અન્ય મુલાકાતીઓની પાછળ પડીને તેમને ઉડાડી મૂકે છે.

૧૬. ટપકીલી નાચણ (White-throated Fantail-Flycatcher) – ટપકીલી નાચણ ફૂલમાંથી રસ ચૂસતી હોય તેવું જોવા મળ્યું નથી. શક્ય છે કે ફૂલ પરની માખીઓથી તે આકર્ષાત્મક હોય.
૧૭. દૂધરાજ (Asian Paradise-Flycatcher) – મેં દૂધરાજને એક વાર જ પંગારા પર જોયો છે. શક્ય છે કે એ પણ માખીની શોધમાં જ ત્યાં આવ્યો હોય.
૧૮. અધરંગ (Tickell's Blue-Flycatcher) અને
૧૯. નીલપંખો (Black-naped Monarch-Flycatcher) – ફૂલોથી લદાયેલી ડાળી પર ઘડી વાર જોવા મળે છે; પરંતુ ફૂલમાં ચાંચ નાખતાં નથી દેખાતાં. અન્ય ‘ફ્લાઈકર્ચર્સ’ની જેમ આ બંને પણ કીટકો માટે આવતાં હોય તેમ લાગે છે, મધુરસ માટે નહીં. મારું માનવું છે કે, આ કારણોસર પરાગનયનમાં ‘ફ્લાઈકર્ચર્સ’ની ભૂમિકા નગણ્ય જ હોઈ શકે.
૨૦. મટિયો લટોરો (Rufous-backed Shrike) – મટિયો લટોરો અસામાન્ય તો નથી જ, પણ મેં માત્ર એક વાર જ તેને ફૂલમાં ચંચુપાત કરતો જોયો છે. શક્ય છે કે તે કીટક પકડતો હોય અથવા તો પંગારાનો આસપાસ નજર રાખવાના થાણા તરીકે ઉપયોગ કરતો હોય.
- ૨૧.\* દરજાડો (Common Tailorbird) – સામાન્ય મુલાકાતી.
૨૨. ફડકુંટી (Ashy Prinia) – સામાન્ય મુલાકાતી.
૨૩. પાન ફડકુંટી (Plain Prinia) – સામાન્ય મુલાકાતી.
- ૨૪.\* વૈયાં (Rosy Starling) – વૈયાં પંગારાનાં ફૂલોની વારંવાર મુલાકાત લે છે; છતાં જોવા મળ્યું છે કે વૈયાં શીમળાનાં ફૂલને ઘણાં વધારે પસંદ કરે છે. વૈયાં પણ આકમક બનીને અન્ય પક્ષીઓને ભગડી મૂકે છે.
૨૫. કાબર (Common Myna) – સામાન્ય અને નિયમિત મુલાકાતી. પાંચ-છ પક્ષીના ટોળામાં આવે છે. કાબર ફૂલના એક જૂમખાથી બીજા જૂમખા પર પદ્ધતિસર રીતે ફરતી અને ચાંચ ઊંચી કરીને મધુરસના ઘૂંઠા ગળે ઉત્તારતી જોવા મળે છે.
- ૨૬.\* જંગલી કાબર (Jungle Myna) – જ્યાં આ કાબર થાય છે ત્યાં તે પંગારાનાં પુષ્પોની મુલાકાતે અવશ્યપણે આવે છે. આ કાબરની ચાંચના મૂળમાં જે વિશિષ્ટ પીંઘાનો ગુરુછ રહેલો હોય છે તે પરાગનયન માટેનું ઉત્તમ સાધન બની રહે છે.

ગ્રાન્ટ મેડિકલ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ કનેથી સાંભળ્યું છે કે : “વનસ્પતિવિદ્યા એ અરસિક કે શુષ્ક વિદ્યા છે.” પણ પનરવાનું વૃક્ષ જ્યારે અમૃત જોવા મીઠા રસથી ભરાયેલાં સુંદર રાતાં શુકનાસા જોવા આકારનાં ફૂલોના ભારથી ભરાયેલું હોય છે, ત્યારે તેને ખરેખર રસિક હૃદયથી અને શાસ્ત્રીય દસ્તિથી અવોલકન કરી તેઓ નિહાળો તો સાચે જ તેઓનાં હૃદય શુષ્કતા મૂકી એમાં રહેલાં અમૃતનું પાન કરી અમૃત જેવાં જ રસરૂપ થશે.

પનરવાનાં ફૂલોની પુષ્પધારણ કરનાર સરળી પરની તેઓની ગોઠવણા, ફૂલોની કળી અને ઊઘડેલાં ફૂલોની આકૃતિ, તેઓનો રંગ અને તેઓની અંદરની રચના, ખરેખર એક અવર્ણનીય સુંદરતા અને અદ્ભુત કારીગરીની વસ્તુ છે, તે કોઈ રસ્કિન (Ruskin) જોવા અદ્ભુત અવલોકનશક્તિ ધરાવનારાઓએ દિલ ભરીને જ જોવાવાયક છે.

સોત : ‘વનસ્પતિશાસ્ત્ર’  
લેખક : જયફકુંઝણ ઠંડજી

## ભારતનાં પુષ્પવિહંગો તથા વિહંગમુખો (૬)

- ૨૭.\* ઘોડા કાબર (Bank Myna) – જ્યાં આ કાબર થાય છે ત્યાં અવશ્ય આ ફૂલો પર આવે છે.
- ૨૮.\* કાબરી કાબર (Pied Myna) – ઉપર મુજબ.
૨૯. શ્વયમશિર પીળક (Black-headed Oriole) – વારંવાર આવવા છતાં તેને સામાન્ય તો ન જ કહી શકાય.
૩૦. સોનેરી પીળક (Eurasian Golden Oriole) – ઉપર મુજબ.
- ૩૧.\* સુગારી (Baya Weaver) – પાંચથી માંથીને ૩૦ પક્ષીના ટોળામાં મધુપાન કરતાં જોવા મળે છે. ફૂલ કરમાવા લાગ્યાં હોય તે સમયે પણ સુગારી પંગારા પર જોવા મળે છે. એ સમયે એનું નિરીક્ષણ કરતાં લાગે છે કે તે પંગારાને ફૂટેલી નવી, ફુમળી શિંગોનો આહાર કરે છે.
૩૨. ચકલી (House Sparrow) – પંગારાનું ઝડ શારેરી કે ગ્રામ વિસ્તારમાં હોય કે તેની નજીક હોય ત્યારે ચકલી તેનાં ફૂલોની કાયમ મુલાકાત લે છે.
૩૩. રાજ (Yellow-throated Sparrow) – અવારનવાર મુલાકાત લે છે.
૩૪. ટપુશિયું (White-throated Munia) – કયારેક આવી ચે.
૩૫. કાબરું ટપુશિયું (White-rumped Munia) – કયારેક આવી ચે.
- ૩૬.\* ગુલાબી તૂરી (Common Rosefinch) – અસામાન્ય નથી.
- ૩૭.\* પોપટ (Rose-ringed Parakeet) – ડેટલાક વિસ્તારોમાં પોપટ પંગારાના બહુ નિયમિત મુલાકાતી હોય છે. પરંતુ પોપટની મધુરસ ચૂસતા પહેલાં ફૂલ તોરી લેવાની આદતના કારણે તે પરાગનયનમાં ખાસ ઉપયોગી બનતો ના હોય તે શક્ય છે.
૩૮. કોયલ (Asian Koel) – મેં કોયલને માત્ર બે વાર મધુરસનો આહાર કરતા જોઈ છે. એ વખતે એનું વર્તન ખૂબ શરમાળ હતું. શક્ય છે કે અનુકૂળ વિસ્તારમાં આવેલાં વૃક્ષો પર કોયલ વધુ નિયમિત મુલાકાતી હોય.
- ૩૯.\* પચરંગી શક્કરખોરો (Purple-rumped Sunbird) – આખો દિવસ અચૂક રીતે જોવા મળે છે.
૪૦. જાંબુરી શક્કરખોરો (Purple Sunbird) – ઉપર માફક
- ૪૧.\* લોટેનનો શક્કરખોરો (Loten's Sunbird) – ડેટલાક વિસ્તારો અતિસામાન્ય.
૪૨. ફૂલરાજ (Crimson Sunbird) – જે વિસ્તાર થાય છે ત્યાં અવારનવાર મુલાકાત લે છે.
૪૩. ચેતનયના (Oriental White-eye) – અસામાન્ય નથી. ચેતનયનાનું ટોળું એકેએક ફૂલની મુલાકાત લેવાનું ચૂક્યું નથી.
૪૪. સોનેરીપીઠ લક્કડખોડ (Common Flameback) – મેં તા. ૨૪-૪-૧૯૭૧ના રોજ સૌ પ્રથમ વાર આ લક્કડખોડને મધુરસ ખાતો જોયો ત્યારે મને ખૂબ આશ્વર્ય થયું હતું. પરંતુ ત્યાર બાદ પણ મેં તેને અનેક વાર આવું કરતો નિહાળ્યો છે. મેં દૂરભીન વડે બરાબર નિરીક્ષણ કરીને ખાતરી કરી છે કે તે મધુરસ માટે જ આવે છે.
- [હેરમાન મ્યુલાર જણાવે છે કે, Carolinea પ્રજાતિનાં મોટાં પુષ્પોનું ફ્લીકરણ લક્કડખોડ દ્વારા જ થાય છે. મ્યુલાર આગળ જણાવે છે કે “લક્કડખોડ ફૂલ પર કીટકો તેમજ મધુરસ માટે આવતા હશે; પણ મધુરસ માટે તો અવશ્ય કારણ કે મેં તેમને ઘણી વાર પાકા સંતરામાં ચાંચ મારીને તેમાંથી રસ ચૂસતા જોયા છે. આવું કરવાથી તેમને મીઠો ફળરસ જ મળે, નહીં કે

કોઈ કીટકો.” (Knuth, Vol. i, પૃષ્ઠ ૭૭)]

ઉપર જાણવેલાં પક્ષીઓ ઉપરાંત, મેં તમામ જગ્યાએ જોયું છે કે, પણ્ણવાળી બિસકોલીઓ (*Funambulus tristriatus* અને *F. pennanti*) પંગારાની સૌથી વધુ મહેમાન બને છે. એક પુષ્પગુચ્છથી બીજા પુષ્પગુચ્છ પર તે મધુકોશમાં જ બટકું ભરીને મીઠો રસ ચૂસ્યા કરે છે. આના કારણે તેની ઘણી વાર પાંખવાળા અન્ય મહેમાનોની સાથે ઘર્ષણ થાય છે. ખાસ કરીને કાળા કોશી અને વૈયાની સાથે. ક્યારેક બિસકોલી સ્વસ્થાને ટકી રહે છે, તો ક્યારેક તેને ઊભી પૂછુંની આગવું પણ પડે છે! મેં બિસકોલીના પણ કેટલાક નમૂના હસ્તનગત કરીને તેમનો અભ્યાસ કર્યો હતો. આમાંથી ત્રણ નમૂનાની માથા પરની અને નીચલી ડોક પરની રૂવાટી પર પરાગરજ ચોટેલી જોવા મળી હતી, જે પરથી

જાણી શકાય છે કે પંગારાનાં ફૂલોના પરાગનયનમાં કેટલાક અંશો તેમનો ફણો પણ રહેતો હતે.

પોર્શ (Porsch) કહે છે કે, કદાચ પંગારાના પરાગનયનમાં ચામાચારીડિયાનો ફણો પણ રહેતો હતે. પણ મેં ક્રિલિમ ખાતે એકાધિક વાર રાત્રીના દસ વાગ્યા સુધી નિરીક્ષણ કર્યું છે, જેમાં આ બાબતને સાબિત કરતો કોઈ જ પુરાવો જોવા મળ્યો નથી. અલબત્ત બીજા કોઈ વિસ્તારમાં નિરીક્ષણ કરતા આ વિશે નવાં તથ્યો મળી આવે તે શક્ય છે જ.

(ક્રમશઃ)

ડૉ. સંહિત અલ્લી

સોત : બી.એન.એચ.એસ., વોલ્યુમ-૩૫, નં.-૩ અને ૪, ૧૯૭૨

અનુવાદ : નંદિતા મુનિ



## દેવતરુ - પનરવાનો પર્યાય

થોડા દિવસ ઉપર અહીં પલાશ એટલે કે, કેસૂડાનું સામાજય હતું. જ્યાં એને જુઓ સર્વત્ર ‘કામણગારો’ લાગે. અહીંની કન્યાઓના હથમાં અને મસ્તકે તો સવિશેષ. દોલપૂર્ણિમાએ તો કેસૂડાનાં ફૂલોના અલંકાર. વસંતને બધાવવા એથી વધારે યોગ્ય કર્યું પ્રસાધન? કેસૂડો તો બધી ખીલે છે, પણ અહીં સૌના મનમાં પણ ખીલે છે. રવીન્દ્રનાથે એને બિરુદ્ધ આવ્યું છે, આનંદમૂર્તિ. પલાશ આનંદમૂર્તિ.

અને શાલ્મલી? શીમળો જ તો. અત્યારે તો શીમળાનું રૂ પવનમાં ઊરે છે, પણ કેટલાક દિવસ આગળ શાલ્મલીની ડાળી ભારજલ્લાં લાલ-લાલ ફૂલોથી લચી પડી હતી. પ્રિયકાન્તે ભલે કલ્યું હોય - ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી - પણ ખરેખર જાણો બોજ. ગુરુદેવના એક આવાસ કોણાઈના પ્રાંગણમાં એક વિરાટ શાલ્મલીવૃક્ષ છે. પ્રાચીન

કાંદબરીમાં શુક વૈશંપાયનના મુખે તેના એક વખતના નિવાસસ્થાન શાલ્મલીનું જે વર્ણન આવે છે, તે આ શાલ્મલીને જોતાં સમજાય. કેસૂડો પણ એક રીતે લાલ અને શીમળો પણ લાલ. કાંદબરીકાર બાણભણ હોતો બંને લાલ રંગની અલગ-અલગ ઝાંખે જુદા-જુદાં ઉપમાનોથી ચાક્ષુસ કરી બતાવત.

પણ આ ત્રીજું એવું લાલ ફૂલ! એ તો મંદાર. દેવતરુ. ‘સ્વર્ગમાંથી વિદ્યાય’ કવિતામાં કંદે મંદારમાલિકનો ઉલ્લેખ આવે છે. પુષ્યો ક્ષીણ થતાં સ્વર્ગમાંથી વિદ્યાય લેવાની નિશાની કઈ? કંઠની આ મંદારમાલા કરમાય એ. અહીં પૃથ્વી પર કોણ લઈ આવ્યું છે આ દેવતરુ? પારિજાતહરણની તો ખબર છે. પલાશ, શિમુલની જેમ મંદાર પણ જ્યારે પુષ્પિત થાય ત્યારે અપત્ર બની જાય. માત્ર પુષ્પ!

સૌજન્ય : નેરાં દિશ્યુ’ (ચુંટેલા નિબંધો)

વેખક : ભોળાભાઈ પટેલ

પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૦૪.

# પત્ર-સેટુ



## અભિનંદન!

‘વિહંગ’ દિવસે દિવસે સુંદર – અતિસુંદર થતું જાય છે. અભિનંદન!

આ સાથે શ્રી નિતુ મજમુદારનું એક કાવ્ય ‘કાગડાઓએ વાત માંડી...’ની નકલ મોકલું છું. પક્ષીજગતની વાત છે, તમને ગમશે.

પુસ્તક પ્રકાશન તથા પ્રિન્ટિંગ મારા રસ અને જાણકારીના વિષય છે એમાં કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તો મફદુરૂપ થવાનું ગમશે.

શિવળ આશર  
૧૦, બિરવા રો હાઉસીસ, ગ્રામપંચાયત માર્ગ,  
બોપલ, અમદાવાદ-૩૮૦૦૪૮



## ‘ફોન્ટ’ મોટાં કરી શકાય ?

લગભગ બે વર્ષથી ‘વિહંગ’ની ગ્રાહક બની છું. ડૉ. પીયુષ પટેલ અમારા મિત્ર હોવાથી એમના દ્વારા ‘વિહંગ’ વિશે જાણેલું. સર્વોદય કાર્યકર કાંતિભાઈ શાહ જે પિંડવળ ખાતે પોતાનું કામ કરી રહ્યા છે, એમણે ‘વિહંગ’ માટે ખૂબ ઊંચો અભિપ્રાય આપેલો. ત્યાર પછી જ્યારે અંક જોયો ત્યારે થયું કે, એમનો અભિપ્રાય તફન ઘોગ્ય હતો.

સુધાર છાપકામ, મન લોભાવે એવી તસવીરો, પક્ષીઓ અંગેની ઢગવાબંધ અવનવી માહિતી અને આ બધાની સાથે સાથે જળવાતાં સાહિત્યિક મૂલ્યો – ખરેખર, માતૃભાષામાં આટલું સુંદર સામયિક આપવા બદલ આપ સૌને ઘન્યવાદ.


એક સૂર્યન – પક્ષીઓના ઝોટાની નીચે એમના ગુજરાતી-અંગેજ નામ આપવામાં આવે છે એના ‘ઝોન્ટ’ જરાક મોટા કરી શકાય? એક તો અમારા જેવા આ ક્ષેત્ર માટે સાવ અંગૂઠાછાપ હોઈએ એમાં વળી અક્ષર ઝીણાં હોય તો વાંચવામાં તકલીફ પડે, માટે આ સૂર્યન કરું છું.

‘શ્રીઝ’ની જોડણી માટે આપે ખૂબ અફસોસ

વક્ત કર્યો. આટલી બધી નિસબ્બત તો સાહિત્યને લગતાં સામયિકી પણ

બતાવતાં નથી; બધું ‘હોતા હે ચલતા હે’ એમ ચાલ્યા કરે. પ્રશાંતભાઈનો લેખ ‘વનવાસીની નજરે’ ખૂબ જ ગમ્યો.

આશા વીરેન્દ્ર શાહ  
બી-૪૦૧, દેવદર્શન, હાલર, વલસાડ



## ચાતક અને બપૈયો

તા. ૧૦-૭-૧૦ના રોજ શનિવારે સવારે ૧૧.૦૦ વાગે મારી શાળા છૂટી ત્યારે ચાતક (Pied Crested Cuckoo) વીજળીના તાર પર બેઠેલું જોયું. ઘણાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને ચાતકના દર્શન કરાવ્યાં, કારણ હું છેલ્યાં પાંચ વર્ષથી આ શાળામાં નોકરી કરું છું પણ આ વર્ષે જ પ્રથમ વખત ‘ચાતક’ જોયું. સોમવારે પ્રાર્થનાસભામાં ચાતકનો પરિચય આપવામાં આવ્યો. મેં પણ નજીકથી પ્રથમ વખત જોયું હતું. ખૂબ આનંદ થયો.

૧૨-૭-૧૦ના રોજ બપૈયો પણ શાળાના પરિસરમાં પ્રથમ વખત આવ્યો. તેણે તો ધામો નાખ્યો છે. ખૂબ બોલે છે. અવાજ મુદ્રિત કર્યો છે. વિદ્યાર્થીઓને નજીકથી બતાવ્યાનો અનેરો આનંદ થયો. બપૈયાનો પણ પ્રાર્થનાસભામાં પરિચય આપવામાં આવ્યો.

મારી ઈંગ્રેટ ઈકો કલબના વિદ્યાર્થીઓ પક્ષીઓમાં ખૂબ રસ લે છે. અઠવાડિયામાં એકાદ ઘાયલ પક્ષી કે બચ્ચું લાવે છે. શાળાનું પટાંગણ ખૂબ મોટું છે. શાળા ટેકરી પર છે. વિદ્યાર્થીઓ પક્ષીઓ માટે ચાણ પણ લાવે છે. ૫૦ વિદ્યાર્થીઓના વેર તોઈ એકાદ પક્ષીનો માળો અચૂક છે, જેની તેઓ જાણ કરે છે.

કોઈ વાર ‘વિહંગ’ મળતું નથી, કારણ કે તેનું મુખપૂષ્ટ ખૂબ સરસ હોય છે!

અશ્વિન રાજ્યગુરુ  
જ્ઞાનજ્યોતિ હાઇસ્ક્વુલ, મોટા આસરાણા, જિ. ભાવનગર



## બાળકો કણ-કણ બચાવી ચણ નાખે છે

વિહંગ તૈમાસિક નિયમિત મજાનો આનંદ થાય છે. આગળ-પાછળનાં બંને પૃષ્ઠો ઉપરનાં ભવ્ય ચિત્રો જોયા કરીએ તેવાં. દરેક અંકનાં આ પૂઠાં તો ખાસ સંઘરચા જેવાં છે. ‘વિહંગ’ના સતત ધોધમાર વાચનથી પક્ષીપ્રેમ ઊભરાયો છે. આ તો નાનીશી પ્રાથમિક શાળા છે, પણ શાળામાં જ ચબૂતરો બનાયો છે. નિવાસી શાળા હોઈ બાળકો રહે છે, જમે છે, ભાડે છે. વિચરતા સમુદ્દરનાં બાળકો, વહાલના દરિયા જેવી દીકરીઓ. આ ગરીબ, પછાત, ભોળાં, શ્યામળાં બાળકો કણ કણ બચાવીને ચણ નાખે છે. ટુકડો બચાવી પણુને ખવરાવે છે. અમારું બોરડીવાળું આખુંય જેતર પંખીઓ – જીવજંતુઓ માટે ખુલ્લું મૂક્યું છે. બોર માટે જંતુનાશક દવા છાંટતા નથી. વધુમાં શાળામાં વિશાળ પંખીવન ખડું કરવું છે. અમારી પાટણ કોલેજના જીવશાસ્ત્ર વિભાગના વડા ડૉ. કુમુદબહેન પટેલ પણ અમને ઉત્સાહ આપી રહ્યાં છે. ‘વિહંગે’ અમને હામ પૂરી પાડી છે.

શાંભુભાઈ યોગી

નવજીવન આશ્રમશાળા

રેલવે સ્ટેશન, મુ. મંસુર-૩૮૪૨૬૦, તા. પાટણ



## પક્ષીઓ સાથેનું અનુસંધાન

વિહંગમાં શ્રી પ્રશાંત દેસાઈનો લેખ વાંચીને આનંદ થયો. કિશોરાવસ્થામાં “આપણે આંગણે ઉડનારા” એ પુસ્તક (નિરંજનભાઈ વર્મા, જ્યમલ્લ પરમાર) વાંચીને પક્ષીઓમાં દીકરીક રસ પેદા થયો હતો પરંતુ પછી તો નાતો સાવ છૂટી ગયો.

મારી કિશોરાવસ્થામાં મારા વતન થાનગઢમાં રહેવાનું થયેલું. એ દિવસોમાં ગામમાં પાણીના નળ નહોતા અને પાણી દૂરથી લાવવું પડતું એટેલે કપડાં ધોવા બહેનો તળાવ પર જતી અને કપડા ધોતી. અમને બાળકોને સાથે લઈ જાય અને તેઓ જે કપડાં ધૂએ તે અમારે છીપર ઉપર સુકવવાનાં, આ કમ હતો. પરંતુ તળાવમાં અનેક જળજૂકડી જોવાનો લાભ અમને મળતો. (“સર્પશીવ” નામ તો પછી જાયું.) તે પાણીમાંથી ડેક

બહાર કાઢે, તેનું મોહું લયબદ્ધ રીતે ચાલતું જોઈએ ત્યાં તે દૂલકી મારે. અનુમાન કરીએ કે કયાંથી મોહું બહાર કાઢશે? પરંતુ આપણું અનુમાન હંમેશાં ખોટું પડે. તેને જોવામાં સમય ક્યાં જતો તે ખબર પડતી ન હતી.

શીઠોગ્રાહીના શોખને કારણે અનાયાસે ડો. આર. બી. બલર સાથે પરિચય થયો અને ફરીથી પક્ષીઓ સાથેનું અનુસંધાન થયું. જો કે, મારી આંગણોની તકલીફ અને ઉમરને કારણે પક્ષીઓના સૂક્ષ્મ ભેદ તેઓ જગ્ઘાવે તે મારી નજરે ચડતા નહોતા. પરંતુ, બલર સાહેબ, રેખાબહેન, લાલસિંહભાઈ સૌની સાથે અનેક વખત પક્ષીઓના શીટા પાડવા માટેનો અને તેમના વિશે જાણવાનો અનેરો લાભ મળેલો. આજે વહેલી સવારે કમ્પાઉન્ડમાં જે પક્ષીઓ જોવા મળે છે તેના વિશે મારા પૌત્ર-પૌત્રીઓને જાણતો હોઉં એટલું હોંશથી કહું છું.

કાળી કંકણસાર અંગે શ્રી નીરજભાઈ જોશીએ જગ્ઘાવ્યું તે સંદર્ભમાં ઉમેરો કરું. તા. ૧૪મી મે ૧૦ બુધવારે સવારે ‘કમ્પાઉન્ડ’માં ગયો ત્યારે ‘આઈબીસ’નો અવાજ સાંભળ્યો. ‘કમ્પાઉન્ડ’માં આવેલા ઊંચા લીમડાની ટોચ ઉપર ‘આઈબીસ’નું બરચ્યું જોયું. મારા પુત્ર, દર્શને પણ તેનો અવાજ સાંભળી અગાસીમાં જઈને જોયું તો ત્રણ હતા – બે પુખ્ત ઉમરના અને એક બરચ્યું. એણે તેના શીટા લીધા. આ લીમડાની ટોચ ઉપર સમીકીનો માળો હોય છે, પણ ત્યારે સમીકીનાં બરચ્યાં માળામાં ન હતાં. કાગડા ‘આઈબીસ’ને પજવતા હતા જેથી કરીને થોડી વાર પછી તે ઊડી ગઈ. રાતવાસો તેમજે લીમડા ઉપર જ કરેલો હશે. આજથી ત્રણ વર્ષ પહેલાં આ જ ઠેકાડો ત્રણ ‘આઈબીસ’ રાતવાસો કરતા હતાં.

દ્વિનુભાઈ દવે

૪૪, શારદાનગર સોસાયટી, પાલડી, અમદાવાદ-૭



## ખાબોચિયાંના પક્ષીઓ ‘વિહંગ’ની ચાદ અપાવી જાય છે

વર્ષમાં એક વાર તો આપને યાદ અચૂક કરીએ છીએ. ઘણાં બધાં કાર્યોમાં વ્યસ્ત રહેવાથી સમય ફણવી.

‘વિહંગ’ ઓકટોબર – ડિસેમ્બર ૨૦૧૦

શક્તાતો નથી પણ પક્ષીનિરીક્ષણનો શોખ છૂટ્યો તો નથી જ. હા, લખી મોકલી શક્તાતું નથી. હમણાં ભાવનગરમાં થોડા દિવસ પહેલાં ‘સાયન્સ સિટી’માં જવાનું થયું, અને બહાર રાજીપળાના પોપેટ (Alexandrian Parakeet)નો અવાજ સંભળાયો. વરસાદના વાતાવરણમાં હૈયડ (Oriental Magpie-Robin)નાં ગીતો સંભળાય અને ‘ક્યાં છે?’ શોધવાનું મન થઈ જાય. બહાર જોવા દોડી ગયા તો કાળિયો કોશી (Black Drongo) ઘણા સમયે જોયો. ખેરખંડો (Indian Treepie) તો અમારા ઘરનું કાયમી મહેમાન. હમણાં મેં એક પુસ્તક બહાર પાડ્યું છે. ‘Terminology for Biology Students.’ એ પુસ્તક સાયન્સ સિટીના સંચાલકોને ખૂબ પસંદ પડ્યું અને મને જૈવિકવૈવિધ્ય (Biodiversity) પર પુસ્તક લખવાનું આમંત્રણ મળી ગયું. આમ અમે જાણ્યેઅજાણ્યે સાયન્સ સિટી સાથે પણ જોડાઈ ગયા, એટલે કાર્યબોજ વધ્યો છે. પરંતુ ભાવનગર - બોટાઈ વચ્ચે દર શાની-રવિ પ્રવાસ થાય છે તે દરમિયાન, વચ્ચે આવતાં પાણીનાં ખાબોચિયાંમાં અનેક પક્ષીઓ જે હાલમાં આવી ગયાં છે, એ ‘વિહંગ’ની યાદ અચૂક અપાવી જાય છે.

ડૉ. કિંબાબા ગોડિલ

જવશાસ્ત્ર પ્રયોગશાળા, એમ. ડી. શાહ વિદ્યાલય  
પાણીયાદ રોડ, બોટાઈ-૩૬૪૭૧૦



“તમે જોડણીની વળી બીજુ ભૂલ  
કરી છે...”

‘વિહંગ’ નિયમિત મળે છે, એ બદલ આપનો અસીમ ઋણી છું. આખું જ ખૂબ રસપૂર્વક વાંચી જાઉં છું. ઘણું જ જાણવાનું માણવાનું મળે છે, ખૂબ આનંદ આવે છે. ધ્યાનવાદ!

દેખો તથા નિરીક્ષણનોંધો બહુ જ સરસ-સુંદર તથા સમૃદ્ધ અને સત્યદર્શક હોય છે. અભિનંદન! એમાંય છેલ્લો અંક તો સુસમૃદ્ધ છે. તમારા (સંપાદકીય આદિ), લાલસિંહજીના અને લવકુમાર ખાચરસાહેબના લેખો તો નેત્રદીપક, પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી

બાબતે જગૃતિ લાવનારા પણ અને માહિતીસભર તથા રસ-કુતૂહલ પ્રેરનારા સુંદર-સુસજ્જ આવે છે; જે વાંચીને ધન્ય થાઉં છું.

હું પણ પક્ષીનિરીક્ષક - વનસ્પતિનિરીક્ષક છું. (હવે કદાચ હતો.) હું પંચમહાલનાં જંગલો (આરિયા સ્ટેટ)માં જન્મેલો અને ઊછરેલો. પક્ષીઓ અને વનસ્પતિ સાથે તો અમારી આજનું દોસ્તી. બાળપણથી જ નિરીક્ષણ તથા સાંનિધ્યનો આનંદ માણસો રહેલો. હવે ખૂબ વૃદ્ધ (ઉ. ૮૮) થઈ ગયો છું. મુસાફરી કરી શકતો નથી; અરે બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ પડે છે. ઘરમાંથી થાય તેટલું નિરીક્ષણ કરું. અગાઉ એક એવો લેખ ‘કાનકડિયા’ નામક વિચિત્ર ‘પક્ષીઓ’ (?) વિશે, ‘વિહંગ’ને મોકલેલો, પણ છિપાયો નહીં. હું નિયમિત કટારલેખક (‘ગુજરાત મિત્ર’માં ‘રમણભ્રમણ’ કટાર) પણ છું. ક્યારેક મારી કટારમાં પણ પક્ષીઓ તથા વનસ્પતિ વિશે લખ્યું છું. આજકાલ ઉદ્ભવેલી ચકલીઓની ‘ંગી’ વિશે એક એવો લેખ લખેલો. એવી જ ચર્ચા એ પછીના ‘વિહંગ’માં જ આવેલી પણ ખરી; પરંતુ મારો કે મારી કટારનો એમાં ઉલ્લેખ નહોતો. આ ફરિયાદ નથી, પ્રીતિ, એવું ન સમજશો! (કદાચ યોગાનુયોગ પણ હોઈ શકે.) ચાલો, પુનઃ પુનઃ અભિનંદન તથા આભાર!

આપ સૌ ખૂબ જ મૂલ્યવાન તથા ઉપયોગી કાર્ય કરો છો, પણ એ પ્રત્યે હજુ સંબંધિતો તથા સત્તાધીશોનું ધ્યાન સક્રિય રીતે જતું નથી. ભયંકર કટોકટી સર્જાશી, ત્યારે કદાચ ભાન આવશે. પણ ત્યારે અતિમોદું થઈ ગયું હશે. (‘ડોડો’ પક્ષીના નિર્કંદન જેવું) ‘ઔષધયઃ શાંતિ: વનસ્પતયઃ શાંતિ:’નો પાઠ હવે તો યંત્રવત્ જ વાગોળનારા ભારતવાસીઓ વનસ્પતિ તથા પક્ષીઓની હસ્તી અને સલામતીનું મહત્વ ભૂલી ગયા છે, એ અત્યંત કરુણ કમનસીબી લેખાય. મેર! કુશળ હશો જ.

બીજું કે, તમે ‘ગ્રીઝ’ની જોડણીની ગતાંકમાં થયેલ ભૂલ બાબત ખેદ વ્યક્ત કર્યો છે, ક્ષમા માંગી છે, એ તમારી ઉદારતા તથા ભડત્તા બદલ આપને મારા હાઈક ધન્યવાદ તથા અભિનંદન! પરંતુ એ જ લેખમાં

તમે જોડણીની વળી બીજી ભૂલ કરી છે; 'પ્રસ્તુતિકરણ' નહીં, પણ 'પ્રસ્તુતીકરણ' એ સાચી જોડણી કહેવાય. આ સંસ્કૃત શબ્દ છે અને એને સંસ્કૃત જોડણીનો નિયમ લાગુ પડે. નિયમ છે; જેવું ન હોય એવા થાવું અથવા બનાવવું, તેને માટે બે સામાસિક શબ્દો છે; 'ભવન' અને 'કરણ'. આ શબ્દો જોડતાં પૂર્વ મૂળ નામ કે વિશેષણને દીર્ઘ 'ઈ' લગાડવાનો હોય છે; દા.ત. 'બાણીભવન' અને 'શુદ્ધીકરણ'. ભૂલ થવાનું કારણ એ છે કે, આવા સમાસમાં મૂળ શબ્દ 'પ્રસ્તુતિ', 'શુદ્ધિ', કે 'શક્તિ' છે. હકીકતમાં, મૂળ શબ્દો છે, 'પ્રસ્તુત', 'શુદ્ધ' અને 'સશક્ત' વગેરે. એથી, 'પ્રસ્તુત + દીર્ઘ ઈ + કરણ' એમ 'પ્રસ્તુતીકરણ' થાય. એ જ રીતે 'શુદ્ધીકરણ', 'સશક્તીકરણ' એમ થાય.

સંસ્કૃતમાં આવા રૂપાખ્યાનને 'ચ્વી' (ચ્ + વી) રૂપો કહે છે.

આવી ભૂલ ચીધવાની ધૂષ્ટતા બદલ અંતઃકરણ પૂર્વક તમારી ક્ષમા માગું છું. આપ ભાષાશુદ્ધિના આગ્રહી છો એમ પ્રતીત થયું, માટે જ આવી ધૂષ્ટતા આચરી, એટલી સ્પષ્ટતા. તમારી ભાષાશુદ્ધિની કાળજી બદલ તમને ખોબલે ખોબલે અભિનંદન પાઠવું છું.

તા.ક. (૧) 'બિનઉપસ્થિતિ' લખ્યું, એને બદલે 'અનુપસ્થિતિ' બહેતર ગણાય. (ઉર્દૂ અને સંસ્કૃતની વર્ણસંકરતા યાળી શકાય.)

(૨) એક 'ઉંઝ જોડણી'નું અભિયાન ચાલે છે, એ પ્રત્યે આપનું ધ્યાન જેંચવાની રજા લઇ છું.

પાઈક સાહેબ, આપે ભાષાની ભૂલો પ્રત્યે જે ધ્યાન દોર્યું છે તે ખૂબ જ આવકારદાયક છે અને તે બદલ હું આપનો આભારી છું. - સં.)

રમણ પાઈક (વાચસ્પતિ),  
અ-૪, નટરાજ એપાર્ટ., પારીદાર જન કોમ્પ્લેક્સ,  
સેશન માર્ગ, બારડોલી-૩૮૫૪૦૧

પક્ષીનો સુંદર ફોટો છે. આ પક્ષી આપણને કોઈ સંદેશ આપવા માગતું હોય તેવું જરૂર છે. સંપાદકીય લેખ હું અવશ્ય વાંચું છું. લેખકશ્રીની ભાષા, વિચાર પ્રેરણા આપે છે. આ લેખમાં માતૃભાષા પ્રત્યેની નિષ્ઠા મને ગમી. માનવી પોતાની માતૃભાષામાં પોતાની લાગણી-વિચાર અને સંવેદનાઓને સૌથી સારી રીતે અભિવ્યક્ત કરી શકે છે. 'ગીઝ' શબ્દની જોડણીમાં થયેલ ભૂલને હદ્યથી સ્વીકારીને સંપાદકશ્રીએ માતૃભાષાના ગૌરવને જાળવ્યું છે. માતૃભાષા પ્રત્યેના પૂજ્યભાવને અભિવ્યક્ત કર્યો છે. તેઓશ્રીના માતૃભાષા પ્રત્યેના પ્રેમને પ્રણામ. અન્ય લેખોમાં 'માણયું તેનું સ્મરણ'-૮ અને 'વિહંગાવલોકન' ખૂબ જ પ્રેરણાદાયી છે. 'વનવાસીની નજરે' શ્રી પ્રશાંતભાઈનો જીવંતલેખ ખૂબ ગમ્યો. વનવાસી શંકરની અનુભવજન્ય વાતો વિચારવા જેવી છે.

પટેલ અનિલભાઈ જે.

૨૬-બી, શાયોના સોસાયટી, દેંગેજ રોડ,  
મુ. પો. તા. કરી જિ. મહેસૂલા પીન-૩૮૨૭૧૫

## પાને પાને પક્ષીઓના કૂજનથી

### ચિત્ત પ્રસન્નાં...

'વિહંગ'ને પહેલા અંકથી અમારો પરિવાર જોતો આવ્યો છે. એનો રૂપેરંગે થયેલો આટલો વિકાસ ગુજરાતના પક્ષીપ્રેમીઓને તો છીદું શોધતાં લાધી પોળ જીવો છે. પાને પાને પક્ષીઓના કૂજનથી ચિત્ત પ્રસન્ન!

સૌ પ્રથમ તો 'વિહંગ'ના સંપાદક મંડળ અને મુદ્રકને આવું સામયિક ગુજરાતને આપવા માટે હાર્દિક ધન્યવાદ આપું છું. ગત અંકમાં પ્રશાંત દેસાઈની કલમે લખાયેલો 'વનવાસીની નજરે' લેખ અત્યંત સરસ. તમારી જોડણી વિષયક ચિંતા જોઈ ખરેખર માન થાય છે. એટલી ચિંતા તો સાહિત્યના સામયિકો પણ કરતા નથી હોતા.

વંદન સાથે.

ડૉ. ક્રિશોર વ્યાસ,  
પ્રિન્સિપાલ, કાલોલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ  
૬/બી, મહેતા સોસાયટી, કાલોલ (સંચમહાલ) ૩૮૮૮૩૩૦



## માતૃભાષામાં અભિવ્યક્તિની

### સરળતા રહે છે...

વર્ષ ૨૦૧૦ અંક મણ્યો. મુખપૃષ્ઠ પર 'નવરંગ'



## સૌરાષ્ટ્રમાં લડાખી ફૂટી

શ્રી પ્રસાદ ગણપુલેનો ‘શું લડાખી ફૂટી’ (Olivaceous Leaf Warbler) સૌરાષ્ટ્રમાં નિયમિત શિયાળુ મુલાકાતી છે?’ તે શીર્ષકનો લેખ ‘વિહંગ’ વર્ષ ૪, અંક ૩, જુલાઈ-સપેચ્બર ૨૦૧૦માં વાંચ્યો.

હિંગોળગઢમાં સ્વ. શિવરાજકુમાર ખાચરે આ ફૂટી જોયેલી અને તેની નોંધ પ્રસિદ્ધ થયેલી. શ્રી લવકુમાર ખાચર સાહેબ પણ હિંગોળગઢમાં આ પક્ષી અસામાન્ય પણ નિયમિત મુલાકાતી હોવાનું જણાવે છે (જે. બી. એન. એચ. એસ. વો. ૮૩ (૩૩) ડિસેમ્બર ૮૬ પાના નં. ૩૬૬). આમ આ પક્ષી સૌરાષ્ટ્રમાં નિયમિત શિયાળુ મુલાકાતી હોય તેમ લાગે છે.

## કચ્છમાં રણ ડબકચીડી અંગે સ્પષ્ટતા

‘વિહંગ’ વર્ષ ૪, અંક ૨ એપ્રિલ-જૂન ૨૦૧૦માં સ્વ. મ. કુ. શ્રી હિંમતસિંહજીનો “કચ્છમાં ઘાસિયા જમીનો” શીર્ષક હેઠળનો લેખ પ્રસિદ્ધ થયેલ છે.

આ લેખમાં સ્વ. શ્રી હિંમતસિંહજીએ રણ ડબકચીડી કચ્છના રણ વિસ્તારમાં હોવાનો ઉલ્લેખ કરેલ છે. તેઓ Greater Hoopoe-Larkના સંદર્ભમાં આ વાત કહેવા માંગે છે. કારણ કે, અગાઉ આ પક્ષીને Desert Lark પણ કહેવાતું (જુઓ ‘The Birds of Kutch’ by Salim Ali પાના નં. ૫૭). આમ, હાલનું Desert Finch-Lark, *Ammomanes deserti*ના સંદર્ભમાં તેઓ કહેતા હોય તેવું લાગતું નથી, કારણ કે આ પક્ષીની કચ્છમાં નોંધ થયાનું ક્યારેય પણ તેમની

કશ્યા (Cuckoo Shrike, *Campenhalagidae*) કુળનાં પક્ષીઓનાં ઈડાં આશા લીલા રંગનાં અને બદામી, રાખોડી કે જાંબલી ભાતવાળાં હોય છે. પણ જો આ ઈડાં તડકામાં ખુલ્લાં રલી જાય તો એમનો રંગ કાળો થઈ જાય છે.

પાસે સાંભળ્યું નથી અને મારા ખ્યાલમાં કોઈ સાહિત્યમાં પણ વાંચવામાં આવેલ નથી. રણ વિસ્તારમાં ખુલ્લા પટમાં વિષમ પરિસ્થિતિમાં રહેતું પક્ષી Greater Hoop-Lark જ હોય.

## શાંતિભાઈ વર્ઝ

જૂન વાસ, મંહિરવાળો ખાંચો, માધાપર, ભુજ-૩૮૦૦૨૦



## વિકાસનો દાનવ

‘વિહંગ’ જુલાઈ-સપેચ્બર ૨૦૧૦નું ‘નવરંગ’થી શોભતું મુખપૃષ્ઠ અત્યંત ચિત્તકર્ષક રહ્યું આ જ અંકમાં, અંતરના ઊડાણમાંથી ઉલેચીને લખાયેલી, વથાસભર ‘નળસરોવર ડાયરી’, અમારા જેવા દરેક પક્ષીપ્રેમીની લાગણી (કદાચ થોડાઘણા અંશે સુધૂપ્ત)ને વાચા આપી ગઈ. સાચે જ ‘નળ’ એકલું જ નહીં, ગુજરાતનાં લગભગ બધાં જ અગત્યનાં જળપાવિત ક્ષેત્રોની સામે ‘વિકાસ’ નામનો દાનવ તાંડવ કરી રહ્યો છે, ત્યારે પ્રવાસન ઉદ્યોગનું કદ વધારવા અને ગુજરાતને ‘બર્ડ વોર્ચિંગ ડેસ્ટિનેશન’ તરીકે ઉપસાવવાના પ્રયત્નોમાં, પંખીઓનું તો નિકદન નહીં નીકળી જાય તે ચિંતા સૌ પંખી-પ્રકૃતિપ્રેમીઓને કોરી ખાય તે સ્વાભાવિક છે. ગુજરાતને ‘પક્ષીનિરીક્ષણ ક્ષેત્ર’ તરીકે વૈશ્વિક પ્રસિદ્ધ મળે તે જરૂર આવકાર્ય છે, પરંતુ પ્રકૃતિ અને તેના અમુલ્ય ભજાના સમાં પંખીડાંઓના ભોગે તો નહીં જ.


## તરુણ જોધી

૬/૧, નિત્યાનંદ નગર, ટેલિફોન ભવનની સામે,  
પીજ રોડ, નડિયાદ-૩૮૭૦૦૨

ચેતપંખ જલમાંજાર (Pheasant-tailed Jacana)ની ઈડાં સેવવાની એક આગવી ખાસિયત છે.  
તેની માદા ઈડાં પાણીથી દૂર રહે તે શીતે દરેક પાંખની નીચે બે ઈડાં રાખીને તેને સેવે છે.

P

## યાયાવર-દર્શન કાર્યક્રમ



‘માઈગ્રન્ટ-વોચ પ્રોગ્રામ’ (Migrant-watch Programme), ઑંગસ્ટ ૨૦૦૭માં ‘ઇંડિયન બર્ડ્સ’ (Indian Birds) સામયિક તથા ‘નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સીઝ’ (NCBS), બેંગલોર દ્વારા ‘સિટીઝન સાયન્સ પ્રોગ્રામ’ (Citizen Science Programme) હેઠળ સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો હેતુ આબોહવામાં થતી ફેરફારોની યાયાવર પક્ષીઓના ઋતુપ્રવાસ પર થતી સંભાવિત અસરો જાણવાનો તેમજ યાયાવર પક્ષીઓનું આગમન, વિસ્તરણ અને વળતો પ્રવાસ વળેનો અભ્યાસ કરવાનો છે. પ્રથમ વર્ષમાં આ કાર્યક્રમમાં પ્રમાણમાં બાપક અને સહેલાઈથી જોવા મળતાં એવાં ૮ યાયાવર પક્ષીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. વર્ષ ૨૦૦૮માં આ સંખ્યા વધારીને કુલ ૩૦૦ યાયાવર પક્ષીઓને આવરી લેવાયાં. આ માટેની જરૂરી વિગતો સમગ્ર ભારતમાંથી ઘણા પક્ષીનિરીક્ષકો દ્વારા પૂરી પડાય છે. હાલમાં ભારતમાંથી કુલ ૧૦૦૦ કરતાં પણ વધારે પક્ષીનિરીક્ષકો તેમાં જોડાયા છે. ‘વિહુંગ’ના વાચકોને વિનંતી છે કે, આ કાર્યક્રમમાં જોડાઈને તેમનું યોગદાન આપે તથા જે નોંધ ‘માઈગ્રન્ટ વોચ’ને મોકલે તેની એક નકલ સાથે સાથે ‘વિહુંગ’ને પણ મોકલે. ‘યાયાવર-દર્શન’ કાર્યક્રમમાં કેવી રીતે જોડાઈ શકાય?

‘ઇન્ટરનેટ’ પર [www.migrantwatch.in](http://www.migrantwatch.in) ‘વેબસાઈટ’ પર ‘રજિસ્ટ્રેશન’ કરવીને કોઈ પણ પક્ષીનિરીક્ષક પોતાની નોંધ તેમાં ઉમેરી શકે છે. જો ‘ઇન્ટરનેટ’નો નિયમિત ઉપયોગ ન હોય તો, ‘વેબસાઈટ’ પરથી PDF ફોર્મ ‘ડાઉનલોડ’ કરી શકાય અને જરૂરી વિગતો ભરીને તેને ‘Citizen Science

Programme, National Centre for Biological Sciences, GKVK Campus, Bellary Road, Bangalore- 560065’ – સરનામે ટપાલ દ્વારા મોકલી શકાય. જે લોકો ઇન્ટરનેટનો બિલકુલ ઉપયોગ કરતા નથી તેઓ ઉપર્યુક્ત સરનામેથી ટપાલ દ્વારા પણ ફોર્મ મંગાવી શકે છે અને જરૂરી વિગતો ભરીને મોકલી શકે છે.

આ કાર્યક્રમ મુજબ યાયાવર પક્ષીઓના પ્રવાસની ઋતુ પહેલી જુલાઈથી શરૂ થઈ પછીના વર્ષની ત્રીસમી જૂને પૂરી થાય છે. પક્ષીનિરીક્ષક તેના વિસ્તારમાં જોવા મળતા કોઈ પણ યાયાવર પક્ષીની પ્રથમ નોંધ (first sighting), અંતિમ નોંધ (last sighting) અથવા સામાન્ય નોંધ (general sighting) ઉમેરી શકે છે; તેમની તસવીરો પણ મૂકી શકે છે. આ ઉપરાંત ચાતક (Pied Cuckoo)ની નોંધ ઉમેરવા માટે તેમાં ‘Pied Cuckoo Campaign’ નામથી અલગ વ્યવસ્થા છે.

**પ્રથમ નોંધ** – પહેલી જુલાઈ પછી કોઈ પણ યાયાવર પક્ષીને પ્રથમ વખત ક્યારે જોયું તે તારીખ, સ્થળ તથા પક્ષીની સંખ્યા.

**અંતિમ નોંધ** – ત્રીસ જૂન સુધીમાં કોઈ પણ યાયાવર પક્ષીને અંતિમ વખત ક્યારે જોયું તે તારીખ, સ્થળ તથા પક્ષીની સંખ્યા.

**સામાન્ય નોંધ** – યાયાવર પક્ષીની પ્રથમ નોંધ અને અંતિમ નોંધ સિવાયની કોઈ પણ નોંધ. આ ઉપરાંત અન્ય જરૂરી માહિતી ‘વેબસાઈટ’ પર ઉપલબ્ધ છે.

## યાચાવર-દર્શન કાર્યક્રમ

‘માઇગ્રન્ટ વોચ’માં વર્ષ ૨૦૦૮-૧૦માં વિવિધ યાચાવર બતકોની

ગુજરાતમાં સૌ પ્રથમ નોંધ અને સૌથી અંતિમ નોંધની યાદી:

પક્ષીનું નામ	પ્રથમ નોંધ (first sighting)				અંતિમ નોંધ (last sighting)			
	તારીખ	સ્થળ	સંખ્યા	પક્ષીનિરીક્ષક	તારીખ	સ્થળ	સંખ્યા	પક્ષીનિરીક્ષક
ગયશો (Northern Shoveller)	૧૪-૮-૦૮	ખીજડિયા પક્ષી અભયારણ્ય, જામનગર	૨	ડૉ. મૌલિક વરુ	૧૫-૫-૧૦	દાહેયાળી બંધ, બાંલભા પાસે	૩	ડૉ. મૌલિક વરુ
ચીંગપર (Northern Pintail)	૭-૧૦-૦૮	વિભાપર ગામ પાસે, જામનગર	૧૫	ડૉ. મૌલિક વરુ	૧૪-૪-૧૦	રણજિતસાગર બંધ, જામનગર	૨	ડૉ. મૌલિક વરુ
પ્રેયાસાડા (Eurasian Wigeon)	૮-૧૦-૦૮	ભગાડિયો ઠંડ, કરણી	૬	શાંતિલાલ વરુ	૧૫-૫-૧૦	દાહેયાળી બંધ, બાંલભા પાસે	૩	ડૉ. મૌલિક વરુ
મીલશીર (Mallard)	.....	.....	.....	.....	૧૭-૩-૧૦	લાંઘોટા તળાવ, જામનગર	૧	ડૉ. મૌલિક વરુ
રાખોડી કારચિયા (Common Pochard)	૨૩-૧૦-૦૮	ગીરણું ઝંગલ	૫	ડૉ. મૌલિક વરુ	૨૭-૨-૧૦	કુકમા તળાવ, કરણી	૧૪	શાંતિલાલ વરુ
ચોટીલી કારચિયા (Tufted Duck)	...	....	...	....	૩-૨-૧૦	ધારી ઠંડ, કરણી	૩	શાંતિલાલ વરુ
નાની મુરચાબી (Common Teal)	૨૩-૮-૦૮	રેલવે સ્ટેશન પાસે, જામનગર	૨	ડૉ. મૌલિક વરુ	૨૭-૩-૧૦	ઢીંઢા જળાશય, જામનગર	૧૦	ડૉ. મૌલિક વરુ
ચેતવા (Garganey)	૨૫-૮-૦૮	વિભાપર ગામ પાસે, જામનગર	૬	ડૉ. મૌલિક વરુ	૨૯-૪-૧૦	ધારી ઠંડ, કરણી	૫	શાંતિલાલ વરુ
સહેદ સુરખાબ (Common Shelduck)	૨૧-૧૧-૦૮	ભગાડિયો ઠંડ, કરણી	૨	શાંતિલાલ વરુ	....	....	....	....
બાક્ષણી બતક (Ruddy Shelduck)	૨૧-૧૧-૦૮	ખારાબેચાજા બંધ, જામનગર	૧	ડૉ. મૌલિક વરુ	૧૫-૫-૧૦	લિંડ-૧ બંધ, જામનગર	૨	ડૉ. મૌલિક વરુ
લુહાર (Gadwall)	૨૩-૧૦-૦૮	ગીરણું ઝંગલ	૨	ડૉ. મૌલિક વરુ	૨૭-૩-૧૦	ઢીંઢા જળાશય, જામનગર	૫	ડૉ. મૌલિક વરુ

સંકલન : ડૉ. મૌલિક વરુ, જામનગર

# સંચય

## ધોળી કંકણસાર : પ્રજનનગ્રહતુમાં

### વિચિત્ર લક્ષણો

પાન નં. ૨૦૬, જર્નલ ઓફ બી. એન. એચ. એસ.  
વોલ્યુમ ૧૦૬ (૨), ઓગસ્ટ, ૨૦૦૮

રાજેશ સેન્ના, ચિરાગ આચાર્ય

પ્રાણીશાસ્ત્ર વિભાગ, એમ. એન. કોલેજ  
વિસનગર-૩૮૪૩૧૫

૨૩ મે, '૦૮ના રોજ વિસનગરથી ૮ કિ.મી. ઉત્તરે પાલડી ગામની મુલાકાત વખતે ધોળી કંકણસાર (Oriental White Ibis)ની ત જોડી માળાની જગ્યા શોધતી નજરે પડી. નજીકથી જોતાં એક પક્ષીના ગળાની પાછળના ભાગાં લાલ રંગનું ધાંબું દેખાયું. ૨૮ મે '૦૮ના રોજ રાત્રીસણા ગામ પાસે ૪૪ ધોળી કંકણસારના ટેળામાંના એક પક્ષીમાં આવું જ ધાંબું દેખાયું. ૧૪મી જૂન '૦૮ના રોજ વિસનગરની સિવિલ હોસ્પિટલ પાસે બે પક્ષીઓમાં ગળાની પાછળ ઉપરાંત આંખ અને ચાંચની વચ્ચેના ભાગમાં (lores) તથા ગળા ઉપર છૂટાંછવાયાં લાલ ટપકાં દેખાયાં.

પ્રજનનગ્રહતુમાં અમે જે ઈ જોડીઓ જોઈ તેમાં ૧૭ પક્ષીઓને બોચી તથા તેની નીચેના ભાગમાં (mantle) અને ત પક્ષીઓને આંખની આગળ તથા ગળા પર છૂટાંછવાયાં લાલ ધાંબાં અને ટપકાં દેખાયાં. સાહિત્યમાં, ધોળી કંકણસારમાં પ્રજનનગ્રહતુમાં આ પ્રકારના કોઈ ફેરફારો વિષે જણાવેલું નથી.

### કચ્છમાં નીલવળી માખીમાર

પાન નં. ૨૦૮, જર્નલ ઓફ બી. એન. એચ. એસ.  
વોલ્યુમ ૧૦૬ (૨) ઓગસ્ટ ૨૦૦૮

જે. કે. તિવારી

સેન્ટર ફોર ડેઝર્ટ એન્ડ ઓસન, મોટી વિરાસી,  
તા. નભત્રાણા, કચ્છ-૩૭૦૦૬૬૫

૩૦ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ કચ્છના દક્ષિણ કંડે પિંગળેશ્વર મંદિર પાસેના ૨૦૦ ચો.મી.ના વૃક્ષાચાહિત વિસ્તારમાં પક્ષીનિરીક્ષણ કરતાં એક નીલવળી માખીમાર (Ultramarine Flycatcher, *Ficedula superciliaris*) જોવા મળ્યો.

અત્યાર સુધી આ પક્ષી ગુજરાતના અન્ય ભાગોમાં જોવા મળ્યું છે પણ કચ્છમાંથી નથી મળ્યું. ડૉ. બંકુલ ત્રિવેદીએ તેને જેસોર રીછ અભયારણ્ય (જિ. બનાસકંઠા) તથા પોળોનાં જંગલો (વિજ્યનગર પાસે, જિ. સાબરકંઠા)માં એકાધિક વાર નોંધ્યો છે. ડૉ. ભરત જેઠવાએ તેને ગાંધીનગરના ઈન્ડ્રોડા પાર્કમાં જોયો છે. (આ સિવાય રતનમાળ રીછ અભયારણ્ય જિ. પંચમહાલમાં પણ ત્રણ વર્ષ અગાઉ તેની નોંધ કરી છે. - સં.)

કચ્છમાં નીલવળી માખીમારની નોંધ એ નવો રૈક્રિક કષી શકાય.




ધાણાં લોક સુગંધવાળાં ફૂલને સાચાં અને સુગંધરહિત ફૂલને ખોટાં ફૂલ કહે છે. પણ પંખીઓને મન સાચાં ફૂલ એટલે મધુરસવાળાં ફૂલ જ હશે ને? પનરવાનાં સુગંધ વગરનાં ફૂલો પર તમે કોઈ વહેલી સવારે નજર નાખો તો પંખીઓના મધુપાનનો આનંદ તમને સાંભળવા મળે. આનંદ સાંભળી શકાય તેવો હોય છે, તેની આપણાને જાડા થાય. ઈન્દ્રિયોની મર્યાદા તૂટી જાય અને સાચાખોટાનાં આપણાં માપ કેવાં ખોટાં હોય છે તેની સારી ખબર પડે.

લેખક : કુન્દનિકા કાપડિયા

સૌજન્ય : ‘ચંદ્ર તારા વૃક્ષ વાદળ’


પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, ૧૯૮૮

## પંખી પંચાંગ



**નવેમ્બર :** દિવસો ઠીક ઠીક ટૂકા થઈ જાય છે. રાતની શીતળતા વધે છે. નભોમંડળમાં નક્ષત્રો ઝળણતાં દેખાય. બતકો અને કુજો મોટી સંખ્યામાં આવી જાય. દરિયાઈ પંખીઓથી કાદવિયા સાગરકિનારા જગતા થઈ જાય. સ્થાનિક પંખીઓ મૂંગાં રહે અને નવા આગાંતુકોની સાથે સહ-અસ્તિત્વ સ્વીકારી ચરે-ફરે. શિયા અને વાડો ફૂલકીઓથી ઉભરાય. તારનાં દોરડાં ઉપર તારોડિયા (Swallow) હારબંધ બેઠેલાં કે હવામાં ઝડપબેર ઉડતાં દેખાય.

**ઓક્ટોબર :** સવાર યાઢીબોળ. પવનની દિશા બદલાઈ વાયવ્યનો વાયરો શરૂ થાય. ઘાસ સુકાઈ જાય. બાકીનું વનસ્પતિ-જગત વસ્તંત્રજતુ આવતાં સુધી લાંબા આરામમાં પડી જાય. પણિક યાયાવરો લગભગ જતા રહ્યા છે. વધારે ને વધારે સંખ્યામાં આવતાં શિયાળું યાયાવરો તેમની જગ્યા લેવા માંડે છે. નવું પંખી જોવા મળી જાય એવી આશા આપનારો મહિનો. કોઈ અણધાર્યું પંખી ગમે ત્યારે નજરે ચડી પડા જાય.



**ડિસેમ્બર :** ઓતરાદો વાયરો જોરદાર થાય. શિયાળો આવી પહોંચે. સવારે ગરમ કપડાં પહેરવાં પડે. પોતાના નિવાસ વિસ્તારોમાં શિયાળું યાયાવરો ઠરીઠમ થતાં નિયમિત પક્ષીનિરીક્ષકની નજરે ચડ્યા કરે. માનવ-વર્ષ પૂરું થાય, પણ પંખીઓ માટે તો એ એક વિરામકાળ છે.

લવફુલ્લમાર ખાચર



સત્રચેરિક : માર્ગદરોગના

કુજ (Common Crane)

ઓક્ટોબરમાં ચોમાસુ પવનો કુંકાવાના બંધ થાય છે. રાત્રિ લંબાતી જાય છે. એક બાજુ ઝાકળભીની સવારમાં ઢીનો ચમકારો હોય છે તો બીજુ બાજુ બપોર, ગરમ અને ઉકળાટભરેલી હોય છે. આ રોગની ઝતુ છે અને એટલે જ આપણા પરંપરાગત આશીર્વાદમાં કહે છે, ‘શતમ્ જીવ શરદः’ અર્થात્ ‘સો શરદ જીવો.’ શરદ એટલે ચોમાસા તથા શિયાળાનો સંધિકાળ.

લીલાંધમ અને જીવજીતુથી સમૃધ્ય ગ્રામવિસ્તારો વિશાળ પક્ષીસમુદ્દ્રાઓને આકર્ષવા સજજ થઈ જાય છે. શિયાળુ મુલાકાતી યાયાવરોના આ જંગી સમૂહોમાં કેટલાંક આપણા વિસ્તારોમાંથી માત્ર પસાર થઈ આફિકા નથા દક્ષિણ ભારતના વધુ ઉષ્ણપ્રદેશો ભાડી પ્રયાણ કરે છે, જેને ‘ઝતુપ્રવાસી’ (passage migrant) કહે છે. ઓક્ટોબરના અંતસુધીમાં ઝતુપ્રવાસીઓ બધા ચાલ્યા ગયા હોય છે જીવારે જળાશયો અને તેમને ઘેરતાં ધાસ-ચિયા તથા અન્યત્ર ખીલેલાં ઝાડ-પાન શિયાળુ મુલાકાતી પંખીઓની વધી જતી સંખ્યા અને વૈવિધ્યથી વિશેષ જીવંત બનવા લાગે છે.

લણાયેલાં ખેતરો અને ગોચરોમાં પિંડા, ધાનચીડીઓ તથા ચંડૂલો એકત્ર થવા લાગે છે, તો સ્વચ્છ આકાશ કુજ-કરકરાની હારો અને ચકરાવા લેતાં શિકારી પક્ષીઓથી આભૂષિત થવા માંડે છે. નવે-ડિસે. માં ઉત્તર-પૂર્વ ચોમાસાના જોરદાર સૂક્કા-ઢંડા પવનોથી ચોમાસુ-વનસ્પતિ તથા પણ્ણવાળાં વૃક્ષોનાં પાન કરમાવા લાગે છે.

- લવકુમાર ખાચર

**Our new logo reflects our commitment  
towards preserving nature's  
priceless treasures always.**



Regd. Off. : 2, Shantisadan Society, Nr. Parimal Garden, Ellisbridge, Ahmedabad 380 006. Tel: +91-79-26462980, 26460095. Website : [www.gujaratgas.com](http://www.gujaratgas.com)

VIHANG (Quarterly) Oct.-Dec. 2010  
RNI No. GUJGUJ/2007/20874 Dt. 21-8-07  
Posted at Ahd. P.S.O. on 5th of Jan., Apr., July, Oct.



જાયશો (Northern Shoveller), તસવીર : મનોજ ધોળકિયા

ISO 9001 : 2000 Certified



**REG OFFICE :** "SIHL HOUSE" Opp. Ambawadi Jain Temple,  
Nehrunagar Cross Road, Ahmedabad. 380 015.  
Ph : +91 79 3002 5325, Fax : +91 79 3002 9029  
E-mail: [info@sihl.in](mailto:info@sihl.in), Website: [www.sihl.in](http://www.sihl.in)